

Date of Publication 10th Posted on Every Month

દિન: ૨૦૧૪

વર્ષ: ૮, અંક: ૧૨

૩. ૩૦



ગુજરાતી મન્ત્ર: | (અધ્યવિદેશ)

ગુજરાતી પ્રધા | (અધ્યવિદેશ)

પરબ

તત્ત્વ: વોગેશ જોધ્થી



સમાનો મન્ત્ર: (ક્રીએટ)

સમાની પ્રપા (અથર્વેદ)

પરબ

સ્થાપના વર્ષ: ૧૯૬૦

વર્ષ: ૮

જૂન: ૨૦૧૪

અંક: ૧૨

પરામર્શનસમિતિ

ધીરુ પરીખ
પ્રમુખ

રત્નિલાલ બોરીસાગર
મધ્યસ્થ સમિતિના સભ્ય

ઉષા ઉપાધ્યાય
પ્રકાશનમંત્રી

તંત્રી
યોગેશ જોધી



ગુજરાતી સાહિત્ય પરિષદ

મેધાશી શાનપીઠ .૦૦ ક. લા. સ્વાધ્યાયમંદિર

ગુજરાતી સાહિત્ય પરિષદ (પ્રકાશન વિભાગ), ગોવર્ધનભવન,

ગુજરાતી સાહિત્ય પરિષદ માર્ગ, આશ્રમ માર્ગ, નદીકિનારે, અમદાવાદ-૩૮૦ ૦૦૮
પરબ ૧૫૭૫૦ જૂન, ૨૦૧૪ ફોન: ૨૬૫૮૭૮૪૭

પરબ

ગુજરાતી સાહિત્ય પરિષદના સત્યપદ અને ‘પરબ’ના લવાજમ અંગે :

^૧ ૧૫૭૫૦‘પરબ’ દર મહિનાની દસમી તારીખે પ્રકાશિત થાય છે.

^૧ ૧૫૭૫૦પરબ’ના ગ્રાહક તથા પરિષદના સત્ય વર્ષમાં ગમે ત્યારે થઈ શકાય છે.

^૧ ૧૫૭૫૦પરબ’નું વાર્ષિક લવાજમ રૂ. ૧૫૦ છે.

^૧ ૧૫૭૫૦વિદ્યાર્થીઓ માટે ‘પરબ’નું વાર્ષિક લવાજમ રૂ. ૭૫ છે. સાથે પ્રમાણપત્ર બીડવું.

^૧ ૧૫૭૫૦ગુજરાતી સાહિત્ય પરિષદના વાર્ષિક તેમજ આજીવન સત્યપદના શુલ્કમાં ‘પરબ’ના લવાજમનો સમાવેશ થઈ જાય છે.

^૧ ૧૫૭૫૦પરિષદના વાર્ષિક વ્યક્તિગત સત્યપદનું શુલ્ક રૂ. ૨૦૦ તથા સંસ્થાગત સત્યપદનું શુલ્ક રૂ. ૩૦૦ છે.

^૧ ૧૫૭૫૦પરિષદના આજીવન સત્યપદનું શુલ્ક રૂ. ૨,૦૦૦ છે તથા સંસ્થા આજીવન સત્ય ફી રૂ. ૩,૦૦૦ છે. (વિદેશસારીઓ માટે ૭૫ પાઉન્ડ અથવા ૧૩૦ ડોલર.)

^૧ ૧૫૭૫૦પરબ’ લવાજમ તથા પરિષદ સત્યપદ શુલ્કની રકમ મનીઓર્ડર અથવા ડિમાન્ડ ડ્રાફ્ટથી ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના નામે જ મોકલવી.

લેખકોને :

^૧ ૧૫૭૫૦પરબ’માં પ્રગટ થતાં લખાણોમાંના વિચાર-અભિપ્રાયની જવાબદારી જે તે લેખકની રહે છે.

^૧ ૧૫૭૫૦લેખકોએ પોતાનું લખાણ ફૂલ્સકેપ અથવા ડાચ સાઈજના કાગળની એક બાજુએ, સુવાચ્ય અક્ષરે લખી મોકલવું. પોસ્ટકાર્ડ, ઈન્લેન્ડ કે ચબરખીઓમાં ફૂતિ મોકલવી નહીં. પ્રત્યેક ફૂતિ નીચે પૂરું સરનામું લખવું તથા એક નકલ પોતાની પાસે રાખીને જ ફૂતિઓ મોકલવા વિનંતી.

^૧ ૧૫૭૫૦લીકૃત ફૂતિની જાણ કરાશે. ટાલન-ટિકિટે ચોંટાડેલું કવર મોકલ્યું હશે તો અસ્વીકૃત ફૂતિ પરત કરવામાં આવશે, અન્યથા ફૂતિ અસ્વીકૃત ગણવી. પોસ્ટકાર્ડ મોકલ્યું હશે તો અસ્વીકૃતિની જાણ કરાશે.

^૧ ૧૫૭૫૦મત્રવ્યવહારનું સરનામું : તંત્રી, ‘પરબ’, ગુજરાતી સાહિત્ય પરિષદ (પ્રકાશન વિભાગ), ગોવર્ધનભવન, આશ્રમમાર્ગ, ‘થાઈમ્સ’ પાઠ્ય, નાદીકિનારે, પો.બો. ૪૦૬૦, અમદાવાદ ૩૮૦૦૦૮

E-mail : gspamd@vsnl.net

ફોન અને ફેક્સ : ૨૬૫૮૭૮૪૭

Web-site : www.gujaratatisahityaparishad.org

www.gujaratatisahityaparishad.com

ISSNO250-9747 પરબ

છૂટક ક્રિ. રૂ. ૨૦/-

માલિક : ગુજરાતી સાહિત્ય પરિષદ વતી મુદ્રક અને પ્રકાશક : ઉભા ઉપાધ્યાય (પ્રકાશનમંડી), ગોવર્ધનભવન, આશ્રમમાર્ગ, ગુજરાતી સાહિત્ય પરિષદ માર્ગ, અમદાવાદ ૩૮૦૦૦૮ □ તંત્રી : યોગેશ જોધી □ મુદ્રાશસ્ત્રાન : શૈરાદ મુદ્રાશસ્ત્રાલય, ૨૦૧, તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ ૪૪૦૦૧૫ રિઝિટ્યુન્ટ ફોર્મ જીએચફેર્નીલીલી

આ નું કુમાર

પ્રમુખપદેથી : સાહિત્ય અને ભાષા, ધીરુ પરીખ ૬

કવિતા : વેચતો નથી, ભગવતીકુમાર શર્મા 12, આણ નથી, ભગવતીકુમાર શર્મા 12, કાળો ચિરાયુ, શંભુપસાદ જોશી 13, ગીત, હરીશ મીનાશ્રી 14, ફંટા, સંસ્કૃતિરાણી દેસાઈ 15, હું ને અહુમ્મ બેઠા, લવિત ત્રિવેદી 16, શરૂઆત દીવા જેવી, લવિત ત્રિવેદી 16, મોભમ ઉભો છે, વિનોદ ગાંધી 17, હાઈકુ, રમેશ પટેલ 17

વાર્તા : બાના બાપા, સુરેશ ઓઝા 18

ધ્રુવનિંદોદ : ચશ્માં વિનાનો એક છિવસ, કિશોર વ્યાસ 27

બે કાવ્યો : પ્રજનાથ રથ; અનુ. રેણુકા શ્રીરામ સોની 30

આસ્વાદ : શ્રી ધીરેન્દ્ર મહેતાની લઘુનવલ રવજ માસ્તરનું મૃત્યુ, લાભશંકર ઠક્કર 33

અભ્યાસ : ‘સંભારકાંની સફર’, દક્ષા વિ. પણ્ણશી 35, ‘નૂરી’ની ગાંલસૃષ્ટિ, ડૉ. એસ. એસ. રાહી 39, મહાન સાહિત્યકારોની શોધમાં : નોબેલ પારિપોષિક-વિજેતાઓ પર એક અભ્યાસ ભાગ-2, પ્રદીપ ખાંડવાળા 44, અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં લઘુશોકોર્મિકાવ્યો, ડૉ. વિરંગિ ત્રિવેદી 49

સમીક્ષા/ગ્રંથાવલોકન : ‘ગિરનાર સાદ પાડે છે’ : બે અનેરાં દીર્ઘકાવ્યો, બિપિન આશર 61, લોહીનીગળતી પાંજે, રજનીકુમાર પંડ્યા 68, શયામ બેનેગલનો સર્વાગ પરિચય આપવામાં નિષ્ફળ રહેલી પરિચયપુસ્તિકા, અભિજિત વ્યાસ 73

આપણી વાત : સંકલન : પ્રકૃત્લ રાવલ 76

આસ્વાદનોંધ

આવરણાચિત્ર : પીયુષ ઠક્કર 83

પત્રસેતુ : મધુસૂદન કાપડિયા 85

પરબ્રહ્માંકાંક્ષા, બેણજીએ : સંકલન : પ્રકૃત્લ. રાવલ. 74

ભાષા, પછી તે લખાતી કે બોલાતી, વગર સાહિત્ય સંભવિત નથી તે આતિ જૂની અને જાણીતી વાત છે. તો પ્રશ્ન થાય કે એના વિષે અહીં વાત કરવાનો શો અર્થ. વાત સાચી છે : શો અર્થ ? પણ અર્થ છે એટલે તો આ વિષય પરસંદ કર્યો છે.

જ્યારે લિખિત કે બોલાતી ભાષામાં સાહિત્ય આવે છે ત્યારે તેમાં જો સર્જકતા કે સર્જન હોવાની કળા ના ભણે તો તે કેવળ ભાષાકીય ભૂગણું બની જાય છે. ભાષા આ રીતે સાહિત્યસર્જનનું સાધન છે. પણ એ સાધન હોવાથી અભ્ય મહત્તા ધરાવતું નથી બલકે આતિ મહત્તા ધરાવે છે. જે રીતે ભાષાને સર્જનાત્મકતાના સ્તરે પહોંચાડવામાં આવે છે તેને કારણે જ તેના દ્વારા સાહિત્ય નિર્ભિત થાય છે.

આમ, સાહિત્યસર્જકને માટે ભાષા અતિમહત્વનું ઉપકરણ બને છે. ભાષા શુદ્ધ અને ભાષા અશુદ્ધ એ વળી બીજો પ્રશ્ન છે. બાર ગાઉંએ બોલી બદલાય તે કહેતી પ્રમાણે ભાષાનાં ઉચ્ચારણો અને તે ઉચ્ચારણો પ્રમાણે વિષયાંતર પણ એક સાર્વનિક અને સર્વકાલીન ઘટના છે.

એક કાળે એવી વાત ઊભી થઈ હતી કે સાહિત્યકૃતિમાં ભાષા અમુકતમુક કક્ષાની જ જોઈએ. પણ ગાંધીયુગના આગમન સાથે આ વિચારસરળીમાં બદલાવ આવે છે અને સાહિત્યની ભાષાનો પઠ વિશાળ બને છે. માનવના અંગત ભાવો અને તેની અંગત ઊર્ભિઓ ઉપરાંત પરલક્ષિતા પણ વધુ તીવ્ર બને છે. આથી તે સમયના વાતાવરણ અને પ્રવૃત્તિઓને અનુલક્ષિને લખાતાં લખાણોમાં તત્કાલીન ભાષાપુટ મહત્વનો બની જાય છે. તે વખતે પ્રભાતકેરીમાં ગવાતા એક ગીતમાં ધ્રુવપંજિ આવતી હતી કે -

‘ધોળી દોપીવાળાનાં દોળાં ઊરથ્યા’

આમ તો ‘થાણું’ શબ્દ અવ્યવસ્થિત માનવસમુદ્રાય માટે વપરાતો શબ્દ છે. પણ ભારતની સ્વતંત્રતાની ચળવણમાં ગાંધીવિચારધારાથી પ્રભાવિત સ્વાતંત્ર્યસૈનિકો સમૂહમાં સરધસ રૂપે નીકળતાં તેને અહીં બહુવચનમાં ‘દોળાં’ કહી નવાજવાની ભાવના છે. ગાંધીજીએ ‘સ્વદેશીવત’ વિશે લખતાં કહ્યું છે :

‘સ્વદેશીવત આ યુગણું મહાવત છે. જે વસ્તુ આત્માનો ધર્મ છે પણ અજ્ઞાનને કે બીજે કારણે આત્માને જેણું ભાન નથી રહ્યું તેના પાલનને સારુ ક્રત લેવાની જરૂર પડે છે. જે સ્વભાવે નિરામિષાહારી છે તેને આમિષાહાર ન કરવાનું ક્રત લેવાપણું ન હોય. આમિષ તેને સારું પ્રલોભન નથી, એટલું જ નહિ, પણ આમિષ જોતાં તેને ઓકારી આવશે.’

આહી જોઈ શકાશે કે ગાંધીજીએ સ્વદેશીને એક વ્રત ગણાવી તેનો તે કાળસંદર્ભે મહિમા કર્યો છે. વળી, પોતાની આખી વાત થોડા જ શબ્દોમાં તર્કબદ્ધ રીતે કોઈ વકીલની જેમ મૂકી આપી છે. અને અંતિમ વાક્યમાં ‘ઓકારી’ જેવો જનસામાન્યમાં વપરાતો અને ઊલટી કરતી વખતે એમાં ભગતો અવાજ પણ સૂચ્યવતો શબ્દ વાપર્યો છે. આમ, ભાષા સાહિત્યમાં સક્રિય બને છે ત્યારે તેનો સર્જક પોતાના વિચાર-ભાવોને પોતાને હાથવગા શબ્દોમાં સચ્ચોટ રૂપે મૂકવાનો પુરુષાર્થ કરતો હોય છે.

વળી આપણને જે કંઈ કામ કરવા માટે પૃથ્વી પર જેણે પણ મોકલ્યા હશે તેણે તે કામ પૂરું પાડવાની પણ અપેક્ષા રાખી હશે. આવી પણ એક તત્ત્વ-વિચારણા છે. ઈ.સ. પૂર્વે પાંચમી સદ્દીમાં થઈ ગયેલા એથેન્સના રાજપુરુષ પેરિકલીસ (Pericles) કહે છે :

‘Your great glory is
not to be inferior to
what God has made you.’
(‘પ્રભુએ તમને જે કારણે
નિરભ્યા છે તેથી ઊંઘા ન ઉત્તરવામાં
તમારી મોટી નામના રહેલી છે.’)

એક તત્ત્વજ્ઞ રાજકારણી આ રીતે મનુષ્યને માટે નક્કી થયેલી ફરજ બજાવવાનો અહીં કાબ્યપુરુષાર્થ કરે છે. સાદીસીધી ભાષા પણ અહીં સાહિત્યના સર્જનમાં ઊંઘી ઉત્તરતી લાગશે નહીં.

તો વળી સ્પેનના બે મહાન કવિઓ વાન રામો થીમેનેઝ (જન્મ ઈ.સ. ૧૮૮૧) અને ફેરિન્ઝો ગાર્સિયા લોર્કી (જન્મ ઈ.સ. ૧૮૮૮) પછી ત્યાં નામના મેળવનાર કવિ યોર્જ ઝીલેન (Jorge Guileen) સ્પેનના આંતરવિગ્રહ વખતે દેશ છોડી અમેરિકા જઈને વસે છે. ત્યાંના વિશ્વવિદ્યાલયોમાં તેણે સ્પેનિશનું અધ્યાપનકાર્ય કર્યું. એણે ૧૯૫૭-૫૮ દરમિયાન હાર્વર્ડ યુનિવર્સિટીમાં સ્પેનિશ કવિઓની કવિતા પર વ્યાખ્યાનો આપ્યાં હતાં તેમાં તેનો મુખ્ય મુદ્રા કવિતાની ભાષાનો હતો. તેમનાં આ વ્યાખ્યાનો ૧૯૬૧માં ‘Language and Poetry’ શીર્ષકથી ગ્રંથાકાર પામ્યાં હતાં. ત્યાર પછી માર્કિના તે કાળના સહુ નામાંકિત કવિઓનું એક મંડળ રચાયું અને તેમણે જુદા જ પ્રકારની કવિતા સર્જવા માંડી. આ કવિજીથનું માનવું હતું કે કવિતા રહસ્યમય સર્જનની સાથે સાથે સભાન કળા પણ છે. કવિતાની વાણી પ્રત્યેક કવિની મૌલિક હોય છે એવી સ્પષ્ટ અને સ્વસ્થ એમની ધારણા હતી. યોર્જ ઝીલેનો તેમની વાંબા ગાળાની કવિતારચના એક જ સંગ્રહમાં સંગ્રહાઈ છે, જેનું નામ છે ‘Cantilo’ (કેન્ટિલો). તેની સંવર્ધિત આવૃત્તિ

થતી રહી. આપણા માતબર કવિ કાન્તની જેમ તે એક જ કાવ્યસંગ્રહના કવિ છે !

ત્યાંના ભૌગોલિક સાથે સાથે રાજકીય અંધકાર અને તત્કાલીન અંધારુંધીનો એને જાતપરિચય છે અને એટલે જ એ એક જગ્યાએ કહે છે : ‘My certainty is founded in the dark’ (મારી શ્રદ્ધાનાં મૂળિયાં તિમિરમાં રોપાયેલાં છે.) અહીં એક પણ શબ્દ નવો નથી, પણ એમાં જે કવિશ્રદ્ધાની સ્થાપના ક્યાં છે તે આબાદ રીતે પ્રકટ કરવામાં આવી છે. અને પછી એક કાવ્યમાં લખે છે :

‘I, here, now,

Wide awake, existing here and now,

Once again, marvelous adjustment.’

(અહીં અને અત્યારે હું,

સંપૂર્ણ જાગૃત, અહીં જ અત્યારે અસ્તિત્વવાળો,

ફરી વાર, અદ્ભુત સુસેળ.)

કવિ પોતાના વિચારો આ રીતે શબ્દબદ્ધ કરીને કાવ્યાન્તે કહે છે :

‘More, more and yet more !

Towards the sun, in swift flight,

The fullness makes its escape,

Now I am only song !’

(વધુ, વધુ અને હજ વધુ !

સૂર્યના તેજ પ્રતિ ઝડપી ગતિ

પૂર્ણતા સરકતી ગઈ,

હવે તો હું કેવળ ગીત !)

આપણો ત્યાં કબીરે આ અલૌકિક તેજનો મહિમા કર્યો છે. એક સાખીમાં કબીર કહે છે :

‘કબીર તેજ અનંત કા, માનો ઊગી સૂરજ સેષી,

પતિ ચંગી જાગી સુંદરી, કૈતિગ દીઢા તેણી’

(કબીર કહે છે કે અનંતનું તેજ (પરમાત્માનો પ્રકાશ) એ એકસાથે અનેક સૂર્યોના ઉદ્ય સમાન છે; પણ આ પ્રકાશ, આ કૌતુક, નિહાળી શકે છે.)

આમ તો આ શુંગારની ભાષા છે. અહીં પતિ એ પરમેશ્વર છે અને તેની સાથે શયન કરનાર પત્ની એ આત્મયોગી છે. આ આત્મયોગી પરમાત્મા સાથે સદા સંલગ્ન હોય છે અને તેની જાગૃતિ એટલે કે આધ્યાત્મિક સમજનો ઉંઘાડ તેને અનેકાનેક સૂર્યોનો પ્રકાશ નિહાળવાનું કૌતુક અનુભવાવી શકે છે. જાગ્રત આત્મા જ પરમાત્માને પામી

શકે છે એવી સાદીસીધી વાત કબીરે અહીં અલંકારની યોજના દ્વારા ભાષાના સમુચ્ચિત ઉપયોગથી સાહિત્યિક રચના દ્વારા સિદ્ધ કરી બતાવી છે.

કબીર જુલાલ એટલે કે વણકર હતા. સાચો શબ્દસિદ્ધ કવિ પોતાની ભાષાશુદ્ધિનો કાવ્ય-વ્યાપારમાં કેવો સમુચ્ચિત ઉપયોગ કરી જાણે છે તે કબીરના ‘ઝીની ઝીની બીની ચદરિયાં’ પદમાંથી પામી શકાય છે. એ વણકર હોઈ વણાતી ચાદરનું ઉપમાન લઈ ગાય છે :

“ઝીની ઝીની બીની ચદરિયાં”

* * * * *

જો ચાદર સુર નર મુનિ ઓછે ઓછ કે મેલી કિની ચદરિયાં,
દાસ કબીર જતન સે ઓઢી, જ્યો કિ ત્યો ધર દીની ચદરિયાં.”

વણકરે ચાદર તો સરસ બારીક વળી છે. પણ એ ચાદરને દેવ-માનવ-મુનિ સહુ ઓઢીને મેલી કરી નાખે છે. અહીં ચાદર એ સ્વયં જીવન છે. એને ધારણ કરનાર અશાની લોક જીવનને કલુષિત કરી નાખે છે. શાસ અને ઉચ્છ્વાસના તાણાવાણાથી આ જીવનરૂપી ચાદર વણાય છે એવો સરસ ભાષાપ્રયોગ કબીરે કરીને કાવ્યાન્તે જણાવ્યું છે કે ‘જ્યો કિ ત્યો ધર દીની ચદરિયાં’. પ્રભુએ જેવું શુદ્ધ જીવન આખ્યું છે તેવી શુદ્ધતાથી જીવીને જીવનાન્તે પ્રભુને સમર્પિત થઈ જવાનું છે. આવી જીવનલક્ષી અધ્યાત્મવાદી વાત કબીરે પોતાના વ્યવસાયની ભાષામાં કરી છે.

આપણા કવિ સુન્દરમુલુંધર હતા. તેમણે ‘ઘણ ઉઠાવ’ કાવ્યમાં કહ્યું છે : ‘ઘણ ઉઠાવ મારી ભુજા’. શા માટે ? લોખંડ તો એના અસલ રૂપમાં ઘાટઘૂર વગરના પતરા કે ગણ્ણ જેવું હોય છે. લુંધર તેને તપાવીને ઘણથી ટીપીટીપીને ધાર્યો ઘાટ આપે છે. આપણે જોઈશું કે અહીં પણ કવિએ સુન્દર કાવ્યકૃતિના સર્જનમાં વ્યાવસાયિક ભાષાનો ઉપયોગ કર્યો છે.

તો વળી સાહિત્યના પ્રવાહમાં ઊઠેલી નવી લહરો જોઈશું તોપણ ભાષાનો જુદી રીતે ઉપયોગ થયેલો જણારો. આપોલીનેરની કવિતામાં કે આપણે ત્યાં ગુલામ મોહમ્મદ શેખની કવિતામાં કયારેક ભાષા ચિત્રકલાસમ બની જતી હોય છે. આમાં શબ્દોને કાવ્યમાના અર્થ પ્રમાણે ચિત્રાત્મક રીતે ગોઈવીને એક પ્રકારની આફૃતિ આંખ સામે ઊભી કરવાનો ભાષાપુરુષાર્થ હોય છે. અમેરિકન હબસીનું એક કાવ્ય છે. ‘Blues’, એમાં માત્ર એક ‘Love’ શબ્દને એવી રીતે મુદ્રિત કરીને મૂક્યો છે કે તમે એનું ડાખેથી જમણો, જમણેથી ડાખે, ઉપરની નીચે કે નીચેથી ઉપર વાચન કરી શકો. આ પણ કાવ્યસર્જનમાં ભાષાની પ્રયુક્તિનો એક નમૂનો ગણી શકાય :

L
 O
 L O V E
 E V O L
 V
 O
 L

અહીં ચિત્રાત્મકતાના આશ્રય સાથે કાવ્ય ચારે તરફથી પ્રેમના અર્થ-આશયને
 પણ સ્કુટ કરે છે. આ રીતે અક્ષર-શબ્દની ગોઈવજથી રજૂ કરાતું કાગળ પરનું આ
 કાવ્ય ચિત્રસ્વરૂપ અને ત્યારપદી એ એક જ શબ્દના અર્થો ચિત્તને ચોતરફથી ધેરીને
 એક પ્રકારનો તનાવ ઉભો કરવો એવી ભાષાકીય પ્રયુક્તિ કવિનો અહીં બાબ્ય તેમજ
 અંતિમ આશ્રય જણાય છે.

આપજા ગુજરાતી કવિ યોસેફ મેકવાનની પણ આવી એક પ્રયોગાત્મક કાવ્યરચના
 'કવિલોક'ના ૧૯૭૮માં પ્રકટ થયેલા 'પ્રયોગ વિશેખાંક'માં જોવા મળે છે. એનો એક
 અંશ અહીં કાવ્યમાં ભાષાકીય પ્રયુક્તિના નમૂના તરીકે રજૂ કરું છું :

મિ
 લ
 ચી
 મ
 ની
 ઓ

ચિત્કારે છે સવારે સવારે

મિ
 લ મિ
 ચી લ
 મ ચી
 ની મ

ઓ આભની ભીની આંખોને છંટકારે
 ઓ ચંદ્ર મહીં લબકારે...

પ્રસ્તુત કાવ્યખંડમાં 'મિલચીમનીઓ'ની દશ્ય ચિત્રાત્મકતાની સાથે સાથે અર્થ-
 સંકુલતા પણ ભળેલી છે. અહીં કુલ ત્રણ પંક્તિઓ છે :

૧. મિલચીમનીઓ ચિત્કારે છે સવારે સવારે
 ૨. મિલચીમનીઓ આભની ભીની અંખોને છંટકારે
 ૩. મિલચીમનીઓ ચંદ મહીં લબકારે...
- આ ત્રણ પંક્તિઓને ઊભી અને આડી ગોઠવીને યંત્રસંસ્કૃતિએ ઊભી કરેલી સંકુલતાને કવિએ દશ્યસંવિધાનથી અભિવ્યક્ત કરી છે.
- આ રીતે સર્જનમાત્રમાં ભાષા અવનવીન રીતે ગોઠવાઈ-સંયોજાઈ એ કૃતિને સર્જનપત્મકતા બદ્ધે છે.

વેચતો નથી | ભગવતીકુમાર શાર્મા

જઈને બજારે મારી કલા વેચતો નથી;
સંભળાવું છું બધાંને, કથા વેચતો નથી.
મારો જ હક ઉદાસી ને આશા ઉપર સાઠા;
સંધ્યા ન વેચું છું, હું ઉષા વેચતો નથી..
સાચા હદ્યની પ્રાર્થના એને પરસંદ છે;
ઈશ્વર દુકાન માંડી દયા વેચતો નથી.
નિઃસ્વાર્થભાવે સર્વ સમર્પિત કર્યા કરે;
શ્રેષ્ઠાણું છે એ સાચો, દુઆ વેચતો નથી.
પોતાના ન્યાયને એ બદલશે નહીં કદી;
યમરાજ માનવીને ચિત્તા વેચતો નથી..
સાચો અલેદમાર્ગ છે વરસે છે બધી;
આકાશી દેવ ઈન્દ્ર ઘટા વેચતો નથી.
સર્વાધિકાર મારો છે, મરજી મુજબ કરું;
વહેંચું છું સુખ બધાંને, વ્યથા વેચતો નથી..

આજા નથી | ભગવતીકુમાર શાર્મા

નિશાન તાકવા જોકે કોઈની આજા નથી;
હું લક્ષ્ય વીંધી શર્કું, પજ ધનુષ્ય-બાજા નથી..
તમે સ્વીકારો મને, મારું કઈ દબાજા નથી;
સ્વગત અપેક્ષા છે, જાહેર બુમરાજા નથી..
હદ્ય-ધબક નહીં ઊતરી શકે આ શબ્દોમાં;
કલમમાં સાહી છે ભૂરી, એ લોહીઆજા નથી.
જવી રહ્યો છું હું સાંપ્રત ક્ષણોને સથવારે;
હવે પણીની ક્ષણોની કશી જ જાજા નથી..

વિકલ્ય બંને સ્વીકૃતું તરસ્થ ભાવે હું;
ખુશી મર્યામાં નથી ને જીવ્યામાં હાજર નથી.

ફરી ફરીને હું ભળતો રહીશ મારીમાં;
વિદ્યાય થાઉં છું, પણ આખરી પ્રયાશ નથી..

કાણો ચિરાયુ | શંભુપ્રસાદ જોશી

ડૂબકી મારી છૂપાયાં રતભર...
સૂર્યથી તરબોળ સરિતાનીર -
કલકલ વહી રહ્યાં છે,
બાંધ થોભીને પવનના કાનમાં કે
અનુષ્પન્ન કહી રહ્યાં છે,
કેવિમાં ગુલતાન ભેરુભૂલકંને
ગોદમાં લઈ વહાલથી ભીજવી રહ્યાં છે !

નાવડાં -
જાડો કિરિજને આંબવા (અલલડ વઢેરાં)
તીરવેગે જઈ રહ્યાં છે !

આડવાં -
શીતપાવનધન્ય થાવા મૂક પડળાયા બનીને
તર ભણી ઝૂકી રહ્યા છે !

વાવતા (જર્જર સ્વયમ્ભ) -
વાણાહૈયે હામ પૂરવા
જોશથી ફરકી રહ્યા છે !

ને વિહેંગો -
ચંચુથી ચીલા રચી અવકાશમાં
ઉલ્લાસથી ઊરી રહ્યાં છે !

લોપવી લોપાય ના
એવી ચિરાયુ આ કાણો
શેપવા લઈ જાઉ મારે આંગણે
મહાવૃક્ષ થાવા !

ગીત | હરીશ મીનાશ્રુ

બચિયું એટલે એળે અહીં તો
લૂટયું એટલું વ્હાણ.
(પુષ્યસ્મરણ : ઉશનસ્કૃ)

*

બચિયું એટલે એળે અહીં તો
લૂટયું એટલું વ્હાણ
આકળા એક બુદ્ધમાં, માલમ
ડૂબજો બારે વ્હાણ.

જેમણો પૂનમ ગજવે ઘાલી, ઓટીએ વાળી આંટ
એમને ભાયગ હોય ના શીતળ તેજની ચંદન છાટ
અમને ગમે
ચાંદ ઉથાળી ચોકમાં રમે
રસિયાળુ રમખાણ.

માટીને ખોબતથી આલી એક-બે મૂઠી જાર
સુંડલા ભરી ઢૂડલા : અધધ ઊજિયા રે ઓડકાર
અમને પડી
ચકલાં મારે ચાંચ તે ઘરી
અસલની ઓળખાણ.

વીટલો વાળી મેલ્ય ને ભીતર ભૂંગળીમાં તું પદ
પરખંદાને ખોંચતું કરે નમકી એની નદ
અમને ફિકર
પોથીએ પૂર્યા તેજ નહીંતર
જૂરશો શાહીઝાણ.

સતનો દીવો જાય હોલાઈ તોય ના કશું કેવ
પાંજરે પૂર્યા પોપટા જેવા ગોખલે ઘાલ્યા દેવ
અમને મીઠા
ભજન લેગા ચાત રે દીઠા
ઉદ્ઘિયા રચિ ભાણ
હે જી રે અજવાળાંની આણ.

ફોંટા | સંસ્કૃતિરાષી દેસાઈ

હું રસ્તા પર ઊભી છું
સીધો લાં...બો રસ્તો
અની વચ્ચોવચ્ચે.

આગળ પણ દેખાય ત્યાં સુધી રસ્તો
પાછળ પણ દેખાય ત્યાં સુધી રસ્તો.
જાણે એક લીટી જે લંબાય છે અન્ત તરફ
બંને બાજુઓ.

આગળ તો જરૂરી આવું છું
આગળ અનેક જન્મો છે.
ને પાછળ પણ અનેક જન્મો વચ્ચાવી આવી છું અહીં સુધી.
આગળ જવાને બદલે પાછળ જવાય ?

ને પાછળ જાઉં તો કદાચ કોઈ ફંટો આવે તો તેની ઉપર જવાય ?
ને તેના ઉપર જાઉં ને વળી બેચાર નવા ફોંટા આવે તો ?
મેં ન લીધેલા વિકલ્પો !
તો જુદી હોત જિંદગી ?
ને એ શાખાઓના બીજા ન્રષ ફોંટાઓ.
અને તેમાંથી નવી ન્રષ વૈકલ્પિક જિંદગીઓ !
એ બધા ફોંટા પહોંચત નોખાં પરિણામો પર ?

અત્યારે તો ઊભી છું લાં...બા રસ્તા પર
શું
હું નથી ?
અને રસ્તો પણ નથી ?
બંને છે જ નહીં ? હતા જ નહીં ?
તો પણી આ મનના ફોંટાઓ એટલે ?...

હું ને અહ્મુ બેઠા | લખિત નિવેદી

તપસ્વી તૃશુ ઉપર બેઠા હો એમ હું ને કલમ બેઠા !
સરસતી ! એક પગલું માંડવા હું ને જનમ બેઠા !

રૂઘવવા'તા અમુક આધ્યાત્મ... અમુક જગ્યાત જવવા'તા...
રૂડા બે-ત્રણ સ્મરણની જૂઈમાં હું ને જનમ બેઠાં !

તો બેઠા એમ જાણો કે અડાયા છાણા પર બેઠા,
અધ્યૂરું શું રહી રહ્યું કે પછી હું ને ભસમ બેઠાં !

કમાનોતીર મૂક્યાં ને નિશાંપોનામ પણ મૂક્યાં...
ને રાવણહથ્યા-શા એક તારમાં હું ને અહ્મુ બેઠાં !

ન ઘંટારવ રવા કોઈ સહજ એક જ્યોતની છિલમિલ...
શબદ-શી ટોચના માહોલમાં હું ને સનમ બેઠા !

ખુદા બેઠા'તા... હું બેઠો'તો... ને લોબાન વેતાં'તાં...
ખુદા ! આ કરી ઈલાદતગાહમાં હું ને ભરમ બેઠા !

શરૂઆત દીવા જેવી | લખિત નિવેદી

તો ભક્તો ! આજની શરૂઆત દીવા જેવી કરવી છે,
આ તેત્રી કોડની ઠકરાત દીવા જેવી કરવી છે.

જુદેરો જાગ છે... વિસ્તાત દીવા જેવી કરવી છે,
તરસ ને પાણીની અભિયાત દીવા જેવી કરવી છે.

હો ભીની ભીની રૂની વાટ ને હો રૂબરૂ લગ વાટ,
સાબર આ ઘરની જરૂરિયાત દીવા જેવી કરવી છે.

ઈ કંકુવરણા આપણા બે ઉપર ઢોળાતી અછણક સાંજ,
સાંજી ! ઈ સાંભરણની ભાત દીવા જેવી કરવી છે.

હો જરિયન નામ પેટવીએ... રણકતાં દામ પેટવીએ...
શરીર જેવી ભલી સોગાત દીવા જેવી કરવી છે.

જી રે જી... ખેડશું પરબું... ને ભરશું ઘાલા રસબસતા...
આ લેતીદેતીની રણિયાત દીવા જેવી કરવી છે.

સમેટાઈને તપ્પી સામે બેસી જઈશ, પરભુડા !
કે ઝંગાવાતની રજૂઆત દીવા જેવી કરવી છે.

મોભમ ઉભો છે | વિનોદ ગાંધી

પાણી વર્ચે મહેલ ઉભો છે,
વર્ષોથી અડીખમ ઉભો છે.
તટથી જોતાં ભરચક લાગે,
કિન્તુ ખાલીખમ ઉભો છે.
એની સાથે કોઈ બીજું ના,
પોતે કમસેકમ ઉભો છે.
મરજીથી ઉભો છે અથવા
કોણે દીધા સમ ઉભો છે.
ઉભવાનું કોઈ કારણ પૂછો,
જાણો કે મોભમ ઉભો છે.
હરખ નથી એને ઉભવામાં,
એને શો છે ગમ ઉભો છે.

હાઈકુ

રમેશ પટેલ

| | |
|-----------------|--------------|
| સમુદ્ર; તર- | રોજ સવારે |
| ઉપર છીડી જાય... | પંખીના કલરે |
| શાંખ-ધીપલાં ! | આડિયો જાગો ! |

| | |
|-------------|------------------|
| ખેતર લીલું | ધગધગતા |
| કલરવ કરતું | રણમાં ઊંટ બેઢું- |
| જોઈ મેઘને ! | ખજૂરી છાંયે ! |

ઉબડખાબડ રસ્તા પરથી જતો તમે તેને જુઓ તો લાગે જ કે આ છોકરો કઈ જાતનો છે, સરખી રીતે ચાલતો નથી અને થોડું દોરીને અટકી જઈ એકદમ ધીમી ચાલે ચાલે છે. ક્યારેક ઊભો રહી કંઈક જોયા કરે છે - આ તો તમારું નિરીક્ષણ થયું. પણ જ્યારે તે પોતાની સાંકડી ગલીમાં પ્રવેશવા આવે છે ત્યારે તો તે લગભગ એક શાસે દોરી પોતાના ઘરની જાળીનો આગળિયો ખોલી નાખે છે.

ઘરમાં શું છે તે, તે આટલો રઘવાયો ભાગે છે? સમજાય એવું નથી. કહો કે આ તેની સ્થાઠિલ છે ઘરે આવવાની. તમે તેને રખડું તો ન જ માની લો અને વિચાલિત મનનો પણ નહિએ.

ઘરનું તેને આકર્ષણ છે એમ પણ નથી. છતાં ઘર એ જ તેનું છેવટનું ને છેલ્લું આશ્રયસ્થાન છે.

ઘર ઘણું મોટું છે છતાં તે ઘરમાં કઈ નથી એમ તેને લાગે છે. જાળી ઉઘાડતાં તેની નજર સામે ખુલ્લી ઓસરી અને ઓસરીની જમણી બાજુ હિંડોળો તેની નજરે પડે છે. તેણે હિંડોળો એટલી બધી વખત જોયો છે કે તે હવે દેખાતો જ નથી તેને. પછી સીધો ચોક. ચોકમાં ઊભા રહી ઊંચે જુઓ તો ઉપર અફાટ આસમાન. ઉઘાડું આસમાન. ને એકદમ ઉઘાડ ને અજવાસમાં ગરક થઈ ગયેલો ચોક. ચોકમાં ચોકડી અને નળ અને પતરાં જડીને બનાવેલો બાથરૂમ. ચોકની જમણી બાજુ રસોડું. ચોકના ઉજાસમાંથી જોતાં રસોડામાં માત્ર અંધકાર સિવાય કશું જ દેખાય નહિએ. તેમાં બારી પણ નહિએ.

તેના દાદા - તેના બાપાના બાપા આ રસોડાનો કબજો સવારે આઈ વાગે લઈ લે. તેના બે ભાઈ તેના કરતાં મોટા અને તેના બાપા તેના કરતાં ઘણા મોટા અને તેમને માટે તેના દાદા રસોઈ બનાવતા. દાદા તો તેના બાપા કરતા પણ ઘણા મોટા લાગે. માથે વાળ જ નહિએ. પણ ચોટલી લાંબીને મોટી.

તેના દાદાનું ચિત્ર તેની નજર સામે કાયમ જડાયેલું જ રહેતું. તે તરત જ તેમનું વર્ણન આંખ મીંચીને પણ કરી શકે. આ રીતે - ગોઠણશી ઉપર સુધી પંચિયું. ઉપર ડિલ ઉઘાડું. છાતી પર વાળના ગુચ્છા. હોઠ થોડા ઢીલા. પાંપણો બહુ આણી. દાંત જરાયે નહિએ. માથે જટાજૂટ ચોટલી ગાંઠ મારેલી.

દાદા જ્યારે સવારે રસોડું સંભાળે ત્યારે તેના બંને મોટા ભાઈઓ વાંચતા હોય. બાપા ચોકની સામેની ઓસરીમાં પૂજા કરે.

આમ તો આ પૂજા દાદા કરતા - હવે નથી કરતા. કેમ ?

તે જ્યારે પૂજાના કબાટને જોતો ત્યારે સૌથી પહેલું તેનું ધ્યાન આડા અવળું

પડેલા – તેને તેવું લાગતું – ભગવાન પર પડતું. ભગવાન બધા ગંઠી થઈ ગયેલી ગોદડી પર આરામથી બેઠેલા તેને દેખાય. કબાટનાં નાનાનાનાં બારણાં જૂનાં ખવાઈ ગયેલાં ને રંગ વગરનાં. તેના પર કંકુ અને ચંદનના ડાઢા તેને દેખાતા. ચંદન અને કંકુ તો આખા કબાટમાં દેખાય જ દેખાય. દીવી અને ટોકરી અને બેસવા માટે નાની સાદડી ગોળગોળ વીટેલી પડેલી દેખાય.

આ બધું જોયા છતાં તેને તેમાં જરા પણ રસ ન પડતો. પણ ઘરની કંઈક મહત્વની આ જગ્યા છે તેવું તે મનમાં અનુભવતો.

આ ઓસરી પૂરી થાય ન થાય ત્યાં તો ઓરડાનું બારણું ને તેમાં પાછો હિંડોળો. આ બીજો હિંડોળો. તેના પર તેનો મોટો ભાઈ – સૌથી મોટો નહિં. – નવરો હોય તો જોરાજોરથી હીંચકા ખાય.

તેના બાપા તરફ તેનું ધ્યાન બધું ન જતું કારણ કે બાળ કંઈક ને કંઈક તેને કદ્યા કરે. એટલે સવારે જ્યારે દાદા રસોડું સંભાળે ત્યારે તે ત્રીજા માળના મોટા તોતિગ ઓરડામાં ભરાઈ જાય. ત્યાં લાકડાની બે પદ્ધીની આડસવાળી જાળીની અંદર હાથ બહાર જુલાવી બેસી જાય. ને બારી બહાર જોયા કરે.

આ ઓરડો કોઈ સાફ કરતું નથી. તેની તેને ખબર હતી. તેને તે પણ ખબર હતી કે અહીં કોઈ આવતું જ નથી. શા માટે તે આટલે ઉંચે ત્રીજે માળ ચડી જતો હતો તેની તેને ખબર ન હતી.

પણ બારીમાં લાકડાના કઠોડા પર હાથ ટેકવી બહાર ઝૂલતો રાખી તે બેસતો ત્યારે મોટા વહાણમાં ખૂબ ઊંચે તે બેઠો હોય તેવું તેને લાગતું. નીચેનો ચોક, નહાવાની પતરાની ઓરડી અને રસોડાનું ખુલ્ખું બારણું આ બધું તેને એકદમ નાનું દેખાતું અને તેને મજા પડતી અને જોયા કરતો.

થોડી વારે ઓરડામાં નજર ફેરવતો. આખા ઓરડામાં ધૂળ જ ધૂળ ને નકામો સામાન ધૂળવાળો તેને દેખાતો. સામાન્ય જોતો જોતો પાછો તે ઉપર નજર કરતો તો આકાશ દેખાતું. આ ઓરડામાં તેને એકાંત મળતું હોય તેવું લાગતું. તેની જગ્યા આ ઘરમાં આ ઓરડામાં જ છે તેવું તેને થતું લાગતું ને અનુભવતો.

તે નીચે જતો ત્યારે થતું – શું થતું ? તેને સમજાતું નહિં, એવું કંઈક થતું.

તે તેના પોતાના ઘરમાં અજાણ્યાની જેમ રહેતો એટલે તેણે આ ઓરડો પસંદ કર્યો હતો ? અથવા આ ઓરડો તેનાથી પસંદ થઈ ગયો હતો. આખા દિવસમાં જ્યારે તે નવરો હોય ત્યારે તે અહીં પહોંચી જતો.

તેની આ ઓરડા સાથેની લાગળીની ઘરના બીજા ચાર પુરુષોને ખબર છે કે નહિં તેની તેને ખબર નથી. તેની ખબર હોય તોપણ શું ફરક પડવાનો ?

બધાને ખબર હતી જ કે આ ઓરડો તેનો જ છે. માત્ર તેને જ ખબર ન હતી

કે આ ઓરડો મારો છે. આવું કેમ બને છે તેને સમજાતું નહિ.

બધા પોતાપોતાનામાં વ્યસ્ત હોય એટલે તેને કોઈ બોલાવતું નહિ. આ વાત જ તેને સમજાતી ન હતી. બધા એકબીજાથી છૂટા ને દૂર દૂર હોય અથવા દૂર થતા જતા હોય તેવું તેને આટલો નાનો હતો તોપણ સમજાતું હતું. અલબત્ત કોઈ તેને મારું કે ધમકાવતું નહિ. તેના તરફ કોઈ ધ્યાન જ ન આપતું ત્યાં ધમકાવવાની કે મારવાની વાત ક્યાં રહી.

ત્યારે તે બેચેન બની જતો.

તેનો નિશાળનો સમય થતો તેની ખબર તેના દાદા પાટલી, વેલાણ ને મોટો થાળ લઈને રસોડામાંથી બહાર આવતા ત્યારે થતી. આ બધું ચોકડીમાં મૂકતા ત્યારે તે ત્રીજા માળથી નીચે ઊતરતો, જાણો મોટા જગ્ઘાજના ઉપલા માળથી નીચે આવતો હોય તેમ.

તે શું ભણતો હતો તેને ખબર ન પડતી. પરીક્ષા શું કહેવાય તે તેને સમજાતું નહિ. પાસ થતો કઈ રીતે તે પણ તે જાણતો ન હતો. છતાં પાસ થઈ જતો.

અત્યારે તે ત્રીજા ધોરણમાં હતો.

તેનો મોટો ભાઈ દસમામાં અને તેનાથી મોટો જે તેને પોતાના ઓરડાની બારીમાંથી સામેના નીચેના માળના ઓરડામાં, બારી પાસે બેસી ચોપડી ખુલ્લી રાખી વાંચતો, ખુરશી-ટેબલ પર તે બી.એ.માં હતો. બી.એ.નું તે વાંચતો. તે મનમાં બોલતો – બી.એ. બસ બી.એ.

આમ ચાલતું હતું ને ઘરમાં એક પ્રકારનો સુનકાર અને સન્નાટા જેવું વાતાવરણ કાયમ રહેતું.

સવારે એક બહેન ઘર સાફ કરવા આવતા. તે જ બહેન સાંજે વાસણ સાફ કરવા આવતા.

દાદાને તેણે કયારેય બહાર જતા જોયા નથી, ને બાપાને તેણે આખો દિવસ ઘરમાં રહેલા જોયા નથી. છતાં દાદા, બાપા, બે ભાઈઓ બધા ઘરમાં જ હતા. ને તે પોતે પણ.

તેને મનમાં શું થતું તે તે જાણતો ન હતો પણ દાદા જો તેની સામે આવી જાય તો તેને કંઈક અવનવું લાગતું. માત્ર દાદા જ આ ઘરના મુખ્ય માણસ છે એવું લાગતું ને તે તેમની સામે ઊભો થઈ રહેતો. ને જોયા કરતો. દાદાને.

દાદાને આ વાતની ખબર હતી. દાદા બોલતા, “શું છે ?” ફરી બોલતા, “ઊભો છે કેમ ?” અને ફરી બોલતા, “તને હું પૂછું છું.” આ જોયા કરતો ઊભા ઊભા પછી આજુબાજુ જોતો ત્યારે દાદા બોલતા, “કેમ આમ કરે છે ?”

તે આજુબાજુ જોતો ત્યારે શું જોતો તેની તેને સમજ ન પડતી. ઘરમાં કોઈ જ નથી તે તેને સમજ પડતી. દાદા પછી ખસી જતા તેની સામેથી. ત્યારે દાદા સામે કંઈક

ચાળો કરવાનું તેને મન થતું, આગવીતરા જેમ.

ચારે તરફ જોતો ત્યારે ઘરમાં કોઈ જ નથી તેવો તેને અનુભવ થતો. તે કોને શોધે છે, કોને જોવા ઈચ્છે છે કંઈ સમજાતું ન હતું. તેને તેના દાદા, તેમનું ગોઠણ સુધીનું પંચિયું, છાતીના વાળ, માથે ચોટલી જોઈ તેને કંઈક ચાળા કરવા મન થતું, હમણાહમણાથી. છતાં દાદા સામે જ હોય ત્યારે આજુબાજુ જોતો. જોયા કરતો.

તે જ ઘરમાં હોય અને તેના દાદા જ ઘરમાં હોય અને બીજું કોઈ ન હોય ત્યારે બપોરે તેના દાદા થાડીને જાળી પાસેની ઓસરીના હિંડોળા પર સૂતા હોય ત્યારે તે દાદરાનાં પગથિયાં ધબધબ કરતો જોરથી ઉિતરતો. તેના દાદાની આંખો ખૂલી જતી. તે જોયા કરતા ત્યારે તેને મજા આવતી હોય તેવું લાગતું એટલે ફરી દાદરાનાં પગથિયાં અવાજ કરીને ચડતો ને પાછો ઉિતરતો.

છેલ્લાં ચાર પગથિયાં બાકી હોય ત્યારે ઊભો રહેતો. તે પગથિયાં ત્રાંસાં હતાં. તે દાદા સામે જોતો. દાદા તેની સામે જોઈ રહેતા, બોલતા નહિ કંઈ. પણ દાદા આવી રીતે જોયા કરતા એટલે તેની ન સમજાય તેવી મજા આવતી. ને છેલ્લાં ચાર પગથિયાં પરથી ભુસકો મારતો ને પાછો ઊભો રહેતો દાદા સામે જોયા વગર. તેને ખબર હતી. દાદા તેની સામે જોઈ રહ્યા છે ને મનમાં નિન્નાય છે.

દાદાને સમજણા ન પડતી. આ છોકરો તેમને જોઈને ભૂરાયો કેમ થાય છે ? ત્યારે તે મનમાં કંઈક બબડતો.

આને ખાવા ન આપવું જોઈએ. એના બાપાને કહેવું પડશે. પણ બાપાને શું કહે ? છોકરો મને પજવે છે એમ ? – બસ પછી તે ત્યાંથી જાળી ખોલી બહાર જતો રહેતો.

તેની દાદા, તેની બાની બા આ જ ગામમાં રહે છે. તે ક્યારેય તેના ઘરે આવતી નથી.

દાદર ઉિતરી જાળી ખોલી તે બહાર ગયો તે તેના દાદા જોઈ રહ્યા ને પછી આંખો મીંચી પડ્યા રહ્યા. તેમને ખબર છે તે ક્યાં ગયો છે. તેની દાદીને ત્યાં.

તેની દાદી તેની માની વાત ક્યારેક કરે છે ત્યારે ગંભીર બની જાય છે. તારા દાદાની લાડકી હતી. નાની હતી ત્યારે તારી મા – તેની દાદીએ તેને એક વખત કહેલું.

ત્યારે તેને ખબર પડી ગઈ હતી કે તેની મા મરી ગઈ છે.

તેની દાદી નજીક જ રહે છે – થોડી આઘે.

તેના દાદા વિચારતા હતા તે ક્યાં ગયો છે ત્યારે તે ઘરમાંથી નીકળી નાની ગલી વટાવી બીજી ખાડાખડિયાવાળી લાંબી શોરીના રસ્તા પર આગળ વધતો હતો ને તેના મનમાં ન સમજાય તેવી લાગકી થતી હતી. તેના દાદા તેને રંધી ખવરાવતા તેના તરફ, તેના પોતાના આવા મોટા જહાજ જેવા ઘર તરફ તેને અણગમો કેમ થતો હતો ?

તે આમ જ વિચારતો હતો તેવું ન હતું પણ તેના મનના ભાવ આવા જ હતા.

આ ભાવ તે વર્ણવી ન શકે. માત્ર કહી શકે – મને ગમતું નથી ઘરમાં. તેના કારણમાં – જવા દો ને....

તે રસ્તા પરથી ચાલતો હતો પછી વળવાનું આવ્યું. આ શેરી પજ ઉબડખાબડ હતી. હવેલી પાસેનો રસ્તો થોડો સારો હતો. બધું નહિ, થોડો. ત્યાંથી તે થાંભલાને અડી દોડવા માંડ્યો ને મોટા રસ્તા પર આવી ગયો ને હવે તેની દાઈનું ઘર.

નિશાળે જવાનું ન હોય ત્યારે અચૂક તે તે દાઈની પાસે પહોંચી જતો. તેને ત્યાં – જવા દો ને....

દાઈના ઘરે મોટા રસ્તા પર થઈને જવાય. રસ્તાની વચ્ચે જ શેરીમાં વળવાનું. ત્યાં તે લાઈટના થાંભલાને અડી તેની ફરતો હાથ ઘરી રાઉન્ડ લઈ દોડીને દાઈના ઘરે પહોંચી ગયો.

તેના પોતાના ઘર અને દાઈના ઘરમાં કેટલો બધો ફેર છે ! આ ઘરને મેડો નથી. માત્ર બે જ ઓરડા છે. મોટા ઓરડામાં હીંચકો છે. તેના ઘરે પજ હીંચકો છે. તેના પર તે હીંચકતો નથી. દાઈના ઘરે આવી તે તરત હીંચકો પકડી લે છે. દાઈ તેને ઘણી વાર કહે છે – જોરથી નહિ ધીમે. પજ તે સાંભળતો નથી. દાઈનું આમ બોલવું તેને ગમે છે. દાઈ તેને ગમે છે.

દાઈની દીકરી એટલે તેની બા – તેની બા દાઈ જેવી હશે કે દાઈ તેની બા જેવી હશે ? આવું આવું તેના મનમાં થતું નથી પજ હીંચકા ખાતા ખાતા તે પોતાના જ ઘરમાં હોય તેવું તેને લાગે છે. આ જ તેનું ઘર છે ને જોરથી હીંચકા ચગાવે છે.

દાઈ કહે છે – તું આવી ગયો ?

દાઈને તેના પર હેત છે. હેત ? હેત શું ?

ખૂબ હીંચકો ચગાવ્યા પણ તે થાકી ગયો એટલે તે હીંચકા ખાવા બંધ કરી બેસી રહ્યો. દાઈ બોલ્યા, “થાક્યો ?”

તે સૂનમૂન બેસી રહ્યો ત્યારે દાઈ બોલ્યાં, “ત્યારે માટે આજે લાડવો બનાવ્યો છે.”

લાડવો એટલે બે-ચાર રોટલી મસળી બૂકો કરી ગોળાદી નાખી બનાવે તે. કાયમ તો દાઈ તેને રોટલી ને ગોળ, રોટલી ને ખાંડું અથાળું આપે. પજ હીંચકા પૂરા થયા પછી ખાવા જરૂર આપે.

ત્યારે સમય અટકી ગયો હોય તેવું તેને લાગે છે. તે ત્યાં અટકી જાય છે. તે ક્યાંયે નથી એવું તેને લાગે છે. તે ભર્યો ભર્યો થઈ જાય છે. ભરપૂર ભરપૂર.

આ અંધારા ઓરડામાં તેની મા જન્મી હશે. અહીં તે રમતી હશે ને તેની જેમ જ હીંચકા ખાતી હશે. દાઈ તેને કહેતી હશે – છોડી બધું રહેવા દે હીંચકા મારવા. આ તારી બહેનપણીઓને કહી દે ઘરે જવાનું.

દાઈ બાની બહેનપણીઓને પણ રોટલી—અથાણું કે રોટલી—ગોળ આપતી હશે ખાવા ?

બસ તેના મનમાં સમય અહીં અટકી ગયો હતો ત્યારે દાઈ બોલ્યાં – કેમ મુંગો બેડો છે. લાડવો ભાવે છે ને તને ? લે તને આપું.

દાઈ તેનું બાવડું પકડી માથા પર હાથ ફેરવે છે. તેને ઊઠવાનું મન થતું નથી. ક્યાંક સમય અટકી ગયો છે તેના મનમાં. પોતાના ઘરમાં તેને ગમતું નથી એવા કારણમાં તે પડતો નથી. અહીં દાઈ તેને ગમે છે કે નહિ એવા કારણમાં તે પડતો નથી.

દાઈ ન હોય તો ? આવું તે કલ્યી જ શકતો નથી. ધારો કે દાઈ ન હોય, દાઈનું ઘર આ ગામયાં ન હોય તો !? તે વિચારી શકતો નથી.

અંધારું થવા આવે ત્યારે દાદા બારણામાં ઢેખાય. અને દાઈ તેને કહે – હવે ઘરે જતો રહે. અંધારું થવા આવ્યું.

દાદા શું બોલે છે તેની તેને ખબર પડતી નથી. દાદા તેની સામે જુઓ છે. કોટ ઉતારી ખીંટી પર યંગે છે. દાદા બહારથી આવ્યા છે તે તેને ખબર પડે છે.

“આને કંઈ ખાવા આપ્યું ?” દાઈને પૂછે છે દાદા.

“કુપારનો રમે છે.” દાઈ જવાબ આપે છે.

દાદા મનમાં કંઈક સમજી ગયા છે એવું તેને લાગે છે. તેને કંઈ કહેતા નથી. બોલાવતા નથી. માત્ર દાઈ સાથે જ બોલે છે. દાઈ જવાબ આપે છે. દાદા પછી થાકી ગયા હોય તેમ ડિડોળા પર બેસી જાય છે.

દાદા અને દાઈ શું વાત કરે છે તેની સાથે તેને કંઈ જ લેવાડેવા નથી. તેને દાઈ-દાઈની વાત સાંભળવાની ઈચ્છા પણ થતી નથી. ત્યારે દાઈ ફરી બોલે છે – હવે ઘરે જતો રહે. કાલે પાછું તારે નિશાળે જવાનું છે.

હમણાં હમણાં તેને એક દોસ્ત મળી ગયો છે તેની જ ઉમરનો. થોડા દિવસોમાં જીગરજાન દોસ્ત બની ગયો. રોજ મળવું એવું થઈ ગયું. ન મળે તો ચેન ન પડે. મજા ન પડે.

એ આના ઘરે આવે ત્યારે જાળી ખખડાવે ને તેના દાદા ચમકે. આ લગભગ ત્રીજે માળ હોય તેના મોટા ઓરડામાં બારી પાસે, તેની જાળી એવી હતી કે તેનો અવાજ ઠેઠ ત્રીજે માળ સંભળાય. તરત જ તે નીચે ઉતારી આવે ધબધબ કરતો. દાદા તેની સામે જોઈ રહે.

તેના દોસ્તને ઉપર લઈ જતો તેના દાદા જોઈ રહે. મનમાં તેમને થાય – બે થયા. એકનું હજુ ઠેકાણે પડતું નથી ત્યાં. છતાં દાદા તેને કંઈ કહેતા નહિ.

ઉપર તેની બેઠકવાળી બારી પાસે બેસે. પહેલી વખત તેનો દોસ્ત બોલી ગયો હતો – આટલું મોટું ? ત્યારે આંગે તેના દોસ્તને કહેલું – મારી દાઈનું ઘર તો સાવ

નાનું છે. તેને તો મેરો પણ નથી. એકદમ રજોરીયા જેવી મેરી ને દાદરો પણ વિચિત્ર. આપણે પુંપું થઈએ. ઉપર ચરી ઊભા થઈએ તો છાપરા સાથે માથું ભટકાય અને કંઈ દેખાય નહિ. બારી હોય તો દેખાય ને. તને લઈ જઈશ.

દાદા, બાપાના બાપા ભૂલમાં તેને પૂછી બેઠા, “તારો દોસ્ત શું કહે છે ?”

તમારે શું કામ છે એમ તે બોલવા જતો હતો. દાદાને આ ખબર પડી ગઈ. દાદાને થયું આને હવે ખાવા ન આપવું. ત્યારે તે બોલ્યો હતો, “નાના છોકરા શું કરે એટલીયે ખબર નથી તપણે.” તે શું બોલી રહ્યો છે તેના દાદા સામે તેની તેને પોતાને જ ખબર ન હતી. “ભણે છે.” આને બોલતાય નથી આવડતું - દાદાને થયું. પણ તેમણે પૂછ્યું, “તારી દાદી શું કહે છે ?”

તે જવાબ આપે તે પહેલાં દાદા ચોકમાંથી ઓરડામાં જતા રહ્યા. ને તેનો ભાઈબંધ તેની સામે બોલ્યા વગર જોઈ રહ્યો. આને પણ પોતાનું વર્તન ત્યારે વિચિત્ર લાગ્યું. પણ શું કરે ? તેનો દોસ્ત તેની સાથે હોય ત્યારે તે ગેલમાં આવી જતો. આવી તેને ખબર પડતી ન હતી, શા માટે આમ થાય છે ?

આ બધું તેના દોસ્તને કંઈક નવું લાગતું.

તેના દોસ્તને તેણે કહેલું - મારી દાદીને ત્યાં આપણે જઈશું.

તે જ્યારે શેરીમાં થઈને જતા ત્યારે એકબીજાના ખભા પર હાથ મૂકીને ચાલતા. ખાસ ભિત્રો હોય તે રીતે. ચાલતા ચાલતા કંઈક અગમનિગમની ખાસ વાતો કરતા. આમ ચાલતા તેની દાદીને ઘરે પહોંચી ગયા.

જતાવેંત હીંચકાનો કબજો લઈ લીધો ને તરત દાદીને પૂછ્યું, “દાદી, ઘરમાં બારી એક પણ નથી ?” દાદી જોઈ રહ્યાં શું જવાબ આપે ? પછી બોલ્યાં, “તારે બારીને શું કરવી છે ?”

“પૂછું છું.”

“ના, નથી. પછી ? હીંચકા બંધુ ન ચંગાવતા.”

અને એક છેદે સણિયો પકડી એનો દોસ્ત બેઠો. એક છેદે આ. અને હીંચકવાનું શરૂ થયું. દાદી તેના દોસ્તને કંઈ કહેતી નહિ. તેની તેને નવાઈ લાગતી.

આમ તો તેના પોતાના દાદા પણ તેના દોસ્તને કંઈ કહેતા નહિ. ઘરમાં આવવા દેતા. ને મેડા પર જવા દેતા. તેના દોસ્તને દાદી રોટલી-ગોળો તેને આપતા તેમ આપતો. ખાવા. ને દાદા આવે - તેની બાના બાપા, ધોતિયા ઉપર ખમીસ અને તેની ઉપર કોટ પહેરીને.

કોટ પછી ખીંટી પર લટકાવે. લાકડાની ખીંટી પર. હાથ-મોહું ધોવે. ફણિયામાં ખાટલો ઢાળી તેના પર ગોદંગું પાથરી ઓશીકું મૂકી સૂચે. થાકી ગયા હોય તેમ.

આને જોઈ દાદા તેના માથા પર ક્યારેક હાથ મૂકતા ને પૂછતા, “આ કોણ છે ?”

“ભાઈબંધ.”

“એમ ??” આટવું જ તે બોલતા.

દાદા સાથે આ માથાકૂટ ન કરતો. પોતાના દાદા સાથે કરતો તેમ. તેમના ચાળા પણ ન પાડતો ને ચીડવતો પણ નહિ. તો પછી પોતાના દાદા સામે તે તોફન કેમ કરતો ? આ તેની સમજ બહારની વાત હતી.

નિશાળ ન હોય ત્યારે શનિ-રવિ તેનો ભાઈબંધ તેના ઘરે આવતો તે માટે તેના દાદા તેને કંઈ ન કહેતા. શનિવારે તેની દાદીના ઘરે ગયો ત્યારે દાદા ઘરે જ હતા આજે. તેને જોઈ દાદા કંઈ જ ન બોલ્યા. તે પણ તેમની પાસે ન ગયો ને ભાઈબંધને લઈ પોતાનું જ ઘર હોય તેમ દર વખતની જેમ હીંચકા ખાવા માંડ્યો.

ત્યારે દાદીને તેણે દાદા સાથે વાત કરતી બહાર જોઈ. આને લાગ્યું કે દાદા તેની જ વાત દાદી સાથે કરે છે.

ઘરમાં આવી દાદીએ કહ્યું, “તારા દાદા તને બોલાવે છે.”

દાદા તેને કોઈ દિવસ બોલાવે જ નહિ. આજે કેમ ?

હીંચકા ખાઈ, રોટલી ને અથાણું ખાઈ તે બહાર ફિલિયામાં ગયો. તેનો દોસ્ત પણ સાથે ગયો. દાદા બેઠા ન થયા, સૂર્ય જ રહ્યા. દાદાના સર્કેટ વાળ તેને દેખાયા. તેમની થોડી વધેલી દાઢી પર તેનું ધ્યાન ગયું. તે જોઈ જ રહ્યો ખાટલા પાસે ઊભો ઊભો.

અચ્યાનક દાદા બોલ્યા, “શું કરે છે તું ??”

આણો જવાબ ન આપ્યો. તેણે શું કરવાનું હતું ? શેનું ? તે કંઈ સમજ્યો નહિ.

દાદા બોલ્યા, “મારી પાસે બેસ.”

તે બેઠા. તેનો દોસ્ત ઊભો રહ્યો. દાદાને શું કામ હશે ? ત્યાં દાદા બોલ્યા, “તારા ઘરે તું શું કરે છે ?”

આણો શું જવાબ હોય તેની તેને કંઈ ખબર ન પડી.

“તારા બાપા મારી પાસે આવ્યા હતા.” પછી તેની સામે જોઈ દાદા ધીમેથી બોલ્યા, “તારી ફરિયાદ કરતા હતા.”

ત્યાં દાઢી ખાટલા પાસે આવી ઊભો રહી. દાદા બોલ્યાં, “તું તારા દાદાને હેરાન કરે છે. તેમની સામે ગમે તેમ બોલે છે ??”

છતાં આ કંઈ ન બોલ્યો.

“તારા બાપા ફરિયાદ કરતા હતા તારી આવી.”

આ રોવા જેવો પણ ન થયો. તેના ભાઈબંધ સામે તેણે જોવું ત્યારે દાદા તેના હાથ પર તેમનો હાથ મૂકી બોલ્યા, “હે તારા દાદા સાથે એવું કંઈ ન કરતો.”

આ કંઈ ન બોલ્યો ત્યારે દાદા ફરી બોલ્યા, ને દાઢી પણ બોલ્યા, “મોટાનું માન

રાજવું જોઈએ ન !” તેના દાઈનું બોલવું સંભળાયું, “બાંગરાવેડા કરાય ?”

દાદાએ કહ્યું, “જા હવે. તોકન ન કરતો.” પાછા બોલ્યા, “કાલે આવજે પાછો.”

રસ્તામાં તેના દોસ્ત સાથે વાત કર્યા વગર તે ચાલતો હતો. જરા પણ ઉતાવળે ચાલતો ન હતો. તેનો દોસ્ત થોડું ચાલી ઊભો રહી ગયો, “તારા ઘરે તો તારા દાદા કંઈ બોલે તો રાડ પાડીને તું તેમને જવાબ આપે છે. અહીં કેમ કંઈ જ ન બોલ્યો તું ?”

પાછા બંને ચાલવા માંડ્યા. થોડું ચાલ્યા પછી તે ઊભો રહી ગયો, “તેમની સામે કંઈ ન બોલાય તે મારી બાના બાપા છે.”

તેનો ભાઈબંધ આમાં કંઈ સમજ્યો નહિ. બંને ચાલવા માંડ્યા. તેનો ભાઈબંધ તેનું ઘર આવતા છૂટો પડ્યો. તે એકલો ચાલવા માંડ્યા.

ઘર આવતાં તે સમસમી ગયો. દાદા ઘરે નથી ને ? દાદા ઘરમાં જ હતા. તેમનાથી બચવા માગતો હોય તેમ ઘરમાં ગયો. દાદા સામે જોયા વગર.

દાદાએ જોયું કે સમય થઈ ગયો છે છતાં પેલો જમવા નીચે નથી ઊતર્યો. ઉપર જ ભરાઈ રહ્યો છે આવ્યો ત્યારનો. ત્યારે તેમણે બૂમ મારી, “અનુ, તારે જમવું નથી ?”

નીજા માળની બારીમાંથી તેણે હાથ લટકતા રાખી જોયું તો તેના દાદા નીચે ચોકમાં હતા ને ઊંચે જોઈ રહ્યા હતા. તેની તરફથી.

સાભાર સ્વીકાર

પ્રક્રિયા

(૨૨૭) દીપમંગલ : મોહનલાલ મહેતા ‘સોપાન’, ૨૦૧૨, નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ, પૃ. ૮+૧૮૨, રૂ. ૧૭૫/- (૨૨૮) મનોમંગલ : મોહનલાલ મહેતા ‘સોપાન’, ૨૦૧૨, નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ, પૃ. ૪+૧૮૦, રૂ. ૧૭૫/- (૨૨૯) કોલોની : સિદ્ધાર્થ પારવી : ૨૦૧૨, નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ, પૃ. ૧૮૨, રૂ. ૧૫૦/- (૨૩૦) પોતપોતાનાં અજાણ્યાં ઈન્દ્ર ઊરી મહેતા : ૨૦૧૨, લેખક પોતે ૧, અશોક નિવાસ કોઠારીવાલા મલાડ (વે) મુંબઈ-૬૪, પૃ. ૮+૧૨૪, રૂ. ૧૧૦/- (૨૩૧) જુગલબંધી : ઉદ્યન ઠક્કર, ૨૦૧૩, નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ, પૃ. ૧૨+૧૩૧, રૂ. ૧૨૫/- (૨૩૨) ફણાદેશની નૂતન શતક પદ્ધતિ : એચ. એન. કેશવાણી, ૨૦૦૮, સાહિત્ય સંગમ, સુરત, પૃ. ૩૨, રૂ. ૨૫/- (૨૩૩) મરવું કોને ગમે : પ્રા. સુર્યકાન્ત ભક્ત, ૨૦૧૨, લેખક પોતે, પ્લોટ નં. ૬/એ, લીમાદાલેન, સંસ્કારનગર, ભૂજ ૩૭૦૦૦૧ પૃ. ૮૬, રૂ. ૧૦૦/-

ચશમાં વિનાનો એક દિવસ | કિશોર વ્યાસ

સવારના પહોરમાં જ રામાયણ થઈ. મેં ખાંખાંખોળા શરૂ કર્યા કે ઘરના સભ્યો સમજી ગયા કે : ‘પતું, કશુંક ખોવાયું લાગે છે. મારાં ચશમાં મને ક્યાંય મળતાં ન હતાં. ટેબલનાં ખાનાંઓ ફંઝેસી લિધાં. કબાટને ખાલી કર્યો. ઘરમાં દિવાળી આવી હોય એવું થઈ રહ્યું. સૌને ચીજવસ્તુઓ કૂદીકૂદીને આવ-જા કરવાની મેં ફરજ પાડી એથી તેઓ અકળાયા. ‘કોણ જાણો ક્યાં મૂકી આવો છો ? અમારે તો તમારી દરેક ચીજો શોધાશોધ જ કર્યા કરવાની ?’

‘ચશમાં મળી જાય પણી ક્યાં શોધવાનાં છે ?’ મેં તણાવભર્યા વાતાવરણમાં પણ મજાક છેડી એથી તેઓ વધુ ગુસ્સે થઈ કહે : ‘શાકભાજીની લારીમાં, કોઈ દુકાનના કાઉન્ટર પર મૂકી આવ્યા હશો. હવે અહીં શોધો તે ક્યાંથી મળે ? હવે શોધ્યાં કરો તમતમારે. અમે તો થાકી ગયાં.’

ઘરનાં સૌનો ચશમાં શોધવાનો આવો અસહકાર જોઈ હું નિરૂપાય થઈ ગયો. શેરીના છેવાડે આવેલી બે દુકાને જઈને પૂછી આવ્યો. એક અઠવાડિયાથી શાક લેવા નહોતો ગયો તોથે શાકભાજવાળાને પૂછી આવ્યો. એ મને ચશમાં ન આપી શક્યો પણ સલાહ આપ્યા વિના રહી ન શક્યો : ‘તમારી ચીજવસ્તુનું ટેકાણું તમારે જ રાખવું જોઈએ ને સાહેબ !’ ‘હાં, એ તો ખરું જા : મારે કહેવું રહ્યું. હું એ સલાહ વરસોથી સાંભળતો હતો એથી મને એની ખાસ અસર ન થઈ. માણસ પ્રાણી જ એવું છે કે એ આજાગમતી સલાહને એક કાનેથી સાંભળી બીજા કાનથી કાઢી નાખે છે. હું પણ એમાંથી શાને બાકત રહ્યું ? મારાં ચશમાં સાવ સાંદ્રાં ન હતાં. નોકરીમાં એક ઈજાફાની સરકારે જાહેરાત કરી પણી ચારેક ઈજાફા વધારે વાપરી નાખીને મેં ચશમાં બનાવડાયાં હતાં. ચશમાંની કિમત સાંભળી જૂના જમાનાના મારા એક સગાંએ કહેલું : ‘હાય, હાય. આટલી કિમતમાં તો નવી આંખો આવી જાય.’

‘તો મારા માટે બે લઈ આવજો, જેથી હુનિયાને બમણી જોઈ શકું, હું બોલેલો.

હાલ તો ચશમાંનો વિકટ પ્રશ્ન મારે ઉકેલવાનો હતો. કદાચ કોલેજમાં પણ ભૂલી ગયો હોઉં એમ માનીને કોલેજ જવાનો સમય થાય એની હું રાહ જોવા લાગ્યો. રસ્તા પરથી પડોશીએ મને ફળિયામાં, લીમડાના ટેકે નિરાંતવો બેઠેલો જોયો એટલે એ વાતો કરવા ઉભા રહી ગયા. ‘સરકારી નોકરિયાતોને આ મજા, નહીં ? જ્યારે ને ત્યારે રજા. એમ કહી નોકરિયાતોને કયારે કયારે મહિતની રજા મળતી હોય છે એની એમણે મને એક યાદી સંભળાવી. મેં કહું કે : ‘આજે તો એવી કોઈ રજા નથી. સાડા દસ થાય કે હમણાં નોકરીએ જવા નીકળું જ છું.’ એ હસ્તીને કહે : ‘રાતે ઊંઘ નથી આવી કે શું ? અત્યારે તો સાડા અગ્નિધાર થવા આવ્યાં.’ વિરસ્ટોટ કરીને તેઓ ચાલ્યા ગયા. હું

દોડગો. ઓસરીમાં ટીંગાડેલી ઘડિયાળમાં આંખ બેંચીને જોયું તો દસ અને અગિયાર વચ્ચે કાંઠો એવો ચાલતો હતો કે મને ચશમાં વિના એ સાડા દસ જણપત્ર હતા. હું દોડાઈદ ઘરમાં જઈ કહેવા લાગ્યો, ‘અરે, મને કહેતાં પણ નથી કે આટલો બધો સમય થઈ ગયો ?’

‘અમને તો એમ છે કે ચશમાંના શોકમાં તમે રજા પાડી દીધી હશે.’

જેમતેમ તૈયાર થઈ કોલેજ જવા મેં ખલે થેલો ભરાવ્યો. ‘અરે, જમીને તો જાઓ.’

મને કોલેજ પહોંચવાનો લાંબો પથ ચશમાં વિના પણ ચોખ્યો દેખાતો હતો. મેં બસસ્ટોપ તરફ જાણે કે દોટ જ મેલી. મંદિરમાં પાર્થના કરીએ ત્યારે આપણાને જાણ નથી હોતી કે ભગવાને આપણી અરજ સાંભળી કે ના સાંભળી. બસસ્ટોપ અને મંદિરમાં જાંઓ તશ્વાવત નથી. બંને જગાએ મોટાભાગે ઉભા રહેવાનું જ આવે. બસ આવવાની છે. ચાલી ગઈ છે કે હવે આવશે એની અટકળમાં રાહ જોયા સિવાયનો કોઈ વિકલ્પ ન હતો.

ખાસ્સી વાર પછી મોટાં ચશમાં લગાવ્યાં હોય એવી બસ આવતી જોઈ. સૌ રણમેદાનમાં જવા સજજ થઈ ગયા. એક ધક્કે હું બસમાં ચઢી ગયો. આટલી ધક્કામુક્કીમાં પણ હું બસમાં જગા કરી શક્કું છું એનું મને આશ્રમ શમતું ન હતું. કંડકટર પાસે કોલેજ રોડની ટિકિટ માગતાં એ મારી સામે આશ્રમથી જોઈ રહ્યો. ચશમાં વિના પણ એનું સૂક્ષ્મ મોં, તુચ્છકારભરી નજર હું જોઈ શકતો હતો. મેં પાંચ રૂપિયાની નોટને બદલે પાંચસોની નોટ આપી દીધી છે કે શું ? એ વિચારથી નોટને એના હાથમાંથી બેંચી લઈ આંખને પણ બરાબર બેંચીને જોયું તો એ બરાબર જ હતી. કંડકટરનો મૂડ બરાબર ન હતો. એમણે મને કહ્યું : ‘તમારી નોટ તમારી પાસે જ રાખો ને હેઠા ઉત્તરો.’

‘અરે, પણ આ સાચી નોટ છે, બનાવતી નથી.’

‘આ બસ કોલેજ રોડ પર નહીં જાય, આશ્રમ તરફ જશે.’

‘મારો ગૃહસ્થાશ્રમ હજુ હમણાં જ શરૂ થયો. છે ત્યાં સંન્યાસાશ્રમની ક્યાં વાત કરો છો ? મારે તો કોલેજ જવું છે.’

‘તો સિસ્ટોરે નંબરની બસમાં બેસો.’

‘કેમ ? આ તો એ જ બસ છે ન ?’

‘આ નવ્યાશું નંબર છે. અભણ છો કે શું ?’

‘પણ મેં સિસ્ટોરે નંબર જ વાંચેલો.’

‘અમ ? તમે તો સિસ્ટોરે પણ વાંચો. હવે ઉત્તરશો કે આશ્રમ લગી આવશો ?’ આમ કહી એણે બેલની દોરી બેંચી. કોલેજમાં છૂટવાનો બેલ અમારા સૌના માટે દુનિયાનું શ્રેષ્ઠ સંગીત અમે માનતા આવ્યા છીએ. એ બે-પાંચ ક્ષણ પણ આધોપાછો થાય તો અમે બેબાકળા થઈ ઊરીએ છીએ. આજે આ ઘંટી મને મૃત્યુધંટ જીવી લાગી. દુષ્યાને ભરસભામાં જેમ શકુન્તલાને અપનાવવાનો ઇનકાર કરી દીધો હતો એમ મુસાફર તરીકે મને અપનાવવા કંડકટર રાજુ ન થયો. એ રાજુ થયો હોત તો મારે એટલા ગાઉ ચાલવું પડત કે માત્ર દિવસ જ નહીં, બોલી પણ બદલાઈ જાત. મેં અધવચ્ચે ઉત્તરી કોલેજની

વાટ પકડી. મારા વિદ્યાર્થીઓને કોલેજ આવતાં જે થાક લાગે છે અને કટાણું મૌં થઈ જાય છે એવા હાલ મારા પણ થઈ ગયા હતા. આચાર્ય મને મોડા પડવા બદલ તત્ત્વાચ્ચો : ‘જુઓ મિસ્ટર, કેટલા વાગ્યા છે ?’

ઘડિયાળ તરફ મેં આંખને ભેંચ્યો. કંટાઓ અને અંકડાઓ મારા મૌં જેવા ઝાંખાપાંખા મને જણાતા હતા. ચશમાંના કારણે હું કંઈક ભણતો જ સમય કહી બેસીશ એવી બીકથી હાજરીપત્રકમાં મેં ચૂપચાપ સહી કરી દીધી. મેં સહી કરી કે સાહેબ ગર્જ ઉક્ખા : ‘તમે આ શું કર્યું ?’ મેં આંખને ફરી જીણી કરી. કોઈ હીરાને તપાસતો હોઉં એમ આંખને ભેંચ્યું તો મેં સેવકભાઈની જગ્યાએ સહી કરી દીધી હતી. ચેકબુકમાં સહી કરવાનું સફ્ટબાબ્ય મને ખાસ મળતું નથી આથી હાજરીપત્રકમાં હું ખાસ ચીવટથી સહી કરી જાતને ધન્ય માનતો હતો. એમાં પણ આજે ચૂક થતાં હું શરમાયો. એ સમયે મારું અધ્યાપકપદું મને કામે આવ્યું : ‘સાહેબ ! આખરે તો હું આ સંસ્થાનો અદનો સેવક જ છું ને ?’

‘સારું, સારું. હવે તમે જાઓ. પણ ધ્યાન રહે. આવતી કાલે મારા ખાનામાં સહી કરીને આચાર્ય ન બની જતા.’

પાછળ જોયા વિના જ મેં વર્ગમાં જવાનું મુનાસિબ માન્યું. કોઈ વર્ગમાં હું ચશમાં વિના ચોપડી પકડી શરૂ એમ ન હતો. મેં જાતભાતાની વાતો જોડી કાઢી. વિદ્યાર્થીઓ અભ્યાસને લગતા મારા વ્યાખ્યાનને પણ ખાસ સમજી શકતા નથી. કેટલાક તો પાટલી પર માણું ટેકવીને સ્વભનગરીના નાગરિકો પણ થઈ જતા હોય છે. કેટલાક મૂઢમતિ હું શું ફેંકી રહ્યો છું એ ન સમજતાં ચશમાંની આરપાર તાકી રહેતા હોય છે. ચશમાં પહેરીને બેઠેલા આવા એક પણી એક વિદ્યાર્થીઓના આ ચશમાંવૈભવની મને ઈર્ષા થઈ.

ઘરે આવ્યો ત્યારે સૌએ ‘ચશમાં મળ્યાં કે ?’ એવા અધરા પ્રશ્નથી મારું સ્વાગત કર્યું. મારા જવાબથી તેઓ હતાશ થઈ ગયા. કેમ કે ચશમાં વિના હું જે ભૂલો કરવાનો હતો એ ભોગવવાની એમના પક્ષે હતી. ‘હવે નવાં ચશમાંનો ખર્ચ કરી નાંખો’ એમ સૌ છૂટથી કહેવા લાગ્યાં. સવારે સૌ પહેલું કામ એ જ હાથમાં લઈશ એવી ખાતરીથી સૌને નિરંતર વળી.

એકચાણાના ભોજનનું રાતે સાટું વાળી દીધું. ચશમાં કરાવવા જઈશ તોયે અઠવાડિયા લગી નવાં ચશમાં બનશે કે કેમ એની ચિંતામાં નીંદર વેરણ થઈ ગઈ હતી. ચશમાં વિના જીવરામ ભણી માફક કશુંયે જોવા-વંચાવાનું કચ્ચાં હતું ? તે છતાં આદતવશ પુસ્તકોના કબાટ પાસે ઊભો રહી ગયો.

કબાટમાં ‘ચશમાં ઉતારવાના સો ઉપાયો’ પુસ્તક પડચું હતું. મોટા અક્ષરો જોઈ એને હાથમાં લીધું. પુસ્તકની વચ્ચે દબાઈને મારાં ચશમાં ત્યાં લહેરથી પડ્યાં હતાં.

રહીરહીને યાદ આવ્યું કે ગઈ કાલે મેં ચોપડી વાળીને આમ જ ચશમાં મૂડી દીધેલાં. મેં મનોમન કચ્ચું : ‘હવે હું પ્રોફેસર સાચ્યો.’

અનુ. રેણુકા શ્રીરામ સોની

૧. માછલી

સાતતાડ ઊડાં
 નીલ સમુદ્રનાં પાણીમાં હોય,
 કે નાના તળવના
 ઢીંગશબર પાણીમાં હોય
 બધી રમતાં ભમતાં રહેવાની છે
 મારી આદિમ પ્રકૃતિ.
 ક્યાંય ક્યારેય
 ક્ષણવાર પણ રિથર
 રહી શકી છે કે રહી શકશે તું ?
 ચપળતા જ તારી ચંચળ જિંદગીનો છે
 સ્વભાવ – તારી સુંદરતા.

તું તો આવી રીતે
 આદિમ કાળથી આજ દિન સુધી
 રમતી જ રહી છે,
 ક્યાં સુધી હજુ બાકી રહી છે તારી રમત ?
 એનો કદી અંત આવશે ખરો ?

કોઈ સુંદર સુદીર્ઘ નેત્રવાળી
 નારીની મત્સ્ય જેવી ચંચળ આંખોના ઉલાળામાં,
 કે કોઈ મુખ દૂધ કન્યાના સ્વયંવરમાં
 મત્સ્યવેધના સ્થાને ગોળગોળ ચકરાતા લક્ષ્યમાં,
 તું જ્યાં પણ હોય
 બધી જ તારી પ્રભાતકતા એકસરાખી,
 અને બધી જ તારો જ્યાજ્યકાર.

આદિમ કામનાની માંસલ ગંધથી
 પલભરમાં વિમુખ અને વસ કરી દેવાની

અપૂર્વ સંમોહન કરી દેવાની કળા
આટળી બધી તારા સિવાય
બીજા કોને આવડે છે ?

હીરાની ચમક લઈ તિર્યક્ત ગમિમાં
તું ફરતી રમતી રહે માટે જ
તને રમાડતાં રમાડતાં
જડપી લેવાને
ચતુર શિકારી
નાખે છે ગલ.

ગલના તીક્ષ્ણ કંચમાં,
કે ગુંથેલી જાળના ફંસામાં,
અચાનક ભરાઈ પડીને
હુંમેશ માટે
સ્થગિત થઈ જવાના ભયમાં
તું હોય છે સતત સંત્રસ્ત.

તો પણ તું શું છોડી શકી છે
તારી સ્વભાવ સુલભ ચંચળતા ?
કે છોડી શકી છે
રમતા રમતા રમાડવાની
આદિમ પ્રવાણતા ?

આ લીલાપિત ચપળતા
તારા જીવનની અનવદ્ય કળા
અને જીવાનો મધુમય લય છે,
આ લયમાં જ તેં હમેશાં
કર્યો છે મોહિત ચતુર શિકારીને
અને ભરી દીધી છે
તેના અણુઅણુમાં
તારી આદિમ અને આરણ્યક કામનાની
માંસલ ગંધ.

૨. ઉધર્ણનો રાફ્ફડો

હું જ્યાં જ્યાં
 જ્યારે જ્યારે બેઠો છું
 ત્યારે ત્યારે ત્યાં ત્યાં
 મારી આસપાસ
 હળવે હળવે ગોઠવાઈ ગયાં હોય છે
 ઢગલે ઢગલાં પુસ્તકો.
 પુસ્તકો તો જાણો
 ધોળી સંફેદ ઉધર્ણ
 ધીમે ધીમે
 ચાઢી ગઈ છે
 મારા શરીર પર
 ઉતરી રહી છે મારી અંદર.
 અને આસ્તે આસ્તે ફરી વળી છે મારા આત્મા સુધી,
 અને જાણો હું
 પલયાઈને બની રહ્યો છું
 એક વિરાટ ઉધર્ણનો રાફ્ફડો.
 અને બહારના લોકો
 જ્યારે મારી નજીકથી પસાર થતા હોય છે
 ત્યારે તેઓ સાંભળો છે
 મારી અંદર ઉઠો કોઈ અનોખો ગૂજરતો શહે,
 જે ઘૂમરાઈને અવિરત
 પ્રગટ થતો હોય છે
 મારા કંઠમાંથી.
 હું નથી જાણતો
 એવી દિવ્ય ક્ષણ
 આવશો કે નહિ,
 જ્યારે અવિરત
 'મરા મરા' શબ્દનું રટણ કરતો હું
 'રામ રામ' બોલતો થઈ જઈશ
 અને ત્યારે એક સુંદર રૂપમાં
 વાલ્મીકિ બનીને
 હસતો હસતો બહાર આવીશ
 ઉધર્ણના આ રાફ્ફડામાંથી.

શ્રી ધીરેન્દ્ર મહેતાની લઘુ નવલ ‘રવજી માસ્તરનું મૃત્યુ’ વાંચતાં વાંચતાં સર્જકની એક લાક્ષણિકતા આ ભાવકની ચેતનામાં ઉપસતી રહી. સર્જક સ્વયં કોઈ પણ ક્ષાળે કથાચકમાં મનસા-વાચા પ્રવેશતા નથી. નવલકથાનાં મુખ્ય ચરિત્રો ત્રણ છે : (૧) જેમનું મૃત્યુ થયું છે તે રવજી માસ્તર. તેઓ શિક્ષક નથી. પોસ્ટ માસ્તર છે. (૨) રવજી માસ્તરનાં પત્ની સાવિત્રીબહેન. (૩) પુત્ર શૈલેશ. આ રવજી માસ્તરનો પરિવાર છે. હા, એક પાત્ર આ કૃતિમાં આવ્યા કરે છે તે શાળાના શિક્ષક જગજીવન. તેનું નામ ટૂંકાવીને જગન કે જગનો એવા સંકેત તેમના મનમાં ને મનમાં ઉચ્ચારતા હોય છે.

આ કૃતિમાં મુખ્ય ઘટના વર્ણવાઈ છે તે પૃષ્ઠ બાવન પર આ પ્રમાણે છે.

દ્રુકકોલ માટે કે ટ્યાલના કંઈ કામ માટે આવનારે જોયું તો રવજી માસ્તર કંઈ વિચાર કરતા બેઠા હોય એમ ખુરશીમાં બચાબર ગોઠવાયેલી સ્થિતિમાં બેઠા હતા. જોનારને એક વાર તો એમ લાગ્યું કે માસ્તરને ઊંઘ ચઢી ગઈ લાગે છે. સમય પણ બરોબર બાપોરનો હતો. જાગી જાય એવા ઈરાદાથી આમતેમ ખાંખાંખોળા કરીને અવાજ પણ થવા દ્યાયો. પછી કોણ જાણે એને કંઈ વહેમ પડ્યો કે શું તે એણે રવજી માસ્તરને ઢંઢોળ્યા, ને ઢંઢોળતાની સાથે એ ઢળી પડ્યા.

પેલો ગભરાયો. ઘરમાં જઈને જુઓ છે તો કોઈ ન મળે. આજુબાજુમાં કહ્યું ને લોકો ભેગા થયા. સાવિત્રીબહેન પણ એ જ પ્રમાણે આવી ગયાં. સહૃદી જેમ એ પણ ડઘાઈ ગયાં હતાં અને એક બાજુ ઊભા રહી ગયાં હતાં. એટલી વારમાં તો શૈલેશ મારમાર કરતો મોટરસાઈકલ પર આવી પહોંચ્યો. સાથે ડોક્ટરને પણ બેસાડતો આવેલો.

હા, બાવનમાં પૃષ્ઠ પરનું વર્ણન લેખકના કથન પ્રમાણે ઉપર ઉત્તાર્દ્યું છે. કથાના પહેલા પ્રકરણમાં પહેલું વાક્ય છે : ‘નોકરીમાંથી નિવૃત્ત થવાને આગામે દિવસે જ રવજી માસ્તરનું અવસાન થયું.’ સર્જકે તે નાની નગરીમાં વસતા નગરજનોના પ્રતિભાવોને આરંભના પ્રકરણમાં મૂક્યા છે. ‘રવજી માસ્તર બિચારું ભગવાનનું માણસ કહી શકાય એમ હતું.’ વગેરે વગેરે. જગજીવન શિક્ષકના નામને બહુ વિવેકપૂર્વક ટૂંકાવીને ગામલોકોએ ‘જગન’ કર્યું હતું અને પોતાના તરફથી એને ભારાડી જેવી સંશાની નવાજેશ કરી હતી.

બાવનમાં પ્રકરણમાં સાવિત્રીબહેન અને શૈલેશના આગમન પછી, બીજાઓના આગમન પછી કથકસર્જક આ પ્રમાણે વર્ણન કરે છે : ‘સ્ત્રીઓ આવી પહોંચી હતી.

એ સૌ સાવિત્રીબહેનને વીંટળાઈને બેઠી અને એમનું રૂદન સંભળાવા લાગ્યું.

અને રાત પહેલાં તો રવજી માસ્તરનો અંતિમ સંરક્ષાર પણ થઈ ગયો. બીજે જ દિવસે ઉઠમણું પણ થઈ ગયું અને ત્રીજે દિવસે તો સાવિત્રીબહેન અને શૈલેશે ઘરનો સામાન બાંધવા માંડ્યો. પોસ્ટ માસ્તર પોસ્ટ ઓફિસના સરકારી મકાનમાં જ રહેતા હતા. શૈલેશ સહુને કહેતો રહ્યો : ‘આ તો સરકારી મકાન, ખાલી કરવું જ પડે... પછી હવે ગામમાં ઘર ભાડે રાખીને રહેવાનો શો અર્થ?’ આ પછી બાવનમા પેજ થી ઉઠમા પેજ સુધી શૈલેશની સક્રિયતા, સ્ફૂર્તિ, સૂજ વર્ણવાયાં છે. સાવિત્રી બહેનનાં નાનાવિધ ભાવો પણ સર્જક બિનંગત રહીને વર્ણવે છે. હા, એમાં મળેલા મકાનનો મા-પુત્રને કેવો તો આર્થિક-માનસિક-દરજજાનો લાભ મળે છે તે લઘુ નવલમાં વર્ણવાયું છે. જગન ભારાડીનું એક કથન પૃષ્ઠ ૭૮ પર નોંધાયું છે : ‘જૂનું મકાન હતું ત્યારે આ નવું ઊભું થયું એ વાત પણ સાચી ને શૈલેશભાઈ?’

આ લઘુ નવલ મને એટલા માટે સ્પર્શી ગઈ કે સર્જકનો ‘આઈ’ તેમાં કોઈ ક્ષણે પ્રવેશતો નથી.

ઇથું કે જેમણે આ લઘુ નવલ ન વાંચી હોય તેઓ વાંચે. હા, એમ પણ ઇથું કોઈ ચલચિત્રસર્જક કૃતિના કથાનકને ઓડિયો-વિડિયો સ્વરૂપની કળા રૂપે સ્કીન પર પ્રેક્શકો સમક્ષ મૂકવા પ્રેરાય.

(તા. ૧૮-૨-૨૦૧૪)

સાભાર સ્વીકાર

પ્રક્રીષ્ટ

(૨૭૪) પર્યાવરણ - પ્રીત આપણું લોકગીત : ડૉ. ઈન્દુ રામબાબુ પટેલ, ૨૦૧૨, લેખક પોતે, ૬ ઉદ્દ, દાદાવાડી સીએરી ચોરાહા કોટા, પૃ. ૬૮૮+૮૮૨, રૂ. ૨૨૦/- (૨૭૫) દુષ્ણિયારાં ખંડ-૧/૨ : અનુ. મૂળશંકર ભંડ, ત્રીજી આ. ૨૦૧૩, ગુજરાત ગ્રંથરન્થ કાર્યાલય, અમદાવાદ, પૃ. ૨૦૪+૪૬૦, રૂ. ૩૫૦/- (૨૭૬) ચાઈ જેટલી સાવધાની પહાડ જેટલો લાભ : વેમુડિ બલરામ, ૨૦૧૨, આર. આર. શેઠ એન્ડ કંપની પ્રા. લિ., અમદાવાદ-મુંબઈ, પૃ. ૧૦૪, રૂ. ૮૦/- (૨૭૭) નહીં માફ નીચુ નિશાન : અનુ. હેતલ સોંદરવા, ૨૦૧૩, આર. આર. શેઠ એન્ડ કંપની, પ્રા. લિ., અમદાવાદ-મુંબઈ, પૃ. ૨૬૪, રૂ. ૨૨૫ -

‘સંભારણાંની સફર’ | દક્ષા વિ. પદુંધી

‘સંભારણાંની સફર’ એ શ્રીમતી સુધા મૂર્તિએ મૂળ અંગેજમાં લખેલ પુસ્તક “How as taught my grand mother to read and other stories” નો શ્રીમતી સોનલ મોદીએ કરેલ ભાવાનુવાદ છે.

ગુજરાતી ભાષાનો વાચક વર્ગ હવે સુધા મૂર્તિનાં લખાણોથી ઠીક ઠીક પરિચિત છે. ‘મનની વાત’, ‘તમે જ તમારું અજવાણું’, ‘બોરસલ્વીની પાનખર’ અને ‘સંભારણાંની સફર’ એટલા પુસ્તકો તો સોનલ મોદીએ જ ગુજરાતીમાં ઉતાર્યા છે પણ એ ઉપરાંત ‘ડોલરવહુ’, ‘મહાશૈતા’ અને ‘દ્વંદ્વ’ એ પણ એમની સાહિત્યકૃતિઓ ગુજરાતીમાં પ્રાય છે.

‘સંભારણાંની સફર’ના લેખો ‘ગુજરાત સમાચાર’ની રવિપૂર્ત્તિમાં પ્રગટ થયા ત્યારે જ અત્યંત લોકપ્રિય બનેલા અને તેમાંથે શ્રી સોનલ મોદીએ કરેલો આ સહજ સરળ ભાવાનુવાદ એટલો તો સુંદર છે કે આ કૃતિ અનુવાદ છે તેવો અનુભવ વાચકને થતો નથી. જાણો મૂળ ગુજરાતીમાં જ લખાયું હોય. તેનું સહૃદી આકર્ષક અંગ હોય તો તેની સહજતા છે. આમ મૂળકૃતિ અને અનુવાદકલા બન્ને દસ્તિએ આ એક આસ્વાદી કલાકૃતિ બની રહે છે.

લેખિકા પોતે ઉચ્ચ કારકિર્દી ધરાવતી અને અત્યંત પ્રતિભાશાળી વ્યક્તિ ઉપરાંત ભારત સોઝરવેર ક્ષેત્રે હરણક્ષણ ભરાવી દુનિયાના નકશા પર મૂકનાર ઇંફોસીસ કંપનીના સ્થાપક અને ચેરમેન એવા શ્રી નારાયણ મૂર્તિનાં પત્ની હોવા છતાં સમાજના સામાન્યમાં સામાન્ય માનવીને સ્પર્શી જાય તેવી સરળ, સહજ, નિરાંબર, સાદગીભરી એમની કલમે ગુજરાતમાં જ નહીં, અનેક પ્રદેશોના વાચકોનું દિલ જીતી લીધું છે. કેમ કે આ પુસ્તકના અનુવાદો મરાઠી, કન્નડ, હિન્દી તથા તમિલ ભાષાઓમાં થઈ ચૂક્યા છે. લેખિકા કેટલા આત્મવિશ્વાસથી કહે છે, “ખરેખર સારી વાર્તાને ભાષાની સીમાઓ નડતી નથી.” આવી ભાષાની સીમાઓને ઓળંગીને મનુષ્યની સંવેદનાને સીધો સ્પર્શ કરતી આ કથાઓ છે પણ એ વાર્તાઓ કથાઓ છે. એનું સાહિત્યસ્વરૂપ નવલિકા કરતાં જરા જુદુ છે.

લેખિકા જાણો કોઈ ચોક્કસ જીવનદર્શનને નજર સમક્ષ રાખીને આપણા રોજબરોજના જીવનમાં બનતી તદ્દન સામાન્ય લાગતી ઘટના કે પાત્રોને પકડીને આ કથાઓ લખે છે. તેની કથાવસ્તુ સામાન્ય જીવનની સહજ ઘટના છે. તેમ તેનાં પાત્રો

આપણી આસપાસ જીવતા આપણી જેવા જ અને ક્યારેક તો જાણે આપણે પોતે જ હોઈએ એવા માણસો છે. જે અસામાન્ય છે તે તો આ સામાન્ય પરિસરમાં રહ્યા રહ્યા તેનું નિરીક્ષણ કરી લેખિકાએ જે પ્રગટ કરી છે તે પોતાની જીવનદિની છે, જીવન વિષેની સમજજા છે. જે કરોડો લોકોને સુખશાંતિથી જીવવાની એક સીધી અને સ્પષ્ટ કેરી દોરી આપે છે.

મૂળ અંગેજુ પુસ્તકનું શીર્ષક જુદું છે. જે વાર્તા પરથી છે તે આ કથાઓની પહેલી અને કદાચ સર્વશ્રેષ્ઠ કથા છે. મારાં દાદીમારે મેં કેવી રીતે વાંચતાં શીખવ્યું અને બીજી વાતો – તેનો ભાવાનુવાદ કરતાં સોનલ મોદીએ તેને ‘સંભારણાંની સફર’ એવું અત્યંત કલાત્મક શીર્ષક આપ્યું છે. ‘સંભારણાંની આ સફર છેક બાળપણથી શરૂ થાય છે. બાળપણની મુખ્યાવસ્થા, દાઢા, દાદી, ઝણિયા સામેનો ઓટલો, ગામનો ચોરો, ગામડાની એ લાઈબ્રેરી અને દાદાને મનોમન આપેલું વચન; જેમાંથી પછી અનેક ગામડાંઓમાં લાઈબ્રેરી ઊભી કરી અને પછી તો જે સેવા-ભાવનું આપ્યું વટવૃક્ષ પાંગર્યું તેના મૂળમાં આ સત્ત્વશીલ કુંઠબના સંસ્કાર છે. બધા જ પ્રસંગોએ કોઈ ને કોઈ સાથેનું સંભારણું બનીને એ વટવૃક્ષની વડવાઈઓ બની રહે છે એવો સહજ તેનો વિકાસ અને વિસ્તાર છે.

દરેક કથાનું કથાનક પહેલી દિનિએ તદ્દન સહજ પ્રગટ થયું હોય, કદાચ સત્યઘટના પણ હોય એમ લાગે, ત્યાં સુધીની ચોટ ઉપજાવે તેવું છે જે ભાવકના ચિત્તમાં સીધું ઉિતરી જાય છે.

દરેક કથાનું વિષયવસ્તુ ટૂંકું, સચોટ, હૃદયસ્પર્શી અને સર્વાગસંપૂર્ણ છે. ભાવનું નિરૂપણ, વિકાસ, ગતિ, પરાકાણ અને ચમત્કૃતિપૂર્ણ અન્ત, આવા કલાઅંશોને કારણે એ નવલિકાની નજીક છે, તો બીજી તરફ એ સ્મૃતિચિત્રો કે ચરિત્રલેખો તરીકે પણ એવા જ સુંદર છે. તેમાં વધારે આસ્વાદ્ય આ સ્મૃતિચિત્રો બન્યાં છે.

પહેલી જ કથા ભાબુ (દાદીમા)ને ભાણવ્યાં એ કથામાં લેખિકા વૃદ્ધાવસ્થાએ પહોંચેલ દાદીમાની ઈચ્છાને માન આપી તેને પ્રેમથી ભણાવે છે તે કથાનો અંત કેટલો કલાત્મક અને સૂચક છે ! પૌત્રીને શિક્ષક રૂપે માન આપી તેના ચરણસ્પર્શ કરતાં, ભણવાથી કોઈ અપૂર્વ સ્વતંત્રતાનો અનુભવ કરતાં દાદીમા એમની પાસે અક્ષરશ્વાન ન હતું પણ શાસ્ત્રજ્ઞાન કેટલું હતું ! પૌત્રીને ચરણસ્પર્શ કરતાં એ કહે છે. “આપણાં વેદપુરાણમાં તો કહ્યું જ છે કે શિક્ષકની જાતિ, ધર્મ કે ઉમર ન જોવાય. તેમના શાનને માન આપવું, ઉમરને નહીં. લેખિકા આમ બાળપણથી જ એક સફળ શિક્ષક બન્યાં. તેના પહેલાં શિષ્યા દાદીમા – એ શિષ્યાએ આપેલું પ્રમાણપત્ર પણ કેવું છે ! એ કહે છે “આટાં ટૂંકા સમયમાં તે મને લખતી-વાંચતી કરી... અને હા, ખૂબ પ્રેમથી. જરાય લઢ્યા વગર. હવે હું સ્વતંત્ર છું.” આ શાબ્દો, આ પ્રમાણપત્ર એ આ પુસ્તકમાં આવતી

દરેક કથામાં લેખિકા માટે, તેની જીવનપદ્ધતિને સમજવા માટે એટલું જ સાચું છે. બધી જ કથાઓમાં લેખિકા જે કોઈ સ્વરૂપે આવે છે પછી એ પૌત્રી હોય, મિત્ર હોય, શિક્ષક હોય, વિદ્યાર્થીની હોય માતા હોય કે સહયાત્રી હોય. પોતાની સાથેના પાત્રને એ જીવનનો કોઈ ને કોઈ પાઠ ભાગાવીને જ રહે છે. હા, અત્યંત ટૂંકા સમયમાં : જીવનદર્શિને અત્યંત લાઘવથી પ્રગટ કરતી આ કલા એ એમની શૈલીની નોંધપાત્ર વિશેષતા છે. દાદીમાને તો લખતાં-વાંચતાં કર્યા પણ કંઈ-કેટલાંયને જીવન અને સૃષ્ટિનું સૌંદર્ય જોતાં કર્યા અને તેથી પાછું પ્રેમથી, જરાય લઢ્યા વગર – જેના પરિણામે સ્વતંત્રતાનો, મુક્તિનો અનુભવ મારાં દાદીમાને જ નહીં, કંઈ-કેટલાંયે પાત્રોને અને સંવેદનશીલ વાચકોને આ કથાઓ વાંચ્યા પછી એવી સહજ, સરળ, પારદર્શક જીવનદર્શિ મળે છે કે જે તેને મુક્તિનો, સ્વતંત્રતાનો કોઈ અપૂર્વ અનુભવ કરાવે છે. સા વિદ્યા યા વિમુક્તયે । આ સિદ્ધિ નાનીસૂની નથી.

બાળપણથી જ લેખિકાનું જીવનલક્ષ્ય બહુ સ્પષ્ટ છે. દુનિયામાં બહુ થોડા માઝસો આટલી સભાનાનતાથી જીવતા હોય છે. તેનું દાખાંત “દાદા તમે ખુશ તો છો ને ?” એ સ્મૃતિકથામાં છે. આ કથામાં દાદા લેખિકાને કવિતાની પૂર્તિ કરવા એક કાવ્યપંક્તિ આપે છે અને કહે છે કે આની પૂર્તિ કર પંક્તિ છે –

જો પ્રભુ મને પદ્ધી જેવી પાંખ દે તો...

હવે લેખિકાને પાછપૂર્તિ તો આવડે છે પણ એથી વિશેષ કશુંક તેની પાસે છે અને તે તેની કલ્યાના – એ અદ્ભુત છે. એ જવાબ આપે છે :

“તો હું પડોશના ગામે જઈને ત્યાંની લાઈબ્રેરીમાંથી ઘણીબધી ચોપડીઓ વાંચી કાઢું... આ કલ્યાનમાં બાળકીનું ભવિષ્ય વંચાય છે. તેની રોગરગમાં શાનંંખના ભરી છે. પછી તો એ દાદાને કવિતાનો ઉત્તરાર્થ પણ કહી સંભળાવે છે. પરંતુ તેની મૌલિક કલ્યાના અને જીવવાની સભાનતા તો બાળપણથી જ દેખાય છે.”

શાનની આ પિપાસા – જીવન વિશેની આ સભાનતા ઉત્તરોત્તર પ્રગટ થતી રહે છે. અભ્યાસકાળ દરમિયાન M.Sc.નો અભ્યાસ પણ હજુ તો ચાલુ હતો ત્યારે જે ખમીર બતાવ્યું છે તે અદ્ભુત છે. નોટિસ બોર્ડમાં એક જાહેરખબર જોઈ – તાતા મોટર્ટરની કંપની જેમાં પોતાની બધી જ લાયકાત હતી પણ છેલ્યે લખ્યું હતું... “યુવતીઓએ તેસરી લેવી નહીં” આ છેલ્ટી નોંધ વાંચી અને લેખિકાએ જે આધાત અનુભવ્યો તેમાંથી એક અદ્ભુત નીડર, નિખાલસ, પ્રભાવશાળી વ્યક્તિત્વ પાંગર્યું જેણો જ્યાં સ્ત્રીઓને કદી કામ નહોતું મળતું તે સ્થાન મેળવ્યું, દીપાલ્યું અને જે આર.ડી. તાતા જેવા મહાનઉદ્યોગપતિનો પ્રેમ અને વિચાર પ્રાપ્ત કર્યા – ભવિષ્યની પેઢી માટે વિકાસની એક દિશા ખોલી આપી. આ પથરમાંથી પાણી કાઢવાનો પુરુષાર્થ જેનામાં છે તે કંઈ-

કેટલાંય સુષુપ્ત જીવનમાં પ્રાણનો સંચાર કરે છે ? તે કથાઓ માણવા જેવી છે.

દાદા, દાદીની કથાઓ ઉપરાંત બીજી કેટલીક જીવનના અમૃત્ય પ્રસંગોને આવેખતી સત્યકથાઓ જેવી છે. મજાની વાત એ છે કે તેમાં લેઝિકાનું અને સામેના પાત્રનું બન્નેનું વ્યક્તિત્વ અત્યંત સાહજિકતાથી સુરેખ આકાર પામ્યું છે. દા.ત. “મા તારી કેઈ ફરજ નથી ?” પુત્રી સાથેની એ કથામાં લેઝિકા શિક્ષક નથી પણ નાની પુત્રીનો પ્રશ્ન તેના જીવનને નવો વળાંક આપે છે. જ્યાં ઉત્તમ પડવું છે તેને પામવા એ શિષ્યા બની જાય છે. આ દસ્તિએ તેની પાત્રાવેખનકલા નિહાળીએ તો “અભૂત કલામ સર, સલામ”, “આપરો જે.આર.ડી.” વગેરે ઉત્તમ ચરિત્રકથાઓ છે જે અનેકપરિમાણી છે.

મને લાગે છે કે લેઝિકાને દરેક કથામાં જીવનનું કોઈ એક સત્ય, સમજજા પ્રગટ કરવામાં છે. એ શું છે એ પહેલેથી નક્કી થઈ ચૂક્યું છે. પછી એ વાતને ભાવકના ચિત્ત સુધી પહોંચાડવા એ જે કલાની રચના કરે છે તે કથાઓ જરા જુદા પ્રકારની રચનાઓ છે. તેમાં બે વિરુદ્ધ પ્રસંગો અથવા બે વિરુદ્ધ પાત્રો ગોઠવીને પોતાને જે કહેવું છે તે વાતને અસરકારક બનાવે છે. આવી કેટલીયે કથાઓમાં લેઝિકા પોતે કહે છે તેમ હકીકતમાં એ પોતાની કલ્યનાના રંગો ઉમેરે છે. આવી કથાઓ જાણે આયાસપૂર્વક એક બોધ આપવા લખાઈ હોય તેવું લાગે છે. દા.ત. સંતોષી નર સદા સુખી, It happens only in india, સૂરોલા સિંહના મૌંડામાં... વગેરે કેટલીક રચનાઓ આ પ્રકારની સાચાસ રચના છે. તેમાં નવલિકાનું સ્વરૂપ દેખાય છે. તેનો અંત પણ સચોટ અને ચમત્કૃતિપૂર્ણ હોય છે.

આ કથાઓની એક નોંધપાત્ર વિશેષતા એ છે કે તેમાં લેઝિકાએ નિરૂપેલ પાત્રનું વ્યક્તિત્વ જેટલું નિખરી ઊઠે છે એટલું જ લેઝિકાનું પોતાનું વ્યક્તિત્વ પણ અનાયાસ તેમાં મહોરી ઊઠે છે. નિરપવાદ રીતે દરેક કથામાં લેઝિકાનું પાત્ર એ સહુથી વધારે પાંગરી ઊઠે છે એ દસ્તિએ આ કથાઓ નવલિકા કરતાં જુદી પડે છે. વળી દરેક કથામાં એને કશુંક વિશેષ કહેવાનું છે - ભલે કલાના સ્વરૂપમાં પણ દર્શાન આપવાનું એ ચૂક્તાં નથી. ‘‘અય મેરે વતનકે લોગો’’માં કથાનો અંતે આપજા શિક્ષણમાં ઈતિહાસ કેમ ભણાવાય તેની કેવી સમજ આપી જાય છે !

અભૂત કલામની સાદગી, નભ્રતા અને ગરિમાના આવેખન સાથે તેને જરૂરવા સમર્થ લેઝિકાનું વ્યક્તિત્વ પણ ઓછું ગૌરવશાળી નથી.

વિષયવસ્તુનું લાઘવ અને સચોટતા, મૂર્તિમંત જીવંત પાત્રો વાતાવરણની તાજગી, ટૂંકા અને સચોટ સંવાદો, નિર્બધ વહેતો ભાષાપ્રવાહ, શૈલીનું માધુર્ય આ કૃતિઓને આસ્વાધ બનાવે છે.

સુધા મૂર્તિ - આમ તો મૂર્તિ એ એમની અટક છે. પરંતુ એમનાં લખાણો દ્વારા એમના વાચ્યકો માટે એ અનેક અર્થમાં, સુધાની મૂર્તિ બની ગયાં છે. જીવન અને

આહિત્યની સુધા મૂર્તિ તો છે જ પણ ભાષાની દણિએ જોઈએ તો અમૂર્તને જે મૂર્ત કરે તે મૂર્તિ. આ લખાણોમાં લેખિકા જે એક પાત્ર સ્વરૂપે પ્રગટ થાય છે તે સુધા મૂર્તિ એટલે આનંદ અને મસ્તીથી ઉછળતું એક વ્યક્તિત્વ.

એમાં આનંદનો ઉછળ છે તો સમજણના ઊંડાણ છે; માનવતાની, પ્રેમની અગાધ વ્યાપ્તિ છે તો કલાનો સંયમ પણ છે, આવા અમૂર્ત ભાવોને મૂર્ત કરતું લેખિકાનું પાત્ર પણ જે આ લખાણોમાં પાત્ર તરીકે પ્રગટ થયું છે તે આ કથાઓની એક અતિસુંદર, કલાત્મક, ઓજસ્તી આડપેદાશ છે. ચીલાચાલુ સ્વરૂપથી જુદી એવી આ કથાઓ એક અનોખું કલાસ્વરૂપ સર્જે છે.

જીવનનો એક ચિરંજીવ પ્રભાવ છોડી જાય છે જે કલાના ઓપ વિનાની, શુદ્ધ કલાના નિતાન્ત મધુર નમૂનાઓ બની રહે છે.

‘નૂરી’ની ગજલસૃષ્ટિ | ડૉ. એસ. એસ. રાહી

પ્રાણ્યમાં સાંપડેલી સરિયામ નિર્જળતા, વિષાદ-વેદના, વિહ્વળતા, અજંપો, અસંતોષ, લાચારી, મજબૂરી, બેબસી (અસર્મર્થતા), બેકરારી (વ્યકુળતા), બેખુદી (નિર્ભાનાવસ્થા), બેકદરી (અપમાન), જીવનની નિરર્થકૃતા તેમજ ઈશ્વર પ્રતેની પ્રીતિ અને શ્રદ્ધા જેવા વિધવિધ વિષયોનું પોતાની ગજલોમાં બળૂર્ક આલેખન કરનાર પરંપરિત ગજલકાર ‘નૂરી’ની ગજલો વિશે વાત કરવાનો અહીં ઉપકમ છે.

‘મજનૂ’, ‘શયદા’, ‘સગીર’, હસનઅલી નામાવરી, ‘આસિમ’ રાંદેરી, ‘સાબિર’ વટવા જેવા સિદ્ધહસ્ત શાયરોની પેઢી પછીના અને ‘અમીન આજાદ’, ‘મરીજ’, ‘ધાયલ’, ‘શૂન્ય’, ‘સૈફ’ની પેઢીના ગજલકાર ‘નૂરી’નો જન્મ ૨૫ માર્ચ ૧૯૧૭ના રોજ વતન જલાલપુર (નવસારી)માં થયો હતો. તેમનું પૂરું નામ મૂસા યુસુફ નૂરી. મેટ્રિક સુધીનું શિક્ષણ લીધા પછી તેઓ શિક્ષક બન્યા હતા. ત્યાર પછી મુંબઈના સમાચાર-પત્ર ‘જામે જમરેદ’ના તંત્રી વિભાગમાં જોડાયા હતા. માત્ર ૧૫ વર્ષની કાચી વયથી જ તેમજે ગજલસર્જનના બિસ્મિલ્હાહ કર્યા હતા. ‘વતન’, ‘બેગમ’, ‘અસુણોદય’, ‘ઈસ્માઈલી’, ‘મુંબઈ સમાચાર’ જેવાં સામયિકો-ફેનિકોમાં તેમની ગજલો પ્રગટ થતી હતી. તેમનો પ્રથમ ગજલસંગ્રહ ‘અવસર’ ઈ.સ. ૧૯૬૮માં મુંબઈથી પ્રકાશિત થયો હતો. જેમાં રૂબાઈઓ, નજીમો, મુક્તકો, તજમીન જેવી રચનાઓ સાથે ૧૨૪ ગજલો ગ્રંથસ્થ કરવામાં આવી છે. ૧૩ ફેબ્રુઆરી ૧૯૮૪ના રોજ તેમનું અવસાન થયું ત્યારપણી ૮૫ ગજલોનો બીજો સંગ્રહ ‘અવસર બીજો’ નામે ઈ.સ. ૨૦૦૦માં પ્રસિદ્ધ થયો હતો. ‘નૂરી’ની ગજલો ‘મધુવન’ (૧૯૬૧), ‘ગુજરાતી પ્રતિનિધિ ગજલો’ (૧૯૮૬) ‘ગુર્જર ગજલસંચય’ (૧૯૮૮) અને ‘અમર ગજલો’ (૨૦૦૭) જેવાં શિષ્ટ સંપાદનોમાં સંપાદિત થયેલ છે.

‘અવસર’માં ‘મરીજ’, બરકત વીરાળી ‘બેઝામ’, ‘સગીર’ અને ‘સૈફ’ પાલનપુરી જેવા મશહૂર શાયરોના આવકાર સાંપદ્ય છે તે બાબત પણ નોંધપાત્ર છે. ‘મરીજ’ લખે છે : “લાગડીશીલ હૈયાને મુખ કરી નાખે એવા અનેક શેર એમની ગજલોમાં મોજૂદ છે. નિષ્ઠળ પ્રણય, વહેવારિક આઘાત, સામાજિક અન્યાય તો કોઈ કેકાણે આધ્યાત્મિક નિર્દર્શન એમની ગજલોમાં સંચિત છે. આ અને એવા બીજા અનેક વિષયોનું નિરૂપણ એમણે ગજલના હાઈને સાચવીને કરેલું છે. એ એમની કલાનો વિજય છે અને તે બળ પર તેઓ પ્રથમ શ્રેણીના ગજલકાર લેખી શકાય.”

‘નૂરી’ના સમકાળીન શાયર બરકત વીરાળી ‘બેઝામ’ પણ ‘નૂરી’ને કઈ રીતે પોંચે છે તે જુઓ : “ ‘નૂરી’ માટે આશ્વર્યકારક ઘટના એ છે કે એ ગજલના કિશોરકાળના કવિ છે અને એમનાં કાંચ્યો ગજલના યૌવનકાળનાં છે. એમનો પ્રવેશ ગજલના બીજા યુગમાં થયો હતો, પણ એમનું પ્રતિનિધિત્વ ગજલના ત્રીજા યુગનું છે. વીતેલી પેઢીના વાતાવરણમાં એ ગજલો લખતા, પણ પછી સંજોગવશાત્ર ક્ષેત્રસંન્યાસ જેવી સ્થિતિ એમણે સ્વીકારી લીધી. પણ મૂળ શાયરનો જીવ એટલે વર્ષો પછી ફરી પાછો એમણે શાયરીનો સંસાર માંડ્યો અને ગજલસાહિત્યમાં પોતાનું સ્થાન મેળવી લીધું. એમની ગજલોમાં ગઈ કલાની અસર નથી, આજની અસર છે – આજનાં જ તાજાં ગુલાબ જેવી, એમના કૃતિત્વના પરિચયમાંથી આપણને એમના રસસુગંધની સભરતા જોવા મળશે.”

‘સગીર’સાહેબે ‘નૂરી’ને આશીષ આપતાં લખ્યું છે : “એમની ગજલોમાં મેં જોયું – ચમત્કૃતિની પ્રમાણભૂત વિશેષતા, પોતાના રંગને છેવટ સુધીની વજાદારી, ખટક વિનાની રવાનીમય લહેર, વિચારોની તલાશ, ભાવને રજૂ કરવાની કલા, સુસંગત થાય તેવા રસમય શબ્દો, વિચારને સ્પષ્ટ કરતી રચના, હદ્યના તારને ઝણઝણાવી મૂકે એવું દઈ, તગઝુલ અને તાજૈયુલનો સુમેળ. ‘અવસર’ એમની કાબેલિયતનું પ્રમાણપત્ર છે.”

તો ‘અવસર’ના પાછલા પૂંઠાં પર ‘સૈફ’ પાલનપુરીએ લખ્યું છે : “ગજલ-સાહિત્યનો આ યુગ મુશાયરા-યુગ છે અને ભાઈ ‘નૂરી’ મુશાયરાના શાયર નથી. એમની પાસે મુશાયરાને આનુષ્ઠાંકિક એવી અભિનયછટા નથી. અને એટલે જ તો આજ સુધીમાં કોઈ મુશાયરામાં એમને વિમાનનો ખર્ચ આપીને બોલાવવામાં આવ્યા નથી. પણ ભાઈ ‘નૂરી’ની ગજલસાધના મુશાયરાપ્રસિદ્ધિની ઓશિયાળી નથી. એ લખતા જ રહે છે, દિલની વાતો ગજલની આંગળી પકડીને દાલવતા જ રહે છે. ગુજરાતી ગજલસાહિત્યનો જ્યારે કોઈ તટસ્થ યુગ આવશે ત્યારે ગજલના એ મતવાલાઓની અંજુમનમાં એક જામ પર ‘નૂરી’નું નામ પણ મોટા અક્ષરે કોતરાયેલું હશે, એ નિર્વિવાદ છે.”

ગજલકાર તરીકેની ‘નૂરી’ની પ્રતિભા કેવી હતી, તેમની ગજલોનો દરજાઓ કેવો હતો તે જાણવા-નાણવા આ અવતરણો પૂરતાં છે તેવો મારો પણ દંડ વિશ્વાસ છે.

આ પ્રતિભાશાળી શાયરની દર્દીલી બાનીમાં હવે લટાર મારી તેનો રસાસ્વાદ કરીએ.

પ્રેમ એ તેમની ગજલોનો મુખ્ય રંગ છે. વળી તગફ્રજુલ તેમને હથવગું છે તેનું પ્રમાણ આપત્તા આ શો'ર જુઓ :

ઘણી સહેલાઈથી પાલવ પડાવીને તમે ચાલ્યા,
ઘણી મુશ્કેલીઓ વેઠી હતી, એ પામવા માટે.

*

તમે હતા તો હતું ઘરમાં કંઈક ઘર જેવું,
તમે ગયા તો નથી રહી શક્યું આ ઘર ઘરમાં.

*

તમારો પ્રેમ નથી એકલો કસોટી પર,
અમારી જિંદગી આખી અહીં સરાણે છે.

ઉપરના શો'રમાં વપરાયેલો 'સરાણે' જેવો કાફિયા આ પહેલાં કે પછી ગજલમાં કોઈએ આબાદ વણી લીધો હોય એવું મારી જાણમાં નથી. ગુજરાતી ગજલનો વળાંક પ્રસ્તુત શો'રમાં શું નથી જોવા મળતો ?

ગજલની બાંધણી અને સજાવટ પ્રત્યે 'નૂરી' પૂરા સભાન હતા. એમાં જ્યારે બેચેની અને બેકરારી ભણે છે ત્યારે તેમની પાસેથી આવા શો'ર મળે છે :

પારિસ્થિતિ હવે પહોંચી ગઈ છે ક્યાં સુધી જોજો !
ગમે તે આવતું હો પણ તમારું આગમન લાગે.

*

નાહક સમયને રૂઝનું ગૌરવ મળી ગયું,
નહિતર કોઈનો હાથ હતો સારવારમાં.

*

ગુજરાતી ગજલોમાંથી મારે ૧૦૧ શો'ર બેંચી કાઢવા હોય તો 'નૂરી'નો નીચેનો શો'ર હું બેધડક અગ્નિયારમા કરે મૂકું :

નજર લાગી જવાપો જેમને ડર હોય છે 'નૂરી';
હું બંધ આંજો કરીને એમનાં દર્શન કરી લઈ છું.

જીવન અને મૃત્યુ વિશેનું તત્ત્વજ્ઞાન તો ઘણા શાયરોએ શો'રમાં દાખ્યું છે પણ 'નૂરી'સાહેબનો અંદાજ-બયાં (રજૂઆતની શૈલી) બેમિસાલ છે. આ શો'ર પાસે જરા અટકી જુઓ :

જિંદગીભર જેમને સંકોટીને રાખ્યા હતા,
એ પગો છેવટ કફનમાં 'નૂરી' લંબાવી ગયો.

જીવનની વિષમ પરિસ્થિતિમાં કંધ આપવા કોઈ તૈયાર હોય તો તેનું નામ છે મૃત્યુ. આ ફિલ્મસૂઝીને શે'રના રંગમાં ઢાળી 'નૂરી'એ કમાલ કરી બતાવી છે. 'સંકોરી' જેવું સર્કર્ખ કિયાવાદ અહીં આગંતુક નથી લાગતું. કેવળ ભાવ નહીં પણ ભાષા પાસેથી કામ કઠાવવાની 'નૂરી'ની આવડત આ શે'ર દર્શાવી આપે છે.

ઇહું દાયકો ગુજરાતી ગજલના વિકાસનો દાયકો હતો તેમ મુશાયરાપ્રવૃત્તિના અતિરેકનો પણ દસકો હતો. મુશાયરાથી લગભગ દૂર રહેલા 'નૂરી' તો કેવળ ગજલસાધનામાં જ રત હતા. તેમની ગજલ પ્રત્યેની નિષ્ઠા અને તલપને લીધે જ આવા શે'રનું અવતરણ થયું હશે :

કોણ જાણી શકે દરદ મારું ?

મુજથી પણ કેટલું એ છાનું છે ?

*

નિરખી લીધા છે તમને હજારો વખત છતાં,
દિલને તરસ છે એની એ, આંખોને ખાસ છે.

*

તમારી જ તસવીર એમાં ઉડી,
અમસ્તી જ રેખાઓ દીરાઈ ગઈ.

'નૂરી' પાસેથી રિન્ડાના કલામની છાબ પણ મળે છે ! 'સાકી' રદીફ પરની ગજલના નીચે ટંકેલા શે'રની છાય માણવા જેવી છે :

નશામાં આ પગો અથડાય તો એની નવાઈ શું ?

કે શુદ્ધિમાંય લોકો કંઈક ઠીકર ખાય છે સાકી !

મહિચા ન પીવાની તૌબા કરવા કરતાં નશો લાખ દરજજે સારો એવું નિવેદન તો 'નૂરી' જ કરી શકે ! નીચેના શે'રને મમળાવશો તો આ વાત સ્વયંસ્પષ્ટ થઈ જશે :

મહિચાએ મને આવો અહુકારી કર્યો ન્હોતો,
નશો કરી એટલો આહિદ ! મને લાગે છે તૌબામાં.

'સાકી', 'સંબંધ', 'હરીફ', 'અંધકાર', 'નજર', 'દુનિયા', 'મજા', 'દોસ્ત', 'ગાંડ', 'યાદ', 'દિન', 'રસ', 'પગલાં', 'થાક', 'જીવન', 'શોભા', 'રસ્તો', 'ઓથ' જેવા એકશબ્દી રદીફ પર લખાયેલી મુસલસલ (ભાવસાતત્યપૂર્ણ) ગજલો પણ 'નૂરી'ના ફલમાં જોવા મળે છે. કોઈ સંશોધકને નવી અને આધુનિક ગજલનાં મૂળ 'નૂરી'ની આ પ્રકારની ગજલોમાંથી મળી આવે તો નવાઈ નહીં !

સામે પક્ષે 'ક્રાં છે ?', 'મુકદરની વાત છે', 'રહ્યો છું હું', 'થઈ જાએ', 'આતો જાઉ છું', 'કોણ માનશે ?', 'યાદ આવે છે', 'નથી હોતી' જેવા પ્રલંબ રદીફ પરની ગજલો પણ 'નૂરી' પાસેથી મળી આવે છે. આ રદીફ પર તેમના ગાળાના શાયરોએ

પણ ગજલો લખી છે છતાં આ રદ્દીનું પર લખાયેલી કેટલીક ગજલોમાં ‘નૂરી’ની સ્વકીય મુદ્રા ઉપસ્તી આવે છે.

ગજલનો મત્તલાં (પ્રથમ શે’ર) તો ભલભલા શાયરની કસોટી કરાવે છે. ‘મરીજ’ પાસેથી આપણને નોંધપાત્ર મત્તલાંના શે’ર મળ્યા છે. તેમ ‘નૂરી’એ પણ કેટલાક ચોટડુક મત્તલાં બેશક આપ્યા છે. ગજલના અભ્યાસીઓનું ધ્યાન તે તરફ જાય તે માટે થોડાક અહીં ઉતારેલ છે :

કેટલા ગમ પી ગયો છું છું ખુશીના ખ્વાબમાં !

કંટકો ચૂમી લીધા છે મેં કળીના ખ્વાબમાં !

*

તમારા રાહમાં બસ એક વેળા નામ થઈ જાએ,
પછી આ જિંદગી આખી ભવે નાકામ થઈ જાએ.

*

એવું તો કયાં છે, તારો ખ્યાર નથી !

એ ખસું છે, કે ઈન્નેજાર નથી..

*

એક સરખા લાગે છે એ મુજથી બેપરવા મને,
કે હે કહેતા નથી કોઈ વિષયમાં ના માને.

*

તારી નજર વિશાળ છે એની તો ના નથી,
દુઃખ એ જ છે કે એમાં અમારી જગ્યા નથી.

*

જરાક કીધી હતી એમણે નજર ઘરમાં,
દીવાલનેય થઈ ગઈ હતી અસર ઘરમાં.

ગજલના નાજુક મિજાજની આછેરી જલક ‘નૂરી’ની ઉપર્યુક્ત શે’રસૃષ્ટિમાં પામી શકાય છે.

‘નૂરી’ના કેટલાક સંગાથી શાયરોની જેમ ‘નૂરી’ પોતાની ગજલોમાં બધા જ કાણ્દિયા વાપરી નાખવાના મોહમાં સરી પડ્યા નહોતા તે તેમનું જમાપાસું ગડી શકાય. વળી તેમની ગજલો ૧૧ થી ૧૫ શે’ર સુધી ધસમસતી નથી તે તેમનો શાયર તરીકેનો સંયમ પણ દર્શાવે છે.

વિરક્ષિત, ઉત્સુક, નિશ્ચિત, પ્રકાશિત, પરિચિત, પરિસ્થિતિ, સુવાસિત, નિર્દોષ, નિષ્ફળ જેવા ચલણી શબ્દોનો ‘નૂરી’એ પોતાની ગજલોમાં છૂટથી ઉપયોગ કર્યો છે તો ઉર્દૂ-ફારસી શબ્દો પણ બેશુમાર વાપરી જાણ્યા છે. કઝા, વઝા, ફલક, રાહબર, નિગાહ,

વાકેફ, બેકરાર, ફિદા જેવા જાણીતા બની ગયેલા શબ્દોનો તેમણે સફુપ્યોગ કર્યો છે તો મગફેરત, તકરીર, તદભીર, સરકશી, મુન્તકિર, બેનજીર જેવા અધરા શબ્દો બાધારૂપ ન નીવડે એવી સહજતાથી ગુંઠી લીધા છે. જે તે ગજલ નીચે અધરા શબ્દોનો અર્થ મૂરી આપી ભાવકોની ચિંતા દૂર કરી આપી છે.

ગજલની વિવિધ બહરનો 'નૂરી'એ ઉપયોગ કર્યો છે. પણ મુત્કારિબ અને હજા જેવી અનુકૂળે ૨૦ માત્રા અને ૨૮ માત્રાની બહરમાં તેમણે જાહેરી ગજલોનું સર્જન કર્યું છે. બહરની શિસ્તનું 'નૂરી'એ બરાબર પાલન કર્યું છે એમાં કોઈ શંકા નથી.

ગુજરાતી ગજલની પરેપરાને નિભાવનાર અને નિખારનાર 'નૂરી'સાહેબની ગજલો પોતીકી મુદ્રા અને ક્રોવત ધરાવતી હોવાથી ગજલસાહિત્યમાં બેનમૂન ઉમેરારૂપ બની રહે છે.

મહાન સાહિત્યકારોની શોધમાં : નોબેલ પારિતોષિક-વિજેતાઓ પર

એક અભ્યાસ ભાગ-૨ | પ્રદીપ ખાંડવાળ

આ લેખના પહેલા ભાગમાં સાહિત્યના નોબેલ પારિતોષિકના ૧૦૭ વિજેતાઓની સંક્ષિપ્ત જીવનકથાઓને આધારે થોડાંક તારણો પ્રસ્તુત કર્યા હતાં. બીજા ભાગમાં જે કારણોને આધારે એમને ઈનામ મળ્યાં હતાં એનું વિશ્વેષણ ૨જૂ કરું છું.

સ્વીડનની અકાદમીનાં ધોરણોની ખોજ

મારે જાણવું હતું કે કયાં ધોરણોને આધારે સ્વીડનની અકાદમી વિજેતાઓ ચૂંટતી હતી. આલ્ફેડ નોબેલના વસિયતનામામાં કોને પારિતોષિક આપવું એનો નિર્ણય થયો છે : સાહિત્યમાં સૌથી આગવું કામ આદર્શ દિશામાં કર્યું હોય તેને. પણ આદર્શ દિશા એટલે શું તેની કોઈ વ્યાખ્યા નથી આપી. એટલે કે બદલાતા સંજોગોમાં અકાદમીને આનું સંજોગવશાત્ર અર્થઘટન કરવું પડ્યું છે.

સ્વીડનની અકાદમીની ઈનામ એનાયત કરવાની પદ્ધતિ રસપ્રદ છે. દર વર્ષે સ્વીડનની અકાદમી દેશદેશાવરની સાહિત્યસંસ્થાઓ અને નામાંકિત અભિજ્ઞો અને વિવેચકોને નામો સૂચવવા વિનંતી કરે છે. આ પ્રક્રિયાથી પચાસેક નામો સૂચવાય છે. અકાદમીની નોબેલ કમિટી આ નામોને તપાસે છે અને છેવટે પાંચેક નામોની ટૂંકી યાદી તૈયાર કરે છે. આ પછી આ પાંચેનાં સર્જનો ઝીણવથી તપાસાય છે. તે પછી અકાદમીના સભ્યો વોટિંગ કરે છે અને જેને અધારી વધુ વોટ મળ્યા હોય એને વિજેતા તરીકે અકાદમી ઘોષિત કરે છે. પારિતોષિક સાથે લગભગ તુપિયા સાઈ લાખનો ચેક વિજેતાને હાલમાં મળે છે.

નોબેલ પારિતોષિક જગતનું સૌથી પ્રતિષ્ઠિત ઈનામ છે એટલે સ્વીડનની અકાદમીએ અપનાવેલાં ધોરણોથી જ્યાલ આવે કે કર્દી જતના સાહિત્યકાર મહાન ગણધ્ય

છે. આમ તો કોઈ જડ ધોરણો અકાદમીએ પ્રતિષ્ઠા નથી કર્યા પણ શા માટે પારિતોષિક-વિજેતાને મહું એનાં કારણો તે ટૂંકમાં આપે છે. આ કારણોના કંટેટ એનાલિસની પદ્ધતિ અપનાવી મેં ધોરણો શોધી કાઢવાનો પ્રયાસ કર્યો. આ પદ્ધતિમાં ચાવીરૂપ શબ્દોનું વિશ્વેષણ કરી ધોરણોનું વર્ગીકરણ કરી શકાય છે. આવા વિશ્વેષણ દ્વારા નીપણતાં ધોરણો જોતાં એવું લાગ્યું કે ધોરણો બે ભિન્ન પ્રકારમાં વહેંચી શકાય. ભાષા કે શૈલીસામર્થ્ય ધોરણો અને વસ્તુ કે તત્ત્વસામર્થ્ય ધોરણો. બન્ને જાતાં ધોરણોમાં પેટાવર્ગો નિપણાયા. સંક્ષેપે, અપનાવેલી પદ્ધતિ નીચે પ્રમાણે હતી.

શૈલીરૂપી સામર્થ્યનાં ધોરણો :

1. લેખનીની કલાત્મકતા (artistry), જેના મુખ્ય ચાવીરૂપ શબ્દો હતા બારીકાઈ, કુશળ કારીગરી, મોહકતા (grace), અદ્ભુત ગૂંથણી.
2. લખાણની કાવ્યાત્મકતા, જેના મુખ્ય ચાવીરૂપ શબ્દો હતા ઉર્ભિશીલતા, કાવ્યાત્મક રચના, ગેય ભાષા, હંદિયજન્યતા (sensuousness), સંવેદનશીલતા, સુંદરતા, અને કાવ્યાત્મક તરંગ.
3. સ્યાષ્ટતા, જેના મુખ્ય ચાવીરૂપ શબ્દો હતા લખાણની સ્યાષ્ટતા.
4. તેજસ્વિતા, જેના મુખ્ય ચાવીરૂપ શબ્દો હતા તેજસ્વી રચના.
5. વૃત્તાંતબળ (narrative power), જેના મુખ્ય ચાવીરૂપ શબ્દો હતા વૃત્તાંત-કુશળતા, ઉંઘીલ અને બલિષ પ્રદર્શન, શક્તિશાળી લખાણ, અને વૃત્તાંત-કૌશલ્ય.
6. વિનોદવૃત્તિ, જેના મુખ્ય ચાવીરૂપ શબ્દો હતા વંગ, વિનોદ, ચતુરાઈ, વકોક્તિ.

તત્ત્વરૂપી સામર્થ્યનાં ધોરણો :

1. મૌલિક વસ્તુ : જેના ચાવીરૂપ શબ્દો હતા મૌલિકતા, સર્જનાત્મકતા, વિચારોનું પુરુષત્વ, નવા તબક્કાની શરૂઆત કરતું લખાણ, સાહસિક, ચીલાચાતરુ લખાણ, નાવીન્યસભર લખાણ, સાહિત્યના નવા પ્રકાર જેડતું લખાણ.
2. માનવીની સમસ્યાઓનું નિરૂપણ જેના મુખ્ય ચાવીરૂપ શબ્દો હતા માનવીના પ્રતિકાર, બળવા અને હાર, વંચિતોનું આલેખન, વિભાજન થયેલી માનવતા, સમાજનો આકાંત આત્મા, જુલમ, સામાન્ય વાતચીત ભીતરની ખાઈઓ, સમાજના હાસ્યાસ્પદ રૂઠિગ્રસ્ત વાક્યપ્રયોગો અને એમની લોકને તાબે કરવાની શક્તિ, સત્તાનો દુરુપયોગ માનવીની નિર્ધનતા વગેરે.
3. ઉત્કર્ષલક્ષી લખાણ જેના મુખ્ય ચાવીરૂપ શબ્દો હતા આદર્શવાદ, આધ્યાત્મિકતા, મૂલ્યોનું વર્ધન, માનવજાતને ફાયદો કરતું લખાણ, નૈતિક શક્તિ, માનવીની અશક્તિઓ માટેનું સંવેદન.

૪. મોટા ફ્લકવાળું ‘epical’ લખાણ જેના મુખ્ય ચાવીરૂપ શબ્દો હતા દસ્તિનો ક્યાસ, એપિકલ લખાણ, ચિરસ્મરણીય, વિશાળ દાખ્ય-શક્તિવાળું લખાણ, બહોળી ક્ષિતિજો અંબતું લખાણ, બહોળો સાંસ્કૃતિક પરિચેક કે પરિચય.
૫. યથાર્થવાદી લખાણ (Realism), જેના મુખ્ય ચાવીરૂપ શબ્દો હતા દેશના આત્માને વ્યક્ત કરતું લખાણ, વર્ચસ્વનું માળાણું, વાસ્તવવાદી લખાણ સમાજનું વર્ણન, આપણા સમયનું વર્ણન, સમાજને આયનો ધરતું લખાણ સટકી જતું વાસ્તવ.
૬. સત્ત્યનિષ્ઠ લખાણ જેના મુખ્ય ચાવીરૂપ શબ્દો હતા સત્ત્યપ્રેમ, અસલિયતવાળું લખાણ, અ-ભાઈ પરબ આપતું લખાણ.
૭. પરંપરા-કેંદ્રિત લખાણ જેના મુખ્ય ચાવીરૂપ શબ્દો હતા મહાન પ્રણાલીને અનુસરતું કાર્ય, પ્રણાલીનો ઉપયોગ કરતું લખાણ, દેશની પરંપરાઓ અને ગુણાદોષો આદેખતું લખાણ,
૮. ઐતિહાસિક દસ્તિકોણ ધરાવતું લખાણ જેના મુખ્ય ચાવીરૂપ શબ્દો હતા દબાવી દીવીલા ઐતિહાસને ઉજાગર કરતું લખાણ, ઐતિહાસનું બર્બર દબાણ, ભુલાઈ ગયેલા ઐતિહાસને વ્યક્ત કરતું લખાણ, ઐતિહાસિક સંદર્ભ.
૯. મુદ્રાઓનું ઊંડું વિશ્વેષણ કરતું લખાણ જેના ચાવીરૂપ શબ્દો હતા વિશ્વેષણીય સામર્થ્ય, વસ્તુનું ઊંડાણ.
૧૦. વૈવિધ્યપૂર્ણ સર્જન જેના ચાવીરૂપ શબ્દો હતા વૈવિધ્ય, બહુમુખી સર્જન.
૧૧. જીવનની ઉજવણી કરતું સર્જન જેના ચાવીરૂપ શબ્દો હતા જીવનને ઊજવતું સર્જન, વિવિધ શક્તિઓથી સભર અને અજ્ય માનવમિજાજ, સામાન્ય બનાવોને ઉત્કૃષ્ટ કરતું લખાણ.
૧૨. દંતકથા કે બોધકથા વડે મુદ્રાઓને ઉજાગર કરતું લખાણ જેના મુખ્ય ચાવીરૂપ શબ્દો હતા દંતકથાઓની વૈશ્વિકતા, દાખાંતકથા, દંતકથાઓથી ઉજાગર થતી માનવવિટંબણાઓ, બોધકથાથી સમજાતી આમિક વસ્તુસ્થિતિ.
૧૩. મનોવૈજ્ઞાનિક દસ્તિકોણ જેના મુખ્ય ચાવીરૂપ શબ્દો હતા મનોવૈજ્ઞાનિક વર્ણન, મનોવૈજ્ઞાનિક સૂર્ય.
- એક દાખલાથી પદ્ધતિ વધુ સ્પષ્ટ થશે. પોર્ટુગાલના હોસે સારામાગોને નોબેલ પારિતોષિક ૧૮૮૮માં મળ્યું હતું સ્વીડનની અકાદમીએ કારણ આ પ્રમાણો દર્શાવ્યું હતું : “...જેણે કલ્યાનાશક્તિ, સંવેદના અને વકોક્ષિતથી પોષાયેલી દાખાંતકથાઓ વડે આપણને ફરી એક વાર સટકી જતા વાસ્તવને સમજવામાં મદદ કરી છે.” આમાં ચાવીરૂપ શબ્દો છે : કલ્યાનાશક્તિ, સંવેદના, વકોક્ષિત, દાખાંતકથા, અને સટકી જતું વાસ્તવ. ઉપર દર્શાવીલા વર્ગીકરણ પ્રમાણો લખાણની કાવ્યાત્મકતામાં અને વકોક્ષિત-યુક્ત વિનોદમાં

શૈલી-સામર્થ્ય પ્રગટ થાય છે, જ્યારે વસ્તુ-સામર્થ્ય ત્રણ વર્ગોમાં પ્રગટ થાય છે – મૌલિક વસ્તુ, યથાર્થવાદ, અને હંતકથાનો મુદ્દાઓ ઉજાગર કરતો ઉપયોગ.

ઉપર દર્શાવેલા ૧૮ વર્ગોમાં સ્વીડનની અકાદમીએ મૌલિક વસ્તુ, માનવીની સમસ્યાઓનું નિરૂપણ, લખાણની કાવ્યાત્મકતા, આદર્શવાદ, મોટું ફ્લેક, વૃત્તાંતબળ, કલાત્મકતા અને યથાર્થવાદી લખાણનો સૌથી વધુ ઉપયોગ કર્યો છે. આ ૮ વર્ગો મહાનતાની મુલવણી માટે અકાદમીને પાચારૂપ લાગ્યા લાગે છે, જોકે એનો અર્થ એ નથી કે બધા વિજેતાઓમાં આ આઠ સામર્થ્યો મોજૂદ હોવાં જોઈએ. પણ આમાંથી એકે ન હોય તો વિજેતા બનવાની શક્યતા બહુ ઓછી. એટલે કે આ આઠ પ્રધાન સહાયક બળ છે. બીજું, અપવાદ સિવાય લગભગ બધા જ વિજેતાઓને વસ્તુ-સામર્થ્ય માટે નવાજવામાં આવ્યા હતા જ્યારે આશરે બે-તૃતીયાંશને શૈલી-સામર્થ્ય માટે નવાજવામાં આવ્યા હતા. એટલે કે લગભગ બે-તૃતીયાંશ વિજેતાઓની મુલવણી વસ્તુ-સામર્થ્ય અને શૈલી-સામર્થ્ય યુગપદે થઈ હતી. વિજેતા બનવા વસ્તુ-સામર્થ્ય તો જોઈએ જ, પણ શૈલી-સામર્થ્ય અગત્યનો સહાયક ભાગ ભજવે છે.

અકાદમીના ધોરણોમાં ફેરફાર

મારે જાણવું હતું કે કાળકમે અકાદમીના મૂલ્યાંકનમાં કોઈ મોટા ફેરફાર આવ્યા છે ? ૧૯૫૦થી પારિતોષિક અપાતાં રહ્યાં છે તે છેક આજ સુધી અને એટલા સમયમાં તો રૂસની કાંતિ, બે વિશ્વયુદ્ધ, નરસંહાર, સાભ્યવાદ અને ફાસીવાદનો પરાજય, મૂડીવાદ અને લોકશાહીનો વિજય, અગણિત પરાધીન દેશોની મુક્તિ, વૈચિકીકરણ, આણુ-પરમાણુ શસ્ત્રોથી તોળાતો વિશ્વનો ધંસ, ચીન, ભારત, અને બ્રાજિલ જેવા દેશોની વધતી વગ, જૂનાં મૂલ્યોનો વધતો હાસ અને વ્યક્તિગતતાનું અને ગ્રાહકવાદનું વૈચિક મોજું, વૈચિક ઉષ્ણતા વગેરે મહત્વની ઉત્કાતિઓ થઈ છે. આ બધાની અસર અકાદમીની મુલવણી પર નથી પડી ? આ શોધવા પહેલા ચાલીસ અને છેલ્લા ચાલીસ વિજેતાઓ માટે અપાયેલાં કારણોનું ઉપર આપેલ વર્ગિકરણને આધારે વિશ્લેષણ કર્યું. નીચેનું ટેબલ પહેલા ચાલીસ, છેલ્લા ચાલીસ અને સંયુક્ત અંશો વિજેતાઓનાં કારણોનું શૈલી-સામર્થ્ય અને વસ્તુ-સામર્થ્યના વર્ગિકરણને આધારે વિશ્લેષણ દર્શાવે છે.

ટેબલ

પહેલા અને છેલ્લા ૪૦ વિજેતાઓનાં કારણોનું વિશ્લેષણ

| શૈલી-સામર્થ્ય દર્શાવતાં કારણો | પહેલા ૪૦ | છેલ્લા ૪૦ | સંયુક્ત ૮૦ |
|-------------------------------|----------|-----------|------------|
| વિજેતાઓ | વિજેતાઓ | વિજેતાઓ | વિજેતાઓ |
| કાવ્યાત્મકતા | ૮ | ૧૩ | ૨૧ |
| વૃત્તાંતબળ | ૨ | ૧૦ | ૧૨ |
| કલાત્મકતા | ૮ | ૫ | ૧૪ |

| | | | |
|---------------------------------------|----|----|----|
| સ્વાધીન | ૧ | ૩ | ૪ |
| તેજસ્વિતા | ૩ | ૦ | ૩ |
| વિનોદવૃત્તિ | ૧ | ૨ | ૩ |
| વસ્તુ-સામર્થ્ય દર્શાવતાં કિરણો | | | |
| મૌલિકતા | ૧૫ | ૧૩ | ૨૮ |
| માનવીની સમસ્યાઓનું નિરૂપણ | ૧ | ૨૩ | ૨૪ |
| આદર્શવાદ | ૧૨ | ૬ | ૨૧ |
| વિશ્વાળ ફ્લાક | ૮ | ૧૧ | ૧૮ |
| યથાર્થવાદી લખાણ | ૮ | ૬ | ૧૫ |
| સત્યનિષ્ઠ લખાણ | ૫ | ૩ | ૮ |
| પરંપરાનિષ્ઠ લખાણ | ૪ | ૨ | ૬ |
| ઐતિહાસિક દસ્તકોણવાળું લખાણ | ૦ | ૫ | ૫ |
| ઉંટું વિશ્વેષણ કરતું લખાણ | ૪ | ૦ | ૪ |
| સર્જનનું વૈવિધ્ય | ૪ | ૦ | ૪ |
| જીવનની ઉજવાડી | ૩ | ૦ | ૩ |
| દંતકથાઓ વગેરેનો ઉપયોગ | ૦ | ૩ | ૩ |
| મનોવૈજ્ઞાનિક વિશ્વેષણ | ૦ | ૧ | ૧ |

ટેબલ પરથી વરતાય છે કે કલાત્મકતા પરનો ભાર છેલ્લા ચારેક દાયકાઓમાં ઓછો થયો છે જ્યારે કાવ્યાત્મકતા અને વૃત્તાંતબળ પર વધ્યો લાગે છે. પણ સૌથી મહત્વનો ફેર તો માનવીની સમસ્યાઓના નિરૂપણ વર્ગમાં આવ્યો છે જેને અંગ્રેજમાં human predicament કહેવાય છે એ સાહિત્યનો અવિનાભાવ થઈ ગયો લાગે છે. પહેલા ચાલીસ વિજેતાઓમાં માત્ર એકને આના ધોરણ પર ચૂંટવામાં આવ્યો હતો, જ્યારે છેલ્લા ચાલીસ વિજેતાઓમાંથી ૨ રને આ કારણને લીધે વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા.

આપણો જમાનો angst એટલે કે ચિંતાનો અને મન પરના ભારનો યુગ છે. આ એક વિચિત્ર ઘટના છે કારણ કે છેલ્લા ચારેક દાયકામાં લોકોની આમદાની તો ખૂબ વધી છે અને અબજોનું જીવનધોરણ ૨૦મી સદીના પૂર્વાર્ધ કરતાં કંઈક ગણું ઊંચું ગયું છે. પણ સાથે સાથે માનવીની અકળામણ અને આરત પણ વધી ગઈ છે. માણસ ખરેખર આવો ? આ પ્રશ્નથી યોગ્યના સાહિત્યકારોમાં અસંતોષનો જીવાળ પ્રસર્યો લાગે છે. આ બહુરંગી પીડાનું નિરૂપણ અકાદમીને માટે મહત્વનું થઈ ગયું છે.

મનુષ્યની સમસ્યાઓને જેમણે જેડી છે એવા નોબેલ-વિજેતાઓની સાહિત્યિક અભિરૂચિઓના થોડાક દાખલા આપું. બિટનના ૧૯૮૮ના વિજેતા વિલિયમ ગોલ્ડિંગનાં

લખાણોમાં મનુષ્ય પ્રત્યેની એમની નિરાશા વર્તાય છે. એમણે માનવની બર્બરતા અને હિસકતા, એની નૈતિક સંદર્ભતા અને માનવરંસંકૃતિની બંગુરતા આવેખી છે. ૧૯૮૬ના પોલંડના વિજેતા વિસ્લાલા ટિલ્બોસ્કાએ માનવઅસ્તિત્વના કોયડાઓ પર પ્રકાશ નાખ્યો છે, નૈતિક મુદ્દાઓ ઉઠાવ્યા છે, અને માનવોની અને એમના સમાજોની પરિસ્થિતિ આવેખી છે. ૨૦૦૪ના ઓસ્ટ્રેલિયાના વિજેતા એલ્ફિનેક, જે સામ્યવાદી અને નારીવાદી હતા, એમણે સ્ત્રીની કામુકતા, એનો દુરુપયોગ, અને સ્ત્રી-પુરુષના જંગ આવેખ્યા છે. ૨૦૧૦ના પેરુ અને સ્પેનના વિજેતા મારિઓ વર્ગસ લોસાએ એમની નવલક્થાઓમાં માનવજાતની હિસાના દેવીકરણની વૃત્તિને આવેખી છે, અને ઝનૂનથી ઉદ્ભબતા ઉત્પાતોની વાત કરી છે.

આ સંશોધનમાં વિજેતાઓ ચૂંટવાનાં મુખ્ય ધોરણો મૌલિક વસ્તુ, માનવીની સમસ્યાઓનું નિરૂપણ, લખાણની કાવ્યાત્મકતા, આર્દ્ધવાદ, મોટું ફલક, વૃત્તાંતબળ, કલાત્મકતા અને યથાર્થવાદી લખાણ નીવડ્યાં. આ આઈ વર્ગને જુદી જુદી રીતે સંમિલિત કરવાથી બિન્ન પ્રકારનાં નવાં નવાં ઘણાં સાહિત્યરૂપો ઊપજી શકે, જેમ કે મનુષ્યની કોઈ સમસ્યાનું નિરૂપણ કરતું આર્દ્ધવાદી લખાણ, કે મોટા ફલકવાળું મૌલિક અને કાવ્યાત્મક લખાણ, કે કલાત્મક યથાર્થવાદી વૃત્તાંતબળવાળું લખાણ, વગેરે. સામાન્ય ગણિત (8C2) બતાવે છે કે આઈમાંના કોઈ પણ બે વર્ગને જોડવાથી ૨૮ જુદા જુદા રૂપનાં લખાણ શક્ય બને છે. સાહિત્યનાં રૂપોને વધારવાનો આ જોવા જેવો કીમિયો છે.

અંતમાં, નવા પેઢીના ગુજરાતી સર્જકો આ તારણોને ધ્યાનમાં લે તો એમનું સર્જનફલક વધુ ખીલે. આને માટે વિજેતાઓના નમૂનારૂપ અનુવાદ બહુ ઉપયોગી થઈ પડે. આ નમૂનાઓને સાક્ષરો ચર્ચે તો તાલીમ શિબિરોમાં ભાગાંતરો સહિત આવી ચર્ચાઓ યુવા સર્જકો પાસે મૂકી શકાય – અનુકરણ કરવા નહીં પણ કાબેલિયત વધારવા, અંગત ઘરેડમાંથી મુક્તિ પમાડવા, ઉચ્ચ સર્જન કેવું હોઈ શકે એ જાણવા અને માણવા.

અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં લઘુશોકોમ્બિકાબ્યો | ડૉ. વિરંધિ ત્રિવેદી

રસાસ્વાદમાં જ કવિતાની કલાકીય સાર્થકતા છે. “એકો રસ કરુણ એવ નિમિત્ત ભેદાત્” એમ કહીને ભવભૂમિએ કરુણરસનો વિશેષ વિશેષ મહિમા કર્યો છે કારણ કે કરુણ શોકજન્ય હોવા છતાં તેનો આસ્વાદ, રસાનુભવની પ્રક્રિયામાં આનંદપર્યવસાયી બને છે. અનંત વિયોગમાંથી વ્યાપી જતા વિષાદની અભિવ્યક્તિના મૂળમાં મૃત્યુનો શોક સર્વોત્કૃષ્ટ છે. પાત્ર, પ્રસંગ અને નિમિત્તની વૈવિધ્યપૂર્ણ સામગ્રીમાંથી જૂની અને નવી પેઢીના કવિઓએ એમાં કેવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે, એની છણાવટનો ઉપકમ આ લેખમાં રાખ્યો છે. મૃત્યુના શોકની ઘેરી અસર રોજિંદા વ્યવહારમાં ગુંથાયા પછી પણ

જાજુથે-અજાજુથે મનને વિધાદયુક્ત દુઃખદ વિસ્મય આપતી રહે છે. “અરે, આ વેળા તો અનુભવ થયો અદ્ભુત નવો” કહી ‘હું મુજ પિતા’ કાવ્યમાં ઉશનસ્ય સ્વાનુભવને નિરૂપે છે :

“પિતાજીની ટેવે ? - અશી જ પ્રગટી પત્રની તુલ્લા ?
સૂલો રાત્રે ખાટે જનકની જ, રે ગોદંદું એ ?
નનામી યે મારી નીરખ્યું પછી ને ભડુલડ ચિત્તા,
રહું જોઈ મારું શબ બળતું હું હું મુજ પિતા.”

પિતા વિનાના હવડ ઘરમાં, પિતાનું જ શાણિયું પહેરી કપાળે ભસ્મની ત્રિવલ્લી કરી એક દિવસની હિન્દયાર્થમાં, જન્મમરણના વિશ્કર્મના કવિના અનુભવમાં મૃત્યુનું રહસ્ય અને મૃત્યુનો શોક ઉભય અભિવ્યંજિત છે. કવિની અંગત લાગણી એકરૂપતા સિદ્ધ કરી વ્યાપક બને છે... અંગતતાનું આદેખન કરતાં આ કાવ્યો બિનઅંગતતાની સરહદને પણ સ્પર્શો છે. “પુત્રનું પિતારુપે થતું રૂપાંતર અંતે ઉત્કટતાપૂર્વક પ્રતીત થાય છે. દૈનિક કિયા-વ્યવહારોમાંથી કમશા: તાદાત્યતાનો અનુભવ કરાવે છે.

કાન્તે વિરહકાવ્યો અને મૈત્રીકાવ્યોમાં અવસાનથી ભાંગી પડેલા હદ્યની લાગણીઓ બ્યક્ટ કરી છે. એમના ‘ઉપહાર’ સોનેટ દ્વારા એ કહે છે કે, “...એ ગત ભાવો, સ્મરણો તથા સંવેદનોને મેં કાવ્યદેહ આંખો છે જે હું તને અર્પણ કરું છું; ગમે તો સ્વીકારજે” કહી હવામાં ઔંગળી ગયેલા ઉદ્ગારોમાંથી સ્મરણમાં સચવાયેલા ઉદ્ગારોને લાગણીવશ થઈ ધરી હે છે :

“અને તને આજે તરબ ધરું તારુ ચરણમાં,
ગમે તો સ્વીકારે ગત સમય કેચા સ્મરણમાં.”

“...કાન્તના અતિ ઝાજુ હદ્યમાં સ્નેહીઓના પ્રતિભાવથી ભાંગે જ પરિતોષ અનુભવાતો” એમ કહી ડૉ. જ્યંત પાઠક કાન્તની લાગણીને વિશેષ રૂપમાં નોંધે છે.

‘મિત્રપતિ ઉક્તિ’ દ્વારા મરાચિત સર્વોત્તમ કરુણપ્રશસ્તિ ‘ફાર્બસવિરહ’નો કાવ્યખંડ છે. લાગણીની તીવ્રતા અને સચ્ચાઈ સાથે સમુચ્ચિત ભાષા અલંકાર દ્વારા હદ્યસ્પર્શી વેનાસાભર શોકોદ્ગાર છે :

“ઉચ્ચયાર્યો કદી ન એક, જૂઠો દિલાસો જીબથી
છેલ્લે વારે છેક, ઝોગટ બોલ્યો ઝારબસ,
માનવ જાતી માત્ર, ભલે વસે સાઉ ભૂમિમાં
પણ પ્રીતિનું પાત્ર કૂટી ગયું રે ઝારબસ.”

બીજુ કરુણપ્રશસ્તિ નરસિંહરાવની ચિરંજિવ કૃતિ સ્મરણસંહિતા છે. ડૉ. જ્યંત પાઠક એને નરસિંહરાવની કવિતાના કીર્તિશિખર તરીકે ઓળખાવે છે. સંસારમાં ભળતા પહેલાં જ શિશુના અવસાનથી કવિનો ઉદ્ગાર પુત્રસ્નેહે તરબોળ ભક્તિના રંગે રંગાયો

છે. આધાતની લાગણી અને પ્રભુને નમ્ર પ્રાર્થનાનો સંયમિત સુયોગ અને સરળ ભાષામાં મૃત્યુવિષયક ચિંતનની આ કૃતિ કવિના ‘સ્મરણસંહિતા’નાં ગીતોમાં ઉત્તમ લોકપ્રિય પ્રાર્થનાગીત છે.

‘ઠેસ’ જ્યેન્ડ શેખડીવાળાનું જનનીના સ્મરણ અને બાલવાણીમાં વેદનાનું કરુણકાવ્ય છે. સંસારની સૂની શેરીમાં જીવનની ઝડીઓ અને જંખાવાતો સહેતા એકલા પડી ગયેલા કવિના ઉત્કટ ઉદ્ગારમાં જૂરાપો એ રીતે વહે છે કે “મૂંજારો તો કેવો, જાણો જીવ નર્યો પરસેવો.”

“આજ અમારી રિક્ત સપાઈ પર ઠલવાતાં

ખડક-ઠેસના શક્ત સામટાં...

ધૂળમાં ગોઠણાભેર પડ્યો છું.

કે મારી માને કહેજો રે.”

મા વિનાના ફળિયાને બદલે પોતાને જ મારા વિનાનું તારું ફળિયું એવા વિપર્યાસે નિરૂપી કાવ્યને અજબની તીવ્રતા અર્પે છે.

“ભાઈનો બહેન પાછળ વિલાપ” ઠન્હુવાલ ગાંધીનું પ્રકૃતિ દ્વારા બહેન માટે વિષાદ વ્યક્ત કરતું કાવ્ય છે. “રોઈ રોઈ આંસુ ખૂટ્યાં, રુદ્ધના સ્વર પ્રતિસ્વર સાંભળી સાંભળી કાન ફૂટ્યાં, દુઃખની શૂળ પણ શમી ગઈ છે પણ દુઃખ પોતે હજી હદ્યમાં ઘર કરી બેઢું છે તે બેઢું છે.” જીવનમાં ભાવનામયતાના એકમાત્ર આધાર વિના નોંધારાની કલ્યાંતકારી વાણી હદ્યદાવક છે.

“ફરી ફરી પૃથિવી અટકી જશે, જગતનાં સહુ ચક જશે ખડી

પણ જરેલ ઉરે સ્મૃતિની કરી, મરણથીય કરી નવ તૂટશે.”

સ્નેહના ગઠબંધનની અનુભૂતિ જયમનગૌરી પાઠકજીની ‘સંભારું’ કૃતિમાં મળે છે. તો દાંપત્યભાવનાં કાલ્યોમાં શોકની જુદી જ અભિવ્યક્તિ આપતું રમણભાઈ નીલકંઠનું ‘રેખા શૂન્યતા’ અને ‘તું ગઈ હવે’ ધેરા વિષાદની કૃતિ છે. પત્નીના અવસાનથી જીવનનું મધ્યબિંદુ ખોઈ બેઠેલા કવિની વ્યથા અપાર છે.

“ગ્રહો ફરે છે રતિ આસપાસ, છાયા ફરે જ્યાં વચમાં પદાર્થ

પ્રદક્ષિણા એ પ્રિય કેરિ સર્વે કર્યાં હું ફરું રે તુજ તુજવીજ મધ્યે”

વિષાદ ધૂટાયેલા દર્દની જ ભેટ છે. કાવ્યમાં વિષાદની અભિવ્યક્તિ કલાત્મક આલેખનના કૌશલ પર આધાર રાખે છે. સંબંધોમાં વિષાદ આત્મક્ય વિના શક્ય નથી. ઐક્યનો વિચ્છેદ એ જ અવસાન છે. ઐક્યના તરફડતા આત્માના ટુકડાની વ્યથા વિષાદ છે અને નિર્મિત પણ છે. બાકી મોત પહેલાં પણ તેને મળતું વસતું જીવન કવિની દસ્તિએ ‘જીવતું મોત’ છે. એવી સ્થિતિ સ્વીકારી લેતાં નાયક કહે છે કે

“મોત જીવનું મોત, તેમાં વધુ વસણું કયું
એ શાનાજિન જ્યોત થકી ભલે ઊગર્યા સખી ?”

એક તરફ મળેલી દર્દબારી એકલવાયા જીવનની કરુણતા છતાં સદ્ગત માટેની સહાનુભૂતિની અભિવ્યક્તિ મરણોત્તર સ્નેહસાયુધને જ વ્યક્ત કરે છે.

“દુતિકણી” કાવ્યમાં કવિનો અનુભવ સૂક્ષ્મચેતનાના સ્પર્શને લઈને આવે છે. પત્ની દુતિકણીનું હરખાલતમાં નાયક સાથે જ છે. કવિ તેના સૂક્ષ્મ હુમલા અનુભવે છે. એ હુમલા સહન કરવાની શક્તિ ના રહી તો ? ભલે ગમે તે થાય પણ નાયક (અર્થાતું કવિ લ. ક. ઠા) કહે છે,

“સહે નયનશોત સ્થૂલ ક્યામ સૂક્ષ્મ હુમલા જ એ
સહે નવ સહે ભલે, દુતિકણી ઝગો સર્વધા.”

દુતિકણી પછી સદ્ગત પ્રિયતમાવિષયક શોકાનુભવનાં ચાર સોનેટ છે, “જેમાંથી ‘જીગરણ’માં સહજીવનના એક સ્મરણમાંથી દુઃખદ વિસ્મયને કવિ તાદશ રીતે વર્ણિયે છે. મૃત્યુવિષયક સોનેટો પછી જ ‘દુતિકણી’ આદિ પાંચ મરણોત્તર વિલાપિકાઓમાંથી પ્રેમવિષયક ગુચ્છ શરૂ થાય છે, એમાં મૃત્યુવેસ્થિત પ્રેમઅનુભૂતિ રજૂ કરવામાં મૃત્યુ અને પ્રેમ એ બંને ગણન જીવવાનુભૂતિઓની સમરસતાને ઉડાવ મળ્યો છે.” શોકોર્નિ કાંખો તેમજ વિષાદકાંખો’માં ઉશનસ અને બ. કા. ઠા.નાં ગુચ્છકાંખોનું અભિવ્યક્તિની દિશાએ આગવું સ્થાન ગણી શકાય. સુંદરમ્ય તેને આ રીતે નોંધે છે, “જેમાં કવિના પોતાના ભાવ પ્રધાનપણે વર્ણવાયા હોય તેવાં તાદાત્યલક્ષી ઊર્ભિકાંખો પણ ઢકીએ ઠીક ઠીક પ્રમાણમાં લખ્યા છે વિરહ ગુચ્છમાંની આ પ્રકારની કૃતિઓ છે એમાં” ગૃહજીવનનું વાસ્તવિક વાતાવરણ, પતિપત્નીના કઠોર મૃદુ સ્વભાવો, પરસ્પરનાં સ્વાર્પણો અને વથાપર્યવસાન નિરૂપણ અને વિરહની અતિલ વ્યથા એ બધું વ્યક્ત થયું છે.”

મૃત્યુપસંગે બંધુવિરહને વ્યક્ત કરતું નંદશંકર પાઠકનું ‘મંગલ વિદાય’ કાવ્ય શોક, વિષાદ, ચિંતન અને મૃત્યુના મંગલયનો સમન્વય સાધ્યતું વિષાદકાંખ છે. જીવન અને મૃત્યુને ચૈતન્યની બે પાંખો કહી કવિ મૃત્યુને કાળકર્મ કે કાળધર્મ તરીકે ઓળખાવે છે. ઊગતા સૂર્યની જેમ માનવ પણ જગતના અંધકારને દૂર કરવા વિશ્વમાં દીપક થઈને પુનર્જન્મ ધરી આવવાનો જ એવી કવિહૃદયની અચળ શ્રદ્ધા પંક્તિઓમાં કવિ વ્યક્ત કરે છે :

“બંને જીવન-મૃત્યુ આજ મુજને આપે મહાપ્રેરણા,
ધરીને દિવસગત પાંખ જગતમાં જેવા ઊડે કાળ આ
તેવાં જીવનમૃત્યુ દ્વિષ ઊડતાં ચૈતન્યની પાંખના ?”

“ભૂના જીવને જૂરવું રહ્યું” મનસુખલાલ જીવેરીનું સ્વર્ગસ્થ મિત્રના શોકમાં લખાયેલું વિષાદ અને ઘેરી વિષણુતા વ્યક્ત કરતું કાવ્ય છે. સાંત્વન માટે શમણાંનો

સહારો લેવા જતાં શમજાથી તો કાળજું કોરાયું એવી કરુણ હાલતમાં હૈયાની વાત સમજનાર મિત્ર હતો એ પણ ગયો એમ કહેતાં વિધાદ ઘેરો બને છે. કમળને લિધી કાદવની મહત્ત્વા વધી પણ કમળ વિના કાદવ કાદવ જ રહ્યો એવા કલ્યાંતમાં મિત્ર વિના સુના કવિહંદ્યનો ઉદ્ગાર અસંખ્ય હંદ્યદ્રાવક સ્થિતિની અનુભૂતિ કરાવે છે :

“કમળે કાદવનાંય રૂપો રઢિયાળાં હતાં

કમળ જતાં કરમાઈ કાદવ તો કાદવ રથ્યાં

પળથી પ્રગટે દિન, દિનથી મહિના મ્હોરતાં

મજલ કપાતી વીર ? આવું નિત દૂકડો.”

‘ધતાં જીવને’ મૃત્યુ પામી મિત્ર ભરડાનું ખેંચાણ ટાળવા ઝંખતા કવિની અભિવ્યક્તિમાં ભારોભાર મિત્રવિરહ જ છે.

વેણીભાઈ પુરોહિતનું ‘સુની સફર’ અને રમણીક અરાલવાળાનું ‘વિખૂટા મિત્રને’ મિત્રવિરહને વ્યક્ત કરતાં સવિશેષ ઉલ્લેખનીય વિધાદકાવ્યો છે.

“વર્થ આશ્વાસને ધૂધવાતો ફરું

સફરમાં કેમ ભાંગે સુકાનો

અંતનો આખર અંત આવી ગયો

સફરમાં તું વણી ગયો છે

નજર નાખી દરે ના પણી અંતરે

આશાદીપણા નિઃસાસા સરે છે”

મિત્ર વિના એકલા પડી ગયેલા કવિ જીવનની સુની સફરને નિરૂપતા તત્ત્વજ્ઞાનને તાંત્રણે ચડી જઈ મિત્રનું જ ગૌરવ લાગણીસભર રીતે કરે છે :

“તો જીવાની નથી ખોઈ મારા સુહુદ

રે જીવાની તને ખોઈ બેઠો.”

ઉશનસુની કરુણસભર ‘વળાવી, બા, આવ્યાં’ કૃતિમાં માતાનું વત્સલકરુણ ચિત્ર આદેખાયું છે. ડૉ. રમણ સોની કહે છે : “એ કાલ્યમાં નિરૂપાયેલી એકલતાની કરુણતા અને ગૃહભાવનું આદેખન તેનું વિશિષ્ટ પાસું છે.” “વળાવી, બા ”માંનો આ કરુણકેન્દ્રી વત્સલરસ જેને ઉશનસુ પોતે ‘વિપ્રલંબ વત્સલ’ કહે છે તે ગુજરાતી કવિતામાં વિરલ ગણાય તેવો છે અને એક વિશિષ્ટ ભાવરેખા ઉપસારે છે.”

‘એક બાળકીને સ્મશાને લઈ જતાં’ કાલ્યમાં આવડી નાની બાળકી માટે શું રોવું ? એવું વિચારતા આત્મીયજનોની વચ્ચે કવિની ભીની ઓંબ વિધાદની લકીર ખેંચી જાય છે. બાળકીને સ્મશાને લઈ જતાં વળાંકે તેની બહેનપણી સૂર્ય રહેવાની રમત માની હાથ ઊંચા કરવા લાગી. પણ તેને લાગ્યું કે... ‘આ રમત કર્યી કારમી હતી તે જ ક્ષણે તે ઊંચા હાથ ગળા પાછળા નાખી દઈ ગોઠણ તેની સાથે ગોઠ કરવા નહીં આવે એ ખ્યાલ

આવતાં જ તેણે જે શૂન્યતા અનુભવી તે જોઈને નાયક કહે છે કે “મારે રોવું નહોંનું તોપણ રોવાઈ ગયું” એનું તાત્પર્ય એટલું જ કે વિષાદ અનુભવનો વિષય છે, વ્યવહારનો નહીં’

“ગઈ મંડી રોવા તુજ મરણની ખોટ વરતી
અકેલી એ આજા જગત મહીં ઓળે જ વરતી
અને રોવું નહોંનું પણ મુજબી રોવાઈ જ ગયું.”

સીધી અસરને બદલે ડિલાતી અવર પરની અસર તેના રહસ્ય સાથે હદ્યસમર્શી બની જાય છે. આ પણ વિષાદની એક નોખી અભિવ્યક્તિ છે.

‘જૂનું ઘર ખાતી કરતાં’ બાલમુકુદ દવેનું પુત્રવત્સલ પિતાની મનોવ્યથાને વ્યક્ત કરતું ઉત્તમ શોકકાવ્ય – સૌનેટ છે. બાળકમુખે કવિએ પોતે પોતાની ઉપર જ કરેલો કરુણા-કટાક્ષ ખરેખર વેદ્ધક છે. શિશુસહજ ભોળપણ અને ક્ષુલ્લક વસ્તુઓમાં ભુલાતા પુત્રનું સ્મરણ ભાવકને પણ ધેરા વિષાદમાં મૂકી ઢે છે.

“બા, બાપુ ના કશુંઘ ભૂલ્યાં, એક ભૂલ્યાં મને કે ?” – એની સાથે જ કવિનું તીક્ષ્ણ સંવેદન એ જ માત્રામાં વ્યક્ત થાય છે કે

“ઉપાદેલા ડગ ઉપર શા લોહ કેગ મણિકા.”

પ્રસંગની માર્ગિકતામાંથી ધેરાતો વિષાદ આ કાવ્યની સર્વોત્તમ ઉપલબ્ધ છે.

કાન્તનો કરુણ અન્યથી નોખો છે. ઈ. સ. ૧૮૮૧માં પત્નીના અવસાને “જીવનભર એ અંતર્મૂછ ઘન વ્યથા”માંથી દર્દના કાવ્યોદ્ગાર સરતા રહ્યા તેમાં ‘પ્રમાદી નાવિક’માં કવિ આપદ્યાત કરવા પ્રેરાય છે, તો સંન્યાસી થઈ જવાની વૃત્તિ પણ વારંવાર જાગે છે. આ તીવ્ર ઉદ્ઘેર કુરંગ વધારે ગહન ગંભીર બને છે:

“કદી સ્મરણ આવતાં રુધિરનીર નેત્રે ઝરે,
દ્યા સ્વજનને થતાં વદન પાસ પાણી ધરે
નહીં સ્વજન તે સખી ? સ્વજન એકલી તું હતી
સહસ્રશત શલ્યમાં હદ્યની પથારી હતી.”

પત્નીના શોક નિમિત્તે જ લખાયેલાં કાન્તના ‘ગાન વિમાન’ કરતાં ‘વિપ્રયોગ’માં કાન્ત પત્નીને સંબોધી કહે છે કે “અંત સુધી મારે રોવાની ઘરા એની એ” પરંતુ એમના ‘વિધુર કુરંગ’ અને પ્રમાદી નાવિકમાં દર્દ વધારે ઘૂંઘાય છે. પુત્ર પ્રાણલાલના અવસાનથી વિધુર કુરંગમાં એ દર્દ બેવડાય છે.

“કુરંગ હતભાગ્યને ભવ અરણ્ય યાત્રા રહી
કર્યા કરવી એકલા, વિવશ આજી અંગો વહી.”

પત્નીના વિયોગમાં લખાયેલાં ખંડકાવ્યોની વિશેષતા એ છે કે એમાં રૂદન, લાચારી, હતાશા, એકરાર, કરુણતા, અફ્સોસમાંથી નીતરે છે અંતે વિષાદ જ. એમનાં ખંડકાવ્યોમાં

કરુણતા છે તો સદ્ગત પત્ની માટે લખેલાં કાવ્યોમાં કરુણ સ્વયં વહે છે.

“સખી ! જો ઉદ્ધિ તણે ઉરે” ‘શેખ’નું વિરહગીત છે. રૂપક દ્વારા કવિ પૂનમ અને અમાસની ભરતીનું અર્થઘટન. એકમાં પ્રિયજનનું સહભાગીપણું અને બીજામાં પ્રિયજનનું વિયોગીપણું, દુઃખદ અવસ્થા તરફ ધ્યાન દીરે છે. વિયોગી અવસ્થામાં ગત પાત્રનાં સંભારણાંથી ભરતીમાં કવિહથ્ય ખેંચાયા કરે છે એવી દુઃખદ પળોનું વિષાદદ્વર્યું કાવ્યાત્મક નિરૂપણ છે :

“પણ ક્રૈસ્ટી લુપ્ત થતાં હૈ જતાં
ઘન અંધાર ઉરેય વ્યાપતાં,
દ્વિને ગત પર્વ સાંભર્ય
ભરતી પાછી અમાસની ચઢે”

અંધારું વિષાદનું સૂચક છે અને વિષાદનાં ઘોડાપૂર વિયોગની અમાસમાં આવતી સ્મરણોની ભરતી છે. રનેહરશિમના ભજન સ્વખનની નાવમાં પણ એકલવાયા શેષજીવનની ઉદાસીનતા ગાઈ છે. જીવનમાં જોયેલા સ્વખનાં ટુકડાથી ભરેલી આ નાવ છે. વિષાદ અને વિરક્તિ કાવ્યને ભાવાભિવ્યક્તિનું ગૌરવ અપાવે છે.

રમણીક અરાવાળાનું ‘વિભૂટા ભિત્રને’ કાવ્યમાં ‘ધૂમકેતુ’ જેવા એકલરખું બની ગયેલા કવિની ભિત્રવિરહની વેદનાનું વર્ણન છે. “તહને તજતાં તજુ સભર સખ્ય સંવેદના” આખી કૃતિનું બીજ છે. કાવ્યની અંતિમ બે પંક્તિઓમાં વેધક અનુભૂતિનું વિષાદમય નિરૂપણ મળે છે :

“હું શું અવરોધ ? બોધ ? અફ્સોસ ? જા હું હવે
કરીશ બમણો બળે ખતમ આપની કૂચને.”

ભિત્ર વિનાના જીવનની ઉદાસીનતા. ઉટક્ટ રીતે આ પંક્તિઓમાં અવતરી છે.

‘ઈન્દ્રધનુ’માં સુંદરજી બેટાઈ જગતનાં બાળકો અને માતાપિતાની ચીસો સાંભળી વિષાદ અનુભવે છે. અંગત વિષાદ વૈશ્વિક સ્તરે વ્યાપે છે. વિરહની દશામાં દુરૂહ તર્ક, કલ્યાના આદિ, માણસ માટે કુદરતી ચિત્તવ્યાપાર છે. “ઊર્મિશીલોને દુરૂહ તકોને ઘોળ્યા કરવામાં ઉચ્ચ કરુણરસ પણ લાગે” એવા કરુણાની એક ઉચ્ચકક્ષા સુંદરજી બેટાઈની પંક્તિઓમાં અનુભવવા મળે છે. મુત્ત પુત્રની સંવેદનાથી વ્યથિત કવિનો વિષાદ અંગતની સીમા ઓળંગી જગતની ચેતનામાં વ્યાપે છે :

“મેં મૃત્યુ અંકે મુજ બાલ અંગે સૂતેલ જોયાં શિશુઓ અસ્ત્રખ્ય
હું સાંભળું છું મુજ બાલચીસે અનેક ચીસો જગ બાળકોની
ઉંડી અમારી ઉરવેદનામાં છૂપી વ્યથા કેં જગની જજાતી;
હું દાઝતો અંતરબાધ્યગળે અનેક દુલ્યાં જનની પિતાની..”

‘પિતાનાં ફૂલ’ કાવ્યમાં ઉમાશંકરને સદ્ગત પિતાના કંધથી ખાંધ સુધીની યાત્રાના અંતે અજિસંસ્કાર પછી પાણીમાં પલાળી ધોયેલાં અસ્થિ ટોપલીમાં મૂકતાં અસ્થિ આકાશના વીજેલા તારા જેવાં લાગે છે. ધોયેલાં અસ્થિ ટાઢાં થતાં વિષાદમય કવિહઠય ક્ષણિક રાહત અનુભવે છે કે

“શાસ્ય મૃત્યુ શોકો, અમર ફરક્તી નીરખીને

પિતાનાં ફૂલોમાં ધવલ કલગી સિથકમની.”

‘સદ્ગત મોટાભાઈને’માં વ્યક્ત થતા રનેહ અને શોકનું મિશ્રરૂપ સુંદર છે તો વિષાદ પણ કઠળ કાળજાને કંપાવનારો છે અને ‘અંગૂઠે વાડ’ના રૂપકથી એ પરાકાણા વ્યક્ત થાય છે.

“થાસે થાસે રહી જાગી, ડંબ અંતરવેદના

પલકે પલકે ઊંઠી, ટપકે ગૂઢ વેદના

...પાંચ આંગળીઓમાંથી અંગૂઠે વાડ મુક્કિયો.”

ગાંધીના મૃત્યુપ્રસંગે લખેલા ઉમાશંકરના ‘રડો ન મુજ મૃત્યુને’ કાવ્યમાં કવિ કબૂલે છે કે

“અમે ન રડીએ પિતા, મરણ આપનું પાવન

કલંકમય દૈનંદનું નિજ રડી રહ્યા જીવન.”

ચંદ્રશંકર ભણ એ વિષાદને મૂલવતાં લખે છે : “ગાંધીજીના અવસાન નિમિત્તે લખાયેલાં અનેક વિષાદકાલ્યોમાં વિશિષ્ટ રચનારીતિ અને દાઢિકોણથી લખાયેલું, ગાંધીજીના મુખમાં મુકાયેલી ઉક્તિ રૂપે રચાયેલું અને અંતે કવિના વિષાદને સંયમિત છતાં તીવ્રતમ રીતે બે પંક્તિઓથી અભિવ્યક્તિ આપતું ઉમાશંકરનું ‘રડો ન મુજ મૃત્યુને’ સદ્ગુરીય છે.”

મનસુખલાલ ઝવેરીના ‘આજ નયનો રડો’ કૃતિ પણ ગાંધીના અવસાનનો શોક વ્યક્ત કરતી ઉલ્લેખનીય રચના છે. રાવજી પટેલના ‘ભાઈ’ સોનેટમાં વાતાવરણ સુખદ છે પરંતુ અચાનક વિષાદનો પલટો તીવ્રતાનો અનુભવ કરાવે છે :

“પછી તો દુંડાઓ હરાન ન માયો હઠયમાં

ફરી આવું થોડું ચલ મન જરી ખેતર વિષે,

જતાં ચોડું વાગ્યું, ચરણ લથજ્યો, આંખ ફરકી

અહીં આ કારીમાં ખડખડ હસ્પો ભાઈ મુજનો.”

કાવ્યની ચોટ આવે છે મૃત્યુ પામેલા ભાઈના સ્મરણથી અને કવિનો આનંદ વિષાદમાં પલટાઈ જાય છે.

ગુજરાતી શોકોર્મિકાવ્યમાં ચિનુ મોદી, નલિન રાવળ, રાહેશયામ શર્મા, મણિલાલ

દેસાઈ, આહિલ મન્સુરી અને રાવજી પટેલની કવિતાઓમાં વિખાદની નૂતન અભિવ્યક્તિ મળે છે. એમાં લાબશંકર ઠાકરની ‘શિવાસ રિગલ’ ત્રણ આત્મીય મિત્રોના શોકથી ઘૂંઘાયેલા વિખાદની અભિવ્યક્તિ આપે છે. રાવજીના મૃત્યુનો વિખાદ અને જીવનની કરુણતાની પંજિઓમાં સ્મરણ હૃદયસ્પર્શી છે :

“આ કોણ ટપકે રાવજી થઈને હવે ?
આ કોણ અમણું વેદના થઈ ઓગળે ?
તૂંકી પદેલા ઢેણના ખંડેરમાં
સરકતાં સપણાં સરિસૂપ : રાવજી
નમક જેવી જિંદગી ખારી છતાં સ્વાદું
અરેરે એય સરકી જાય જ્યારે હાથથી ?”

કવિમિત્ર મણિવાલા દેસાઈના મૃત્યુનો રંજ વેધક અને મિત્ર મિનુ કાપડિયાના મૃત્યુનો જેદ પણ અતિદુઃખદ છે.

“અરે તું કઠળ તો એવો હતો, જાણો મણિ !
મીંશ શો પીગળી ગયો.”

‘શિવાસ રિગલ’માં પ્રશ્ન દ્વારા સધાતી ભાવાભિવ્યક્ત વેધકતા સાવે છે :

“માનવીના સ્નેહ પારાવારનું –
ક્યારે ગયું છટકી ?
જરા કંઈ તરફકું
ને કયાં ગયું ?”

અર્વાચીન ગુજરાતી કવિતાના વિકાસમાં વિખાદ એક તરફ કરુણ પ્રશસ્તિમાં, તો બીજી તરફ સોનેટ જેવાં વિવિધ ઉર્મિકાવ્યોનાં સ્વરૂપોમાં પ્રકારે પ્રકારે, નૂતન રૂપે, લયવૈવિધ્ય અને ઉત્કટ ઉદ્ગારોમાં વહ્યો છે. માનવીય સંબંધોનું વૈવિધ્ય લઘુ વિખાદકાવ્યોમાં વિશાળ પટમાં વહેતું જોવા મળે છે. સ્વજનનિર્દેશ અને લોકપ્રસિદ્ધ મહાનુભાવોની અંજલિનાં વિવિધ રૂપોમાં પણ લાગણીની સૂક્ષ્મતા પારદર્શક થઈ વહી. કુટુંબ પ્રેમના, મૈત્રીના અને સામાજિક સંબંધોના સંદર્ભ રચાયેલાં કાવ્યોમાં પણ કલાસિદ્ધ કાવ્યાત્મકતા સભર કૃતિઓ મળે છે. કેટલાંક કાવ્યોમાં તો શોક જ શ્લોક રૂપે કાવ્યોદગાર બની ગયેલો લાગે છે. એમાં અંતર્મૂઢ ઘન વ્યથા, દર્દનાં વ્લેતાં જરણાં મળે છે. એમાં બ. ક. ઠાકોરનું ‘અ.સૌ. નર્સા ભડી’ કાવ્ય પણ ઉલ્લેખનીય છે :

“અસિધારાવત એવું કપરું
મહાતપસ્વીનેય ન સૂતરું જે જરવાયું
તોપણ તે પાળ્યું આજો ભવ
રે હસતે મુખ ઢંક્યો ઉર દવ

ગ્રેમબિષ્ટા, લીલા, માર્દવ બધૂ ટકાવું”

બ. ક. ઠાકોરરચિત સ્વજનો, ભિન્નો વિશેનાં અંજલિકાવ્યોમાં ‘અ.સૌ. નર્મદા ભણ’, ‘કોકિલ વિલાપ’ અને ‘વિરહનાં આંસુ’ વિખાદની અભિવ્યક્તિ ઉર્મિનું સ્વરૂપ અને શોકના નિરૂપણની દસ્તિ પ્રથમ હરોળના ‘લઘુ વિખાદકાવ્યો’ની ગુણવત્તા, કલાત્મકતા અને ભાવાભિવ્યક્તિ ધરાવે છે :

“હાય ? દિવસ આવો જ હતો એ સાંજે આમ જિલીતી
અમે ચાંદની તે પછિ ઉજળી નદીનાડે ખીધીતી
છે એ સંધ્યા, નરી, બગીચો, એ જ કુરુંગી કોકિલ;
એ રૌંદર્યામી પણ જતાં એક બન્યું વિખ કાત્તિલ
પ્રભુ હું તે કેમ જિંગરને દાઢું રે, ક્યાંયે ઉર ન થરપે મહારું ?”

રુદ્ધન, મૌન, અફ્ઝોસ, ઠાવકો બોધ, એકાંત, એકલતા, નિઃસહાયતા, ઉદાસીનતા દ્વારા વિવિધ કાવ્યોમાં વિખાદ વ્યક્ત થાય છે પરંતુ રા. વિ. પાઠકનું ‘છેલ્લનું દર્શન’ સોનેટ માંગલ્ય અને ધેરા વિખાદના સમન્વયને કારણે વિશેષ ઉલ્લેખનીય છે. કવિ પોતાની આંખોને જ પસાર થતી પળોમાં શાંતિ જળવવાનો જે ઠાવકો બોધ આપે છે એમાં કવિહદ્યનો વલોવાતો દૂમો છે :

“ધડી-બ-ધડી જે મળી – નયન વારિ થંભો જરા
ધમાલ ન કરો ન લો સ્મરણ કાજ ચિલે કશું
અંનંદ જ ભલે રહ્યું હદ્યસ્થાન તેવું હવે
ન સંસ્મરણ વા નશે સ્વજન ય કદી પૂરશે
મળ્યાં તુજ સમીપ અજિન ? તુ જ પાસ જુદા શિયે
કહો, અધિક મંગલ નથી શું એ સુંદરી ?”

દાંપત્યના પ્રારંભે અને અંતે અજિન જ સાક્ષી છે એવા સંદર્ભમાંથી વિયોગનું દર્દ અને વિખાદ તેમજ વ્યથાને કવિ માંગલ્ય અને પાવન ભાવથી પૂજનીય, દર્શનીય અને ચિરસ્મરણીય બનાવી દઈ ઉન્નતપદે સ્થાપે છે.

સિદ્ધાંત માટે સંધર્ષ વેઠી અંતે જીવલક્ષી કરુણતા નોતરનાર ‘કલાનો શહિદ’ ઉમાશંકર જોશેનું હીરાધર માટે લખાયેલાં કાવ્યમાં હીરાધરની કોમળતાની ભાવના સુંદર રીતે કંડારી છે. જીવન સાથે અવિભાજ્ય એવા વહાલા પથ્થરોને સંબોધી કવિએ હીરાધરના મુખમાં મૂકેલું કલ્યાંત હદ્યદાવક છે :

“એ પથ્થરો સૌ કરણો મને ક્ષમા
બેસી શક્યો ના તમ પુષ્ય પાળમાં”

પથ્થરો વચ્ચે હીરાધર ચાણાતો જતો હતો ત્યારે તે કહે છે કે

“હું તો શિલાનો, પણ ગુર્જરીશ
શિલા સમું ના ઉર તું ધરીશ.”

હીરાધરની વાડીમાં વેધકતા, વ્યથા, કટાક્ષ અને કલાપ્રીતિ વ્યક્ત થાય છે.

ખીલવાની અવસ્થામાં ખરવાના દુલ્ભર્યથી વ્યથિત કવિ હરિશ્ચદ ભણ તેમના 'નિર્દ્દિષ' ને નિર્મળ આંખ તારી' કરુણ-વિષાદના કાવ્યમાં બહેનના અવસાનથી વિલાપ-વિષાદ વ્યક્ત કરે છે. સંવિતનો સાહજિક આવિજ્ઞાર કાન્તના 'ઉદ્ગાર', પાઠકસાહેબના 'છેલ્યું દર્શન' અને હરિશ્ચદના 'નિર્દ્દિષ' અને નિર્મળ આંખ તારી' કાવ્યોમાં મળે છે. ચિંતન, ઊર્મિ અને કલ્યાના સપ્રમાણરીતે એકરૂપ થઈ સમન્વય સાવે છે તેથી તે આપણાં ઉત્તમ ઊર્મિકાવ્યો પણ છે.

જનની વિશેના મૃત્યુજન્ય શોકનાં કાવ્યો સુંદરમું, ઉશનસ્કુ, ચંદ્રવદન મહેતા, કૃષ્ણલાલ શ્રીધરાણી, યોગેશ્વરજી વગેરેએ આચ્ચાં છે તેમાં માતૃસંવેદનની ઉત્કૃષ્ટ અભિવ્યક્તિ 'મારી બા'માં આરાધ્ય ઈશ્વર સ્વરૂપમાં આવેખાઈ છે :

“ના વિસ્તારું નેત્ર કરી અમીનાં
અપત્ય ગ્રીતિ પસરંત હીના
ને બીજાં હું તુજ રૂપ ભાણું
માતૃત્વની ત્યાં કવિતા નિહાણું”

ઉત્તમ વિષાદકાવ્યોમાં બાલમુકુંદ દવેરચિત 'દાદીમાનો ઓરડો'માં વૈશ્વિક સ્તરે વાપી જતો કવિહૃદયનો વિષાદ અને આશાસન એક નવો જ ભાવવળોટ લાવે છે. કાવ્ય તેથી હૃદયંગમ બની રહે છે :

“અનેક સુખદુઃખના સમરણના પદારા સમ્મો
સૂનો ભરખવા ધસે અહૃહ ! એ જ આ ઓરડો
હવે નયન બા ! બધી જ તમને રહે હુંદતાં
વિસ્તાત તમ દર્શની અવ રહી છ પીડી જ કે
નિમંત્રી રહું પોઢવા સકલ વિશ્વ વૃદ્ધત્વને
અને સકલ વૃદ્ધમાં વિલસતાં દીસો બા તંગે.”

રાવજની કવિતામાં વેદનાનો એક અનોખો અવાજ મળે છે. એણે વિષય કરતાં અભિવ્યક્તિનાં નવા ઓજસ આચ્ચાં. મણિલાલ દેસાઈ માટે લખેલી રચનામાં એ ઓજસ મળે છે.

“તું કવિતા થઈને
લય લહીયું દિલ ખોલ,
તું મારી મારીનો જાયો મારીના સ્તનમાં
કયાં સંતાયો ?
મીઠા લયના સર્પ-મણિધર
ઉસવાનું હું છોડ,
હું કયાં હું દુલ્ભર્યી માતા

કે ફરી ફરી
મારા મનમાં જન્મી જન્મી શાસ છોડતો.”

આત્મીય મિત્રના મૃત્યુ પછી તેના સ્મરણના ઉંખથી વ્યથિત કવિના આ ઉદ્ઘાર છે. ચિનુ મોટીના ‘પિતાની પ્રથમ પુછુયિથિએ’ કાવ્યમાં સમય દ્વારા પિતૃસ્મરણ અને મનોદશા જે રીતે નિરૂપાયાં છે તે માટે ઉશનસ્ય કહે છે “આવી શોકરંબેદનાને માત્ર વ્યક્તિમાં જ નહીં, સમાચિમાં પણ મંડરાતી જતી જોઈ છે. “વહે ધીમે ધીમે મુજ ઉર દશાને ધર બધું.”

“તમારાથી હુંયે દૂર દૂર થતો જાઉં, હળવે
મને યે હે ધક્કો સમય.”

અતિમ બે પંક્તિઓ સૌનેટની ચોટને બરાબર ધાર કાઢી આપે છે અને સચોટ બનાવે છે.

અર્વાચીન ગુજરાતી કવિતામાં ‘મરણનિમિત્તક કરુણપ્રશસ્તિ’માં જે વિશાળ પટમાં શોક, વિષાદ અને કરુણને વહેવાની મોકળાશ છે એની સરખામજીમાં, જે તે કાવ્યરૂપની મર્યાદામાં રહી કવિ કાવ્યાત્મકતા અને કલાત્મકતા સિદ્ધ કરવા પ્રેરણ ત્યારે લાધવનું કોશલ, કાવ્યની પંક્તિસંખ્યા અને સર્વર્થી વિશેષ, અનિવાર્યપણે કૃતિના કેન્દ્રમાં વિષાદની વેંત ઊંચી અભિવ્યક્તિ મળે ત્યારે લઘુ વિષાદકાલ્યો એક જુદી જ ઓળખ મુદ્રાંકિત કરી દે છે અને એ ઓળખ વિષાદની ભાવાભિવ્યક્તિ, શોકોદ્ગાર અને કરુણની રસનિષ્પત્તિ મુજય અને કાવ્યરૂપનું વૈવિધ્ય ગોણ બની રહે છે. શોક અને વિષાદના ઉદ્ઘગમનું વૈવિધ્ય, વિષાદમાં રૂપાંતર, કૃતિઓમાં સધાતી કલાત્મકતાની સાથે મળતી ઉત્તમ કવિતા લઘુ વિષાદકાલ્યોની અર્વાચીન ગુજરાતી કવિતાને મહત્વની દેન છે. કરુણપ્રશસ્તિથી સ્વરૂપે લઘુ છતાં કરુણ-પ્રશસ્તિની કક્ષાનો જ શોક, વિષાદ અને કરુણ સિદ્ધ કરતાં હોવાથી આવાં કાવ્યો લઘુ વિષાદકાલ્યો તરીકે ઓળખાયાં છે.

સાભાર સ્વીકાર

પ્રકીર્ણ

(૨૩૮) કેન્સર સામે FACE : રજૂઆત : ડિલીપ ગોહિલ, ૨૦૧૩, આર. આર. શેઠ એન્ડ કંપની પ્રા. લિ., મુંબઈ-અમદાવાદ, પૃ. ૧૮૪, રૂ. ૧૫૦/- (૨૩૯) માઈનસે કરો ખસ : વેમૂરિ બલરામ, ૨૦૧૨, આર. આર. શેઠ એન્ડ કંપની પ્રા. લિ., મુંબઈ-અમદાવાદ, પૃ. ૧૦૪, રૂ. ૮૦/-

સમીક્ષા/ગ્રંથાવલોકન

‘ગિરનાર સાદ પાડે છે’ : બે અનેરાં દીર્ઘકાવ્યો | બિધિન આશર

[‘ગિરનાર સાદ પાડે છે’ : લે. ઉર્મિશ વસાવડા, પ્રકાશક : મીડિયા પલ્ટિકેશન, પ્રથમ આવૃત્તિ : ૨૦૧૧, કિ. રૂ. ૮૦, પૃ. ૪૪]

જૂનાગઢના વતની ડૉ. ઉર્મિશ વસાવડા કવિ તરીકે પ્રસિદ્ધ છે. ‘પીંઠાનું ઘર’, ‘ટહુકાનાં વન’, ‘પુષ્પનો પગરવ’ જેવા એમના પ્રકાશિત થયેલા કાવ્યસંગ્રહોમાં વિવિધ સ્વરૂપની કાવ્યરચનાઓ જોવા મળે છે. તાજેતરમાં એમનાં બે વિશિષ્ટ પ્રકારનાં પુસ્તકો પ્રકાશિત થયાં છે. એમાંનું પ્રથમ છે ‘ગિરનાર સાદ પાડે છે’ અને દ્વિતીય છે ‘નાનીલુ’.

‘ગિરનાર સાદ પાડે છે’ પુસ્તકમાં બે દીર્ઘકાવ્યો ગ્રંથસ્થ થયાં છે. કવિએ ગજલના પરમ્ભરાગત સર્જનથી ઉક્રા ચાલીને આ કાવ્યો લખ્યાં છે. આ બે દીર્ઘકાવ્યોમાં એક ગિરનારવિષયક છે. ગિરનાર સૌરાષ્ટ્રમાં જ નહીં, પરંતુ ભારતભરમાં પ્રસિદ્ધ છે. આ ગિરનાર માત્ર પર્વત નથી, પરંતુ ભારતીય લોકમાનસમાં પૂજયભાવ ધરાવતું પ્રાચીનતમ તીર્થધામ છે. કવિશ્રાંતે ગિરનારની પ્રાચીનતા, એમનાં નામો, કૃષ્ણ, ઉગ્રસેન, ચન્દ્રગુપ્ત મૌર્ય, સમાટ અશોક, રાજીવી વલભી, ચુડાસમા, નવધાણ, ખેંગાર, માંડલિક, જયસીહ, મહિંગા, રાણકદેવી, નરસિહ મહેતા, કાઢુ મકરાણી, કાળુ મેર, જમિયલશા દાતાર જેવા ઈતિહાસખ્યાત વ્યક્તિઓ સાથેના સંબંધોને અહીં કાવ્યાત્મક રીતે નિરૂપાં છે. ગિરનાર પોતે જ એક જીવંત પાત્ર તરીકે આવીને પોતાની પ્રાચીનતાથી માંડીને આજપર્યંત જોવા મળતી રિસ્થિત વિશે કહે છે. કવિની આ પ્રકારની કાવ્યરીતિ વિશેષ આસ્વાદ બની રહે છે. ભાવ અને અભિવ્યક્તિનું વૈવિધ્ય ભાવકને ભીજે તેવું છે. ગિરનાર પોતાના અતીત તરફ ધ્યાન કરે છે ત્યારે તે શું જુયે છે ? કેવું અનુભવે છે ?

“કશું નથી ચોપાસ, ભીતરથી

સળગું હું હિન્દારાત

અચાનક જળ વરસે તો

જીવને થશે નિરાંત,

ખબર નથી કે આમ એકલા

ઉભા રહેવું મારે કયાં લગ ?”

ઈતિહાસિક સત્ય છે કે પ્રાચીન સમયમાં ગિરનાર લાવારસ ભરેલો પર્વત હતો. ઉંકળતો લાવા ગિરનારને દાઢાડ્યા કરતો હતો અને આસપાસની વનરાજીને પણ વેરાનમાં પરિવર્તિત કરી દેતો હતો. સેંકડો વર્ષો સુધી ગિરનારે વેરાનિયતનો અનુભવ કર્યો છે. એ પછી એમની ભીતર રહેલો લાવા શાંત પડે છે અને એમની આસપાસ

પ્રકૃતિનું રમ્ય વાતાવરણ સર્જાય છે. કવિએ આ પરિવર્તિત સ્થિતિને અહીં સરસ રીતે કાવ્યસ્થ કરી છે. ગાઢ જગતો ફૂટી નીકળે છે, નાળાં-જરણાં ખગખળ વહેવા માંડે છે, પંખીઓના કલશોર સંભળાવા માંડે છે, વાજુનો સુસવાટ સંભળાય છે, ચારેકોર વનરાજી સુંદર દશ્ય સર્જતી દેખાય છે. અંહિસક અને હિસક પશુઓ ફરવા માંડે છે. ગિરનાર પોતાની આસપાસ આવી અદ્ભુત સૃષ્ટિ નિહાળી હરખાય છે અને પ્રભુનો ઉપકાર-વરદાન માને છે. આ પછી તો ધીમે ધીમે માણસ આવે છે, સમાજ સર્જાય છે, કુટુંબો રચાય છે, ભાષા જને છે અને એ રીતે સંસ્કૃતિનો વિકાસ થતો રહે છે.

ગિરનાર પોની આસપાસ વિસ્તરતી જતી પ્રકૃતિ અને સંસ્કૃતિને કૌતુક દાખિએ જોયા કરે છે. બધા દેવો દામોદર કુંડની રચના કરે છે અને તેમાં દરેક તીર્થનું જળ પધરાવે છે. કૃષ્ણો પણ ગિરનારનો સ્પર્શ કર્યો હતો. કાળયવન પાછળ પડ્યો હતો ત્યારે કૃષ્ણ ગિરનારની ગુફામાં સંતાપા હતા અને એમણે મુચ્યકંદ મુનિના કોધનો ભોગ બનાવીને કાળયવનને કેવો બાળીને ભસ્મ કરાવી દીધો હતો તે પૌરાણિક પ્રસંગને પણ કવિએ અહીં નિરૂપ્યો છે. ગિરનારની તળેટીમાં નગર વસ્યું હતું અને ઉગ્રસેને તેની ફરતે કોટ બંધાવી આપ્યો હતો. ચંદ્રગુપ્ત મૌર્યે સુદર્ધન સરોવર બંધાવ્યું હતું. કાળના વહેણમાં ગિરનારે અતિવૃષ્ટિની વિકરાળતા પણ અનુભવી હતી. રાજવી રુદ્રામને નગરનો શ્રાવોદ્ધાર કરાવ્યો હતો. સમાત અશોકે અહીં શિલાદેખ કોતરાચ્ચ હતા. જૈન-બૌધ્ધ-શૈવધર્માઓ ગિરનારની તળેટીમાં હળીમળી રહેતા હતા. કેટકેટલી દંતકથાઓ પણ આ સ્થળ વિશે વહેતી થઈ છે. કવિએ આ દંતકથાઓ પ્રતિ આ રીતે નિર્દેશ કર્યો છે :

“દંતકથાઓ ઘણી અહીં છે,
અચૂત્થામા હજી જીવે છે.

દંતશિખર પર દંતાનેય ને
સાથે ગોરખનાથ બિરાજે.

વચ્ચે ઓઘદ કરી ટૂક
સજીવન થાય પૂનમની રાતે
સંગે અઘોર ઉમરું બાજે
વસે નવનાથ, સ્તિષ્ઠ ચોર્યસી
ચૌંસઠ જોગણીઓનો વાસ
દેવ કોટિકોટિનાં થાજાં
મારી ગુફા મહીં સમાણાં
ઘણા જોગી એવા દેખાય
જેને કાળ કરી નવ ખાય.”

ગિરનારની તળેટીએ કેટકેટલા સંતોનાં ચરણોએ સ્પર્શ થયો છે. તળેટીમાં કબીર, નાનક, મીરાંએ ભજનો ગાયાં છે. જૈન ધર્મના તો કેટકેટલા અવશેષો અહીં જોવા મળે

છે. કવિએ જૈન મંહિરોના ઉલ્લેખ સાથે નેમિનાથ અને રાજુલના જીવનપ્રસંગને પણ યાદ કર્યા છે. બને ગિરનારમાં આવ્યાં હતાં. વસ્તુપાળે મંહિરો બંધાવ્યાં હતાં. કવિએ આ દીર્ઘકાવ્યમાં વચ્ચે વચ્ચે દોહરા છંદનો ઉપયોગ કરીને અભિવ્યક્તિ વૈવિધ્ય પણ બતાવ્યું છે.

- * “કૃણખંડમાં થઈ ગયા ભવે રાજીવી ખૂબા;
- અંતે માટીમાં મજ્યા સાધુ હો કે ભૂપ.”
- * કેટકેટલી વારતા - કિસ્સા કથા અનેક;
- હજુ ધૂઝાવે છે મને કિસ્સો ઓવો એક.
- * દૂર તળાજ ગામના છોડીને દરબાર;
- આવીને નરસિંહ વસે ભક્તિનો અવતાર.
- * પીડ દીધી નરસિંહને નાગબાઈનો શાપ;
- નષ્ટ થયો એથી જ તો માંડલિક આપોઆપ.
- * હતાં પગથિયાં ના કહો કપરાં, હતાં ચઢાશ;
- લોકો આવી ના શકે એ જ મુસીબત જાશ.
- * વીતેલાં વરસો તણો આ છે ઢૂકો ચાર;
- થોડી અંગત વાત ને બાકી અન્ય વિચાર.
- * વાદળથી વાતો કરું એવું બનતું રોજ;
- આજ કરી આ વાત તો મને પડી છે મોજ.

કવિનું છંદપ્રભુત્વ આ દીર્ઘકાવ્યમાં સાચાંત જોવા મળે છે.

આ દીર્ઘકાવ્યમાં કવિએ નરસિંહ મહેતાને ભાવપૂર્વક યાદ કર્યા છે. એમની રચનાના કેટલાક અંશોને આવરી લઈને એક સરસ કાવ્યખંડ સર્જયો છે -

બાલમુહૂર્તમાં કોણ આ ગાય છે ને વળી સંગ કરતાલ બાજે
ચટકતી ચાખડી જૂલણા છંદમાં સૂર કેદારના નિત્ય સાથે
કંઠમાં ગીત છે જાગને જાદવા, કુડ દામોદરે સ્નાન કરવા
ઝંખતો પ્રેમરસ ભક્તિ ભૂતળ કરે નાગરો એક નરસિંહ નામે
હાથ બાળી અને રાસ નીરખી શકે રામના અમલમાં રાતોમાતો
નાત ને જાતનાં બંધનો ના નડે એ અધૂતવાસમાં ભજન ગાતો
નેત્ર વિષ નિરખતો ગગનમાં દીપ ને ગુણ વૈષ્ણવ તથા નિત્ય ગાવે
ગોપી ભાવે ભજે મોરનો પિરલઘર ભક્તિના લેદ એમાં સમાવે
હાર આપે હરિ મેઘ વરસાવતો ભર ઉનાણે વિના કોઈ વાદળ
પુત્રી કુવર તણા કાપડાઓ પૂરે વિકલો વાંચીને કોરો કાગળ
ભીડ જ્યારે પડી કૃષ્ણ આવી ગયા નિત નાં કેટલાં રૂપ ધારી
શામળે શેઠ થઈ ભક્તાની હુંડીને દ્વારિકાની બજારે સ્વીકારી

ગાય શુંગાર એ કૃષ્ણ કીડા તણો શબ્દમાં ના કશો છોછ રાખે
શુક ને શંકરે શાનથી જે પીઠો પ્રેમથી સહજ રસ એ જ ચાએ
ભક્ત નરસિંહથી હુંય પાવન થથો શબ્દ જ્યાં કાવ્યરૂપ પામ્યો
આ ધરા પર બીજો ભક્ત અથવા કતિ એ સમો અન્ય ના કોઈ આવ્યો.

નરસિંહ મહેતાના જીવન અને કવનના અંશોને કાવ્ય રૂપે રજૂ કરીને કવિએ પોતાની કવિપ્રતિભાનો પણ પરિચય કરાવી આપ્યો છે. ગિરનાર અને જૂનાગઢ એકબીજાના પર્યાય થઈ ગયા છે. કવિએ ગિરનાર અને જૂનાગઢ પ્રત્યેના પોતાના અનન્ય ભાવને આ દીર્ઘકાવ્યમાં પ્રગટ કર્યો છે.

કાવ્યના અંતે મુકાયેલી ‘ગિરનાર સાદ પાડે’ રદ્વીજ્વાળી એક સરસ મજાની છંદોબદ્ધ રચના કવિની ગજલપ્રતિભાની પરિચાયક બની રહે છે.

કોઈ અગમ શિખરથી ગિરનાર સાદ પાડે,
પ્રત્યેક ટૂક પરથી ગિરનાર સાદ પાડે.
ઓંખો અગર ભીંયું તો દેખાય દત્ત સામે,
કેવી અમી નજરથી ગિરનાર સાદ પાડે.
પળભર ઊભી પગથિયે પુલક્કિત થઈ જવાનું,
સ્પર્શી અદીઠ કરથી ગિરનાર સાદ પાડે.
મેં કાળમીઠ પથરાનું મૌન સાંલાયું છે,
લાગે બીજાચા અધરથી ગિરનાર સાદ પાડે.
આ તાલ મંજુરાનો, કરતાલ, ચાખડીઓ,
મીઠા પ્રભાતી સ્વરથી ગિરનાર સાદ પાડે.
આખા નગરને થાતો એવો અકળ અનુભવ,
જાણે સતત ભીતરથી ગિરનાર સાદ પાડે.

કાવ્યમાં કવિની આ બે કાવ્યરચનાઓ સ્વતંત્રપણે પણ આસ્વાદનો વિષય બને રહેવી છે.

કવિએ આ દીર્ઘકાવ્યના અંતે મધ્યકાલીન કાવ્યપ્રણાલીને અનુસરતી એવી કાવ્યપંક્તિઓ મૂકીને પ્રયોગાત્મક વલણ સાથે પોતાની નમતાને પણ પ્રગટ કરી છે.

જે કે સ્થૂલ્યાં મેં ગિરનારી સાદે, એ સર્વ લખતો ખુદના જ હાથે.
ભૂલો હશે એ સંઘળીય મારી, મોદું કરીને મન લો સ્વીકારી.

ગુજરાતી ભાષામાં ગિરનારવિષયક અન્ય ઘણીબધી રચનાઓ હોવા છતાં આ દીર્ઘકાવ્ય અનેરું છે.

આ પુસ્તકમાં બીજી દીર્ઘરચના છે ‘ઉત્તંક’. આ રચનામાં પૌરાણિક કાળના ઉત્તંક મુનિના જીવનપ્રસંગને અને કૃષ્ણ સાથેના એમના સંપર્કને નિરૂપવામાં આવ્યા છે.

મહાભારતના યુદ્ધથી અજાણ એવા ઉત્તંક મુનિ કૃષ્ણને યુદ્ધના સંહારના જવાબદાર ગણીને શાપ આપવા તૈયાર થાય છે. કૃષ્ણ સ્વર્સ્થ મને એમને કહે છે કે જીવનભર મહામહેનત કરીને તમે જે તપની મૂડી બેગી કરી છે તે શાપ આપીને શા માટે વેડફી નાખો છો !? ઉત્તંક મુનિને સત્ય અને કૃષ્ણનું સામર્થ્ય સમજાય છે. તે કૃષ્ણ પાસે એવું વરદાન માગે છે કે જ્યારે એમને તરસ લાગે ત્યારે પાણી મળી રહે. એક વખત તે મરુભૂમિ પર ફરતા હતા ત્યારે તેને તરસ લાગી અને એમણે કૃષ્ણને યાદ કર્યા. તેમને પાણી મળ્યું. પરંતુ કૂતરાઓથી વીંટાળાયેલા ચાંડાલની નીચે થઈને એક વહેતા ઝરણાનું પાણી. ઉત્તંક મુનિ ગુસ્સે થઈ ઉઠે છે અને કૃષ્ણ સહિત ચાંડાલને ગાળો ભાંડે છે. એ સમયે કૃષ્ણ પ્રગત થાય છે અને ચાંડાલ તે ઇન્દ્ર હતા તેવું કહે છે. ઉત્તંક મુનિને પસ્તાવો થાય છે. મળેલું અમૃત તે પી ન શક્યા છતાં હવે તેને પાણી તો મળી જ રહેશે એવું કહી કૃષ્ણ અદશ્ય થાય છે. કવિએ આ પ્રસંગને કાવ્ય રૂપે રજૂ કર્યો છે. મહાભારતના યુદ્ધ પછી દ્વારિકા જતા કૃષ્ણની વિચારવિહુવળતાથી કાવ્યનો પ્રારંભ થયો છે :

“આ ભીષજા સંહારલીલામાં
મારો પણ છે ભાગ
એ જ વિચારે દાહ લાગતો
મનમાં પ્રજળે આગ.”

કૃષ્ણનું હૃદય અવસાદથી ઊભરાતું હતું. ઉદાસીનતાએ એમને ઘેરી લીધા હતા. કાળપુરુષની લીલા એમને સમજાતી નહોતી. આવી વિચારશીલ સ્થિતિમાં તેઓ ઉત્તંક મુનિને મળે છે. ઉત્તંક મુનિના વ્યક્તિત્વની રેખાને કવિએ આ શબ્દોમાં દોરી આપી છે :

“સાવ અડિચન, જીર્ણ વસ્ત્ર
ને કાબરચીતરો વેશ
અસ્તવ્યસ્ત ગ્રૂચ ભરેલા
લાંબા એના કેશ
દીર્ઘ વધેલી દાઢીમાં છે
વાળ વધારે શેત
કેમ કરુણા ઊપજે મનમાં
અને જોતાવેંત.”

વિશ્િ માટે ગયેલા કૃષ્ણ પણી બનેલી ઘટના વિશે ઉત્તંક મુનિ કશું જાણતા નહોતા. આજે તેઓ આ વિશે જિજ્ઞાસા વ્યક્ત કરે છે. કૃષ્ણ મહાભારતના યુદ્ધ વિશે કહે છે ત્યારે મુનિ કૃષ્ણને આકરં વેણ કહે છે :

“યુદ્ધ રોકવાની ક્ષમતા ના,
સહેજે તમે બતાડી

પરમ શાંતિના પથ પર
 ઘેલી પગલી તમે ન પાડી.
 દેવ ભવે દુનિયા માને પણ
 તમેય નીકળ્યા પામર.”

કૃષ્ણ કર્મના બંધન સામે પોતાની વિવશ સિથિત મુનિશ્રીને સમજાવે છે :
 “કાલ થવાનું છે જે એને
 કોઈ શકે ના યણી
 નેવાનાં પાણીને મોબે
 હુંય શર્કું ના વણી.”

મુનિ કૃષ્ણના ગીતાવચનને શબ્દોનો આંદબર કહે છે. કૌરવને યાદવસેના ન આપી હોત અને પ્રાર્થના રથની ધૂરા જો કૃષ્ણએ સંભાળી ન હોત તો પણ યુદ્ધ અટકી શકત. કૃષ્ણ તો સર્વશક્તિમાન છે એવું કહી મુનિ કહે છે :

“તમે કેટલી વાર કાળનાં
 પાસાંઓ પલટાયાં
 ઋષિપુત્રને પાતાળેથી
 જીવતો પાછો લાવ્યા
 દરિયાને લાવીને કારી
 ગોમંતકની આગ
 જમનાના જળમાં પેસીને
 નાથ્યો કાળિનાગ.”

કૃષ્ણ મુનિશ્રીએ પોતાની સિથિત અને કરેલા પ્રયત્નોનો ખુલાસો કરે છે છતાં મુનિ શાપ આપવા તૈયાર થાય છે ત્યારે કૃષ્ણ કહે છે :

“શાપ મને આપો એનાથી
 મને કશ્યું ના અહશો
 પણ સમજુ લો તમને મુનિવર
 ફેર ભયંકર પડશો
 જે થોડી તપની છે મૂરી
 એ ખરચાઈ જશો.”

મુનિવરને પોતાની ભૂલ સમજાય છે. તે કૃષ્ણની ક્ષમા માગે છે. કૃષ્ણ એમને વરદાન માગવાનું કહે છે. મુનિવર પોતાની જાતને ધન્ય સમજે છે અને અધોર જંગલમાંય એમને તરસ લાગે તો પાણી મળી રહે તેવું વરદાન માગે છે. થોડા સમય પછી તરસથી વ્યાકુળ મુનિવર પાણી માટે કૃષ્ણનું સમરણ કરે છે. કૃષ્ણ ઠિન્દને મુનિવરની તરસ છિપાવવા કહે

છે ત્યારે ઈન્દ્ર કહે છે :

“પ્રભુ તમે શું મારું ?
કેમ અડપતું સાવ અચાનક
આજે મનમાં આવું ?
એ અમૃતને પાત્ર નથી તો
શું કામ એને આપું
સાવ અકારણ લખચોરાસી
એની ક્યાંથી કાંપું ?”

કૃષ્ણના આદેશથી ઈન્દ્રને જવું પડે છે, પરંતુ તે ચાંડાળનો વેશ લઈને જાય છે.
કેવા જળ વરચે તો ઊભો રહે છે :

“જળની વરચે ઊભા રહીને નહાતોંતો ચાંડાળ
હત્તાં સાથમાં કૂતરાં એના મહોંથી ટપકે લાળ
દેહ ઉપર બણાલાણી માખો વાસ અતિશય આવે
હતી જુગુપ્સાભરી સિથએ પાણી ક્યાંથી ભાવે ?

મુનિવર આ પ્રકારે મળેલા પાણીને નિહાળી કોવિ ભરાયા છે, પરંતુ એ ક્ષણમાં
જ બધું અદિષ્ય થાય છે અને કૃષ્ણને સામે ઊભેલા જુએ છે. કૃષ્ણ મુનિવરને ઈન્દ્રજ
અને અમૃત વિશે કહે છે ક્યારે એમને અફ્સોસ થાય છે. કૃષ્ણ કહે છે :

“સામે છે એ કમળ નિહાળો જુઓ કદ્દી ના કાદવ
આમ કર્મના બંધનથી તો ચાલે છે સંસાર
તોય ભાગ્યવશ આવે દુર્લભ ક્ષણ એકાદીવાર
એ જ્યારે આવે છે ત્યારે અધરી કરે કસોટી
હેમખેમ એ પાર કરી લો તો સિદ્ધ છે મોટી.”

કવિએ માનવજીવન અને જીવનમાં આવતા અવસરો સંદર્ભે તાત્ત્વિક વિચારોને
કાવ્યરૂપ આયું છે :

“જુદાં જુદાં રૂપ ધરી
અવસર આવે જીવનમાં
ક્યાંક વિપદ લાગે તો
ઉઠે ક્યાંક સમસ્યા મનમાં
પીડાની એના લઈને
અવસર આવે છે એમ
પ્રશ્ન થાય આપણને મનમાં
મને જ આવું કેમ ?
વિપદની બીજી બાજુની

ચાખો ત્યારે જાણ
 તો જ મળેલો અવસર કરશે
 જીવનનું કદ્યાજી
 તેમ છતાં પણ ચૂકી જાવ તો
 શોક કરો ના મનમાં
 જુઓ રાહ નક્કી છે
 પાછી ક્ષણ આવે જીવનમાં.”

કૃષ્ણાના મુખે ઉચ્ચારાયેલાં આ વચનો માનવને જીવવાનો એક તરીકો-અભિગમ ચીધે છે.

‘ગીરનાર સાદ પાડે’માં ગ્રંથસ્થ બંને દીર્ଘકાવ્યો કવિશ્રી ઉર્વીશ વસાવડાની કવિપ્રતિભા સાથે એમારો માનવજીવન વિશે કરેલા ઊંડા ચિંતનનો પરિચય કરાવે છે. ગજલકાર-ગીતકાર આ કવિ દીર્ଘકાવ્યના સ્વરૂપને પણ બરાબર જોડી શક્યા છે.

લોહીનીંગળી પાંખે | રજનીકુમાર પંડ્યા

[‘શૈશવથી સંધ્યા સુધી’: કમલાબહેન પરીખ, ફુતિ પ્રકાશન, પ્ર. આ. ૨૦૦૫, કિ. રૂ. ૫૫/]

‘અમે પાટીદાર કન્યાઓ તે સમયે જન્મની સાથે જ ‘સાસરું’ શબ્દ લઈને આવતી હતી.’

‘તે સમયે’ એટલે ગુજરાતની ચરોતરી પાટીદાર કોમના સંદર્ભમાં ૧૯૨૫ની આસપાસનો સમયગાળો! આમ તો તે પહેલાનાં સમયને પણ લાગુ પડે અને આજ સુધીના સમયને પણ અને દૈવ જાળો કે હજુ પણ ક્યાં લગી એ શબ્દો ઓછાયા લંબાશે એ ભાખી શકાતું નથી. પણ એ થોડા શબ્દો અંદરથી જાળી ગયેલી એક સ્વમાની સ્ત્રીના ઉના નિસાસા જેવા છે. આ શબ્દો લખનારાં સન્નારી તે ૨૧૧૧ના ડિસેમ્બરની ૨૬ મીએ ચોરાસી વર્ષની વયે સદાને માટે આંખો મીંચી દેનારાં એક ગુજરાતી લેખિકા કમલાબહેન ધીરુભાઈ પરીખ, ધીરુભાઈ પરીખ એટલે ગુજરાતી સાહિત્ય પરિષદના વર્તમાન પ્રમુખ, એક ઉત્તમ કવિ અને ગાંધીકાર, અને વિશેષ યાદ રહી જાય તેવી તેમની ઓળખ તે નેવું વર્ષથી પ્રગટ થતા અને ગુજરાતના નાગરિકોની ચાર ચાર પેઢીનું સંસ્કાર-સંવર્ધન કરનારા ‘કુમાર’ માસિકના ૧૯૮૦થી સ્વેચ્છાએ વગરપગારી સફળ અને વિદ્વાન તંત્રી.

૨૦૦૪ સુધી મોટા ભાગના વાત-સવાદિયાઓ માટે જે ગુસ્પાસ (ગોચરાઓ)નો વિષય રહી હતી, પણ જેનો અસલી મામલો બહુ ઓછા લોકો જાણતા હતા તેવી અનોખી સંઘર્ષત્બક સ્મૃતિકથા ૨૦૦૫ની સાલમાં બુદ્ધ કમલાબહેનની કલમે લખાયેલી સંક્ષિપ્ત આત્મકથા ‘શૈશવથી સંધ્યા સુધી’ના સ્વરૂપે બહાર આવી. ત્યારે બધી રસ-અપરસ ઝરતી ગુસ્પાસોનો અંત આવી ગયો, અને પતિપત્ની બંનેનું નિર્મણ ચરિત્ર નજર સામે ઊંઘડી ગયું. વાતચીતની તદ્દન સાદી શૈલીમાં લખાયેલી કમલા પરીખની એ આત્મકથા કેવલ

બચપણાનાં મીડાં સંભારણાંની બિધાત નથી. તેમાં તો ચરોતરની પાટીદાર કોમની એક સ્વમાની નારીને જકડી રાખતા રૂઢીના અને જુનવાળી માનસના કઠીર નાગપાશ અને એમાંથી સ્વયંસિદ્ધ બનીને એણે હાંસલ કરેલી મુક્તિની ગાથા છે. અને એ પછી પણ એણે સહન કરવી પડેલી વેદનાની વાત છે.

એક વાર પરણીને અને એક પુત્રની માતા બન્યા પછી જડબેસલાક રુઢિચુસ્ત પતિથી અલગ થઈને અમદાવાદમાં પિતાના ઘેર રહેતાં મૂળ સોજિત્રાના કમલાબહેન ગોરધનદાસ પટેલ અને વીરમગામના વેષ્ણવ પરિવારના ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખ ૧૮૬૪માં કેવી પરિસ્થિતિમાં લગ્નગ્રંથિથી જોડાયાં ? તે પછી અને કારણે કમલાબહેનને કેવાં સંકટોનો સામનો કરવાનો આબ્યો, કેવી કેવી આકરી હૃદયવિદારક વેદનામાંથી પસાર થવું પડ્યું ?

આ બધા સવાલોના નિખાલસ જવાબો એ આત્મકથામાંથી સાંપડે છે.

પરંપરાવાદી અને દહેજપ્રથામાંથી હજુ પણ સંદર્ભ મુક્ત ના થઈ શકનારી જોડા જિલ્લાની પાટીદાર કોમના હુન્યવી સુખસાધબી ધરાવતા પરિવારમાં એ ૧૮૨૭માં સાપેમ્બરની ૧૮મીએ જન્મ્યાં પણ સમજણાં થતાં થતાંમાં તેમના મનમાં પ્રસંગ પ્રસંગે દહેજની અને વહુઆરુઓ પર ગુજરાતા સિતમની એવી એવી વાતો ઠવાતી ગઈ હતી કે લગ્નના નામમાત્રથી એ ભડકતાં રહેતાં હતાં, પરંતુ લગ્ન કર્યા વગર છૂટકો નહોતો. નાનપણમાં પિતાની નોકરીના બદલાતાં સ્થળોને કારણે અમદાવાદ ઉપરાંત મુંબઈ-પેટલાદ-નિડિયાદ જેવાં સ્થળોએ રહેવાનું થતું હતું. જો કેવી સ્વાતંત્ર્યની ચણવણને કારણે છફ્ટા ધોરણનો શાળાકીય અભ્યાસ તો ૧૮૪૨માં જ શાળા-કોલેજે બંધ થવાને કારણે અધવચ્ચેથી હૂટી ગયો હતો. કિશોરાવસ્થા પૂરી થઈ એટલે મુરતિયાની શોધ ચાલી. ધર્મજના એક છોકરા સાથે નક્કી થયું. એ યુગમાં બનેની મુલાકાતની વાત ‘શાંતમ્ પાપમ્’ ગણાતી, એટલે આપાતી માહિતીઓને આધારે અને તે પણ જ્ઞાતિના ચોક્કસ ગોળમાં જ ચોકઠાં ગોઠવાતાં. ધર્મજવાળા છોકરાના ભણતર અને જમીન-જગીર વિશે બહુ ઊજાંનું ચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું, જે વાસ્તવિકતાથી વિપરીત હતું.

૧૮૫૧માં કમલાનાં ચોવીસ વર્ષની વયે પાંચ હજાર રૂપિયા દાયજના આપીને લગ્ન લેવાયાં જે એ વખતે બહુ મોટી રકમ લેખાતી પરંતુ દરેક રીતે કજોડું એવા આ લગ્ન બે-ત્રણ વર્ષમાં જ પડી ભાંયાં. સાસરવાસમાં વેઠેલા ત્રાસની વાતો લખવાનું કે એ પતિ વિષે એક શબ્દ પણ ઘસાતું લખવાનું કમલાબહેને બહુ સંયમપૂર્વક ટાયું છે; નહિ તો એ કથની પણ ઓછી વેદનાભરી નહીં હોય. વાંચનાર પામી શકે કે બે વાક્યોમાં સમાવાયેલી એ દસ્તાવેજ વાતની કેસ્યુલમાં અંસુભીનાં વીતકના કેટલા દરિયા ભર્યા હશે ! ૧૮૫૪માં એ અકારો સાસરવાસ છોડ્યા પછી એક-દોઢ વર્ષના પુત્રને લઈને બાપને ઘેર અમદાવાદમાં રહેવા આવી ગયાં પછી બે ભાઈ અને ચાર બહેનો અને

માતા-પિતાના પરિવારમાં જિંદગીબર પુરાયેલાં રહેવા સિવાય બીજો શો વિકલ્ય હોય ? પણ કમલાબહેન પોતાની અભ્યાસ કરવાની અધૂરી મંશા પૂરી કરવાનું નક્કી કર્યું. જુનવાળી વિચારો ધરાવતો પરિવાર એક નાના બાળક સાથે સાસરેથી પાછી આવેલી દીકરીને અધૂરો અભ્યાસ પૂરો કરાવવા રજી નહોતો, કારણ કે એ ભણવા જાય તો તેના નાના બાળકને સાચવે કોણ ? અને પરણાવવાની ઉતાવળમાં વરપક્ષ માગે તે દાયજો આપવાની તૈયારી રાખનારા માવતર ભણવાવવાની તદ્દન વિસુદ્ધ હોય ત્યારે નિશાળની સાવ નગણ્ય ગણાય રેવી હી આપવાની હા શા માટે પાડે ? પણ કમલા હિંમત ના હાર્યા ઘરના પ્રચંડ વિરોધ વર્ચ્યે પણ એમણે પંદર વર્ષે ૧૮૫૭માં ફીની જેમતેમ જોગવાઈ કરીને ખાનગી ટ્યૂશન કલાસની વાટ પકડી. એસ.એસ.સી. ૬૭ ટકા માર્કથી પ્રથમ વર્ગમાં પાસ કરી, એલ.ડી. આર્ટ્સ કોલેજના દરવાજામાં દાખલ થયાં. હવે તો કોલેજની ફીની મોટી સમસ્યા હતી. પણ આટલી આકરી તાવણી દરમિયાન પણ આશાવાદી માનસ જાળવી રાખનારાં કમલાબહેન પ્રિન્સિપાલની ચોમબરમાં દાખલ થયાં. પોતાની કથની અને ભણવાની લલક પણ વ્યક્ત કરી. પ્રિન્સિપાલ આર્ટી ડી. ટેસાઈઓ એમની કરુણ પરિસ્થિતિ નાણી-જાણીને આ કોલેજમાં ભાગે ત્યાં સુધી છેકની ફીશિપ બક્ષીને એ સમસ્યા પણ હલ કરી આપી. કમલાબહેન પૂરી લગનથી ભણવામં ધ્યાન પરોવી દીધું. ૧૮૬૭ ઉમાં એમ.એ.ની પરીક્ષા બીજા વર્ગમાં પાસ કરીને એ જ કોલેજમાં ભણવાવવાની નોકરી લીધી.

પણ આ સફળતા સામેથી મુસીબતોની ઝિકાતી તોફાની વાઇટની સામે ગતિ કરવાનું નૈતિક બળ પૂરું પાડતી હતી, અને એની વધુ જરૂર હવે પડવાની હતી, કારણ કે આ તરફ સાસરાપક્ષ તરફથી છૂટાછેડા માટેની કાર્યવાહી શરૂ થઈ ચૂકી હતી. કમલાને નોટિસો જતી હતી પણ એ જાણીબુઝીને કોર્ટ હાજર રહેતાં નહોતાં કારણ કે એમને જે જોઈનું હતું એ કોર્ટમાં હાજર રહેવાથી નહીં પણ હાજર ના રહેવાથી મળે તેમ હતું. અને એમ જ થયું, એટલે અંતે એકપક્ષી ચુકાદાથી ૧૮૬૭ ઉમાં છૂટાછેડા મળી ગયા, ‘ગજેન્ડમોક્ષ’ થયો. હવે પુત્ર દેવેશ પણ દસ વર્ષનો થયો હતો. અને ભણવાય બીજું કોઈ જીવનકાર્ય રહ્યું હતું ?

હા, એક નવો સૂર્ય ઉત્તીયમાન થઈ રહ્યો હતો. કોલેજના અભ્યાસકાળ દરમિયાન પોતાની નાની બહેન પ્રભાને ત્યાં નજીકમાં ચંદ કોલોનીમાં અવારનવાર જવાનું થતું હતું ત્યારે બાજુમાં રહેતા એક પ્રોફેસર ધીરુભાઈ પરીખને પણ માર્ગદર્શન માટે મળવાનું થતું હતું. ખાનગી ટ્યૂશન કલાસમાં કમલા ભણતાં હતાં ત્યાં પણ ધીરુભાઈ વર્ગો લેતા હતા. વીરમગામના ડૉ. ઈશ્વરભાઈ પરીખના ૧૮૮૭ ઉમાં જન્મેલા તેજસ્વી પુત્ર એવા ધીરુભાઈ લગ્ન નહિ કરવાના પણ સાથે પરિવારે જદ કરીને કરાવેલી બે સગાઈઓ તોડીને પિતાની ખફગી વહોરી ચૂક્યા હતા, પણ આ જૂઓાનું સ્ત્રીને જોઈને દર્વી ગયા. એમણે પ્રભાબહેન મારફત કમલા સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો પણ કમલાબહેન પોતાની

સાથે પુત્ર હોવાને લીધે ખચકાતાં હતાં. સહદયી ધીરુભાઈ એ સમજી શકતા હતા. એમણે એ બાળકન પોતાના સગા પુત્રની માફન અપનાવવાની ખાતરી સાથે આખરે ૧૮૬ રૂમાં એ બેઉએ લગ્ન કરી લીધાં, આ પગલાને લીધે કમલાનાં ત્રણ મોટાં બહેન અને બનેવીઓ સિવાયના પૂરા પિતૃપક્ષે તેમનો કાયમી બહિઝાર કર્યાનું જાહેર કર્યું પણ તે હીકતને કમલાએ મન પર લીધી નહીં. કારણ કે પુત્ર પોતાની પાસે હતો. અને ધીરુભાઈ તો ખરા ! ધીરુભાઈના બન્ને ભાઈઓ મહેન્દ્રભાઈ અને પ્રફુલ્લભાઈ સાથે પણ એ હળી ગયો હતો. ધીરુભાઈના પિતાજીએ પણ એને પૌત્ર તરીકે અપનાવી લીધો ! હવે કોઈ વિંતા નહોતી. ૧૮૬ રૂમાં તેમને ત્યાં પુત્રી નિયતિનો જન્મ થયો.

શું હવે બધું સુખ જ સુખ હતું ?

ના, યુદ્ધનો હજુ અંત ના આવ્યો. પૂર્વ સાસરાપક્ષ તરફથી પુત્રના કબજા માટે કાયદેસરની કાર્યવાહી થઈ અને કમલાએ બીજા લગ્ન કરી લીધાં હોવાથી બાળકને એના પિતાને સૌંપી દેવાનો હુકમ થયો અને ભારે હૈયે એનો અમલ પણ કરવો પડ્યો. અગિયાર વર્ષનો પુત્ર માતાથી વિખૂટો પડીને જેનું સાનિધ્ય પોતે લગ્ન પણ માણ્યું નથી તેવા પિતા પાસે ધર્મજ રહેવા ગયો, કમનસીબે કમલાનો પિતૃપક્ષ પણ પોતાના એ જૂના દેવાઈઓના સમર્થનમાં હતો. થોડા સમયમાં એ પુત્ર દેવેશ અમદાવાદ મામા કે જે કમલાબહેન સાથે બોલવા વહેવાર પણ રાખતા નહોતા બલકે એમનો તિરસ્કાર કરતા હતા એમને ત્યાં રહેવા આવી ગયો કારણ કે મોસાળવાળા તેને ધર્મજ નહીં અમદાવાદ રાખીને ભાજાવવા માગતા હતા. મા-દીકરો એક જ શહેરમાં આવી ગયાં, દેશમાં જ પરદેશ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું. એકબીજાને મળવાની સખત મનાઈ ફરમાવાઈ એનો ભંગ થાય તો પુત્રનો અભ્યાસ ત્યાં અટકી પડે તેવી તલવાર માથે લટકતી હતી. જોકે કમલાબહેન લાખે છે કે અમારા ઘરની નજીક એક હોસ્પિટમાં એ રહેતો ત્યાં પ્રસંગોપાત્ર હું એને ચોરીછૂંપીથી મળી લેતી.'

કમલાબહેનના એક ભાઈ અને ત્રણ બહેન-બનેવીઓના અપવાદ સિવાય પૂરા પરિવારે તેનો બહિઝાર કર્યો પરંતુ, કમલાબહેનના હુદયે તો માતા-પિતા તરફ સતત ઝૂરાપો જ અનુભવ્યા કર્યો. તેમના બાની ગંભીર બીમારીના સમાચાર મળ્યા કે તરત પિતાને પત્ર લખીને તાબિયત જોવા દેવા આવવાની વિનવણી કરતો પત્ર લખ્યો પણ પિતાએ એને તરત જ ફાડીને ફેંકી દીધો ! કમલાબહેનને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે કારમો આધાત લાગ્યો. એમને ખબર મળ્યા કરતા હતા કે બાની આ બીમારી કદાચ જીવલેણ નીવડે એવી છે. શું કરવું ? શું બાનાં દર્શન એ દુનિયામાંથી વિદ્યાય થતા સુધીમાં એક વાર પણ મારા નસીબમાં નહિ હોય ? ખૂબ વિચારને અંતે એ પિતાના ઘરની બાજુમાં આવેલા એક પરિચિતના બંગલામાં ગયાં. એમના પોચ્છમાં એક ઊંચો ઓટલો હતો, તેની ઉપર એ ચઢ્યાં અને પોતાના ઘરની બારી પાસે ઢાળેલા ખાટલા

ઉપર અંતિમ માંદગીમાં બિધાને સૂર્તેલાં બાને જોયાં. ભૂલેચૂકે પણ બા આ તરફ એક વાર નજર નાખે એવી અપેક્ષા મનમાં ઊળી હશે પણ એ ફળીભૂત ના થઈ. આંખોમાંથી ચોધાર આંસુ વહી ચાલ્યાં. એ આ રીતે એમનું છેલ્ણું દર્શન પામીને ઓટલો ઉત્તરી ગયાં.

થોડા દિવસમાં જ બા અવસાન પામ્યાં. કમલાબહેનને કોઈએ ખબર સુધ્યાં ના આપ્યાં. પરાકાણા તો ત્યારે આવી કે બાના અવસાન પછી પિતાને મળવા ગયાં ત્યારે એ એકલાઅટૂલા પલંગ પર ઉદાસ ચેહેરે બેઠા હતા. કમલાને જોઈને એટલું જ બોલ્યા કે ‘મારા સાથીદાર મને છોડી ચાલ્યાં ગયાં.’ કમલા દૂસરે ચઢી ગયાં. એમને દોડીને જઈને એમના ખોળામાં મૌન નાખીને છુંદે મૌને રડી દેવાનું મન થયું પણ ત્યાં તો તેમના મોટાભાઈ રૂમમાં આવી ગયા, અને આ જોઈને એમણે તરત જ હાથ પકડીને સગીબહેનને બહાર કાઢી મૂકી.

પિતાનું એ દર્શન પણ અંતિમ નીવડયું. થોડા દિવસમાં એ પણ અવસાન પામ્યા.

વેદનાની વાત સાથે દિલ ઠારે એવી વાત દેવેશ અને નિયતિ પોતપોતાના ભર્યાભાઈયાં પરિવારો સાથે અમેરિકામાં સ્થાવી છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી ધરાવતો દેવેશ અને દસ વર્ષ સુધી અમદાવાદમાં દૂરદર્શન પર સમાચારવાચન કર્યા પછી બીજી ઓકેડેમિકલ ડિગ્રીઓ ધરાવતી સંગીત-નૃત્યવિશારદ નિયતિ એકબીજાને નોર્મલ ભાઈ-બહેનની જેમ નિયમિત હળેમણે છે. ધીરુભાઈ અને કમલાબહેન અવારનવાર અમેરિકા જતાં અને બન્નેને ત્યાં સારો એવો સમય ગાળતાં.

પુસ્તકના અંતભાગમાં કમલાબહેને ધીરુભાઈ સાથેના પોતાના મધુર દામ્પત્યની કેટલીક પ્રસન્નકર વાતો પણ લખી છે. જીવનને સંધ્યાકાળે ધીરુભાઈ કમલાબહેનના વ્યાધિગ્રસ્ત સ્વાસ્થ્યના સંદર્ભે કેવી કાળજી રાખતા અને એ બન્નેની દિનચર્યાં કેવી રહેતી તેની વાતો વાંચતાં બહુ સુખદ ચિત્ર વાંચનારના મનમાં ઊભરી આવે છે. પોતાના દિયરો અને એમના પરિવારની વાતો અને વિગતો બહુ આત્મીયભાવ અનુભવીને આવેખી છે.

અફ્સોસની વાત તો એ છે કે ૨૦૦૫ની સાલમાં પ્રગટ થયેલી આ આત્મકથા માત્ર પંચાવન રૂપિયાની કિમતે મળતી હોવા છતાં રસીકો-વિવેચકોનું બહુ ધ્યાન એના ઉપર બહુ પડ્યું નથી અને એની બીજી આવૃત્તિ પણ થઈ નથી. જોકે એ બન્ને પતિપત્નીએ એની બહુ જેવના રાખી હોય એવું પણ લાગતું નથી.

શ્યામ બેનેગલનો સર્વાંગ પરિચય આપવામાં

નિષ્ઠળ રહેલી પરિચયપુસ્તિકા | અભિજિત વ્યાસ

[‘શ્યામ બેનેગલ (પરિચયપુસ્તિકા)’ : લેખક : યાસીન દલાલ, પ્રકાશક : પરિચય ટ્રસ્ટ,
મુંબઈ, પ્ર.આ. ૨૦૧૩, પૃ.-૫૫, ડિ. રૂ. ૧૫/-]

પરિચયપુસ્તિકાનો હેતુ કંઈક એવો હોય છે કે એ જે વિષય કે વ્યક્તિના ઉપર
લખાયેલી હોય તેનો સર્વાંગ પરિચય મળે. એટલે જ્યારે કોઈ પરિચયપુસ્તિકા વાંચીએ
છીએ ત્યારે એ જેના વિશે લખાયેલી હોય તેનો પરિચય વાંચવા મળશે. પણ ક્યારેક
એવું પણ બને કે આ જાતનો ઉદ્દેશ પરિચયપુસ્તિકા વાંચીને ફળતો નથી. આવો જ
કંઈક અનુભવ યાસીન દલાલદેખિત પરિચયપુસ્તિકા ‘શ્યામ બેનેગલ’ વાંચતાં થયો.

માધ્યમ સંશોધક અને સમૂહ માધ્યમના નિષ્ણાત ગણાતા યાસીનભાઈ પાસેથી
મળેલી આ પુસ્તિકામાં જાણીતા ફિલ્મ ટિગર્શર્ક શ્યામ બેનેગલ વિશે માહિતી મળે છે,
ત્યારે થોડી અપેક્ષા રહે. અહીં પ્રથમ પૂર્ણથી જ ભાષાકીય ભૂલોમાં અનર્થ થવા શરૂ
થાય છે. લેખક લખે છે, ‘(બેનેગલે) એમણે એક વાર ગુરુદાતને પોતાના સહાયક બનવાની
ઓફર કરેલી’—પણ અહીં વાક્ય આમ જોઈએ – ‘ગુરુદાતે એમને (શ્યામ બેનેગલને)
પોતાના સહાયક બનવાની ઓફર કરેલી.’ આમ થોડાક શબ્દ ફેરમાં લેખક જે વાત
કહેવા માંગે છે તેમાં જ ગેરસમજ ફેલાય છે, કહો કે અર્થનો અનર્થ થઈ જાય છે.
પુસ્તિકામાં આ પ્રકારના ગેરસમજ ફેલાવતાં કે અનર્થ કરતાં અનેક વાક્યો પછી તો
વાંચવા મળે છે. એ જ રીતે નામ લખવામાં પણ અનેક ભૂલો થઈ છે. માની લઈએ
કે ક્યાંક પૂર્ણવાચનની ભૂલ રહી ગઈ હો પણ બાસુ ભજાચાર્યની જગ્યાએ દરેક વખતે
એમણે બાસુ ચેટજી જ લખ્યું છે.

લેખક યાસીન દલાલે શ્યામ બેનેગલની ફિલ્મોની સાથે એ સમયની ભારતીય
સિનેમાની ગતિવિધિઓ અને ફોર્મ્યુલાની અતિનાટકીયતા અને યથાર્થવાદને જોડા જોડ
મૂકી આપ્યાં છે. પણ એ બધાંની વચ્ચે બેનેગલની ફિલ્મોની કલાત્મક મુલવણી કરવાનું
ચૂકી ગયા છે. એટલે બીજી બધી ઈતર બાબતો વધુ વાંચવા મળે છે. પણ ઈતિહાસલેખન
એક બાબત છે અને કોઈ કૃતિનું સૌંદર્યત્વક રસદર્શન કરવું એ બીજી બાબત છે. આ
રસદર્શન કરવામાં અને કરવવામાં લેખક નિષ્ઠળ ગયા છે. જેમ કે ફિલ્મ ‘મંથન’ સંદર્ભમાં
તેઓ લખે છે : ‘આમ ફિલ્મનો અંત નિરાશાજનક છે.’ (પૃષ્ઠ-૨૨) જે વાચકને ચોંકાવી
દે છે. ‘મંથન’માં દૂધના વેચાણ માટે શરૂ કરવામાં આવેલી સહકારી મંડળીના સંઘર્ષની
વાત રજૂ થઈ છે. આ ફિલ્મ જો નિરાશાજનક હોય તો તેના નિર્માતાનો ઉદ્દેશ નિષ્ઠળ
રહે. હિક્કતે લેખકે જ્યાં અંતનો નિર્દેશ કર્યો છે ત્યાર પછીનાં દશ્યો એઓ ભૂલો ગયા
છે. લેખકે ફિલ્મ વિશે સ્મૃતિને આધારે લખ્યું હોય તેમ વાગે છે એટલે અનેક ભૂલો

થઈ છે. કોઈ પણ ફિલ્મ વિશે જ્યારે લખવાનું હોય ત્યારે તેમાંનાં પાત્રોની વાત તેમના નામના નિર્દેશ સાથે કરવાની હોય છે. નહિ કે અભિનેતાના નામથી. અહીં મોટાભાગનાં પાત્રોમાં લેખકે તે પાત્રના નામને બદલે અભિનેતા કે અભિનેત્રીનું નામ લખ્યું છે. વળી પાત્રોમાં પણ એમજો ગોટા કર્યા છે. ગિરીશ કર્નાઈ એક વેટરનરી ડૉક્ટર છે. નસીરુદ્દીનને એમજો કોન્ટ્રાક્ટ ગણાવ્યો છે તે મિશ્રાજીનું પાત્ર હકીકતે ફિલ્મમાં અમરીશ પુરીએ ભજવ્યું છે. અને નસીરુદ્દીન શાહે ભોલાનું પાત્ર ભજવ્યું છે જે એક જ આશાનું કિરણ ફિલ્મમાં અંતે જોવા મળે છે. આવરણ ઉપર (અને પૃષ્ઠ ૨૦ ઉપર પણ) ફિલ્મ 'મંથન'નો જે ઝોટે મૂક્યો છે તે પણ શયામ બેનેગલદિગ્દર્શિત ફિલ્મ 'મંથન'નો નહીં, પણ કોઈ મરાઠી ફિલ્મ 'મંથન'નો જોવા મળે છે. ફિલ્મના અંતના સંદર્ભમાં તેઓ ઘણી જગ્યાએ દશ્યો ભૂલી ગયા છે. ફિલ્મ 'ઝનૂન' વિશેની નોંધમાં પણ આવું જ અનુભવાય છે. ભાષાકીય નોંધ જે સભાનતાથી તેઓ કરે છે તે છતાં નસીરુદ્દીનનું 'સોસાયરી'નું 'સીસોરી' બોલવું સમજવામાં નિષ્ફળ ગયા છે. ફિલ્મ 'શતરંજ' કે જિલાડી'ના સંદર્ભમાં પણ એમજો વાજુદહી શાહને શતરંજની રમતમાં દૂબી ગયેલો કહ્યો છે પણ તે શતરંજની રમતમાં નહીં પણ સંગીત-નૃત્યમાં દૂબી ગયેલો જોવા મળે છે.

ફિલ્મ એ દશ્ય માધ્યમ છે. વળી તેને શિયેટરમાં જઈને જોવું પડે છે. આમ મોટેભાગે સમીક્ષકો ફિલ્મ જોઈ આવીને પછી અવલોકન લખતા હોય છે. એટલે એવી શક્યતા રહે કે કોઈ દશ્ય આગળપાછળ થઈ જાય કે યાદ કરવાનું ભૂલી જવાય. આવું અક્સર વર્ષો પહેલાં જોવા મળતું હતું. પણ હવે ટેલેવિઝન અને સી.ડી.ના જમાનામાં તો ફિલ્મ જોતાં જોતાં પણ નોંધ થઈ શકે છે. તે ઉપરાંત એવું સાંભળ્યું છે કે યાસીનભાઈની પુસ્તકોની અને સી.ડી.ની અંગત લાઈબ્રેરી પણ ખૂબ સમૃદ્ધ છે. તે છતાં તેઓ આવી ભૂલો કેમ કરી ગયા તે સમજાતું નથી. એમજો કોઈક ફિલ્મને વિશે બહુ સંવિસ્તર લખ્યું છે તો કોઈ વિષે ફક્ત બે-ત્રણ વાક્યોમાં નોંધ કરી છે તો કોઈ ફિલ્મનો ઉત્તેખ સુધ્યાં નથી વાંચવા મળતો.

ફિલ્મ 'સૂરજ કા સાતવા ઘોડા'ના સંદર્ભમાં તેઓ લખે છે કે 'આફિલ્મનું' માળખું મહાભારત ઉપર આધારિત છે.' પણ ફિલ્મનું માળખું મહાભારત ઉપર નહીં, ઓરઝન વેલ્સની ફિલ્મ 'સિટિઝન કેન'માં જે જાતની શૈલીથી રજૂઆત થઈ છે તેવી રીતનું છે. બેનેગલે એની કેટલીક ફિલ્મોમાં આ રીતે રજૂઆત કરી છે એ જોઈ શકાય છે. તેવી જ રીતે ફિલ્મમાંના દિગ્દર્શનના કૌશલ્યને વ્યક્ત કરવાનું લેખક ચૂકી ગયા છે. કેટલીક બાબતો અવારનવાર પુનરાવર્તિત થાય છે. બેનેગલની મોટાભાગની ફિલ્મોને સમજવામાં લેખક નિષ્ફળ ગયા છે.

પણિયપુસ્તકા એ આમ તો એક પ્રકારનો મોનોગ્રાફ જ છે. અને મોનોગ્રાફ એ કોઈ પણ એક વિષય કે વ્યક્તિના અંગે સર્વાંગ માહિતી આપતો હોય. પણ અહીં

લેખક શયામ બેનેગલને પરિચયાત્મક કે વિવેચનાત્મક રીતે ન્યાય આપવામાં નિષ્ણળ ગયા છે. અહીં એક લેખક તરીકે શયામ બેનેગલ, એક હિન્મ સિદ્ધાંતકાર તરીકે બેનેગલ કે તેમની મહત્વની ડોક્યુમેન્ટ્રી અંગે કશી જ માહિતી મળતી નથી.

પુસ્તકામાં યાસીનભાઈએ વર્ષો પૂર્વે લીધીલો શયામ બેનેગલનો ઈન્ટરવ્યૂ સમાવિષ્ટ કર્યો છે. અહીં પણ આ મુલાકાત અપ્રસ્તુત છે કારણ કે જ્યારે વર્ષો બાદ કોઈ મુલાકાતને ફરી પ્રગટ કરવાની હોય ત્યારે તેને અપેટ્રેસ કરવાની એક પરંપરા છે. જેનું પણ અહીં પાલન નથી થયું. તે ઉપરાંત બે વ્યક્તિ કે બે કૃતિની વચ્ચેની તુલના કરતાં તેમાંના સમયને તેઓ ધ્યાનમાં રાખવાનું ભૂલી ગયા છે.

એકદરે યાસીન દલાલકૃત પરિચયપુસ્તકા ‘શયામ બેનેગલ’ શયામ બેનેગલનો સર્વાંગ પરિચય આપવામાં નિષ્ણળ રહી છે. દુઃખ એ વાતનું છે કે આ જાતની પુસ્તકાને હવે પછી જે વાચકો આધાર રાખીને કંઈ વિચારવા કે લખવા પ્રેરાશે તેમનું શું થશે ?

સાભાર સ્વીકાર

પ્રક્રીષ્ણ

(૨૪૦) આજની વાત આજેજ : વેમૂરિ બલરામ, ૨૦૧૨, આર. આર. શેઠ એન્ડ કંપની પ્રા. લિ., મુંબઈ-અમદાવાદ, પૃ. ૧૦૪, રૂ. ૮૦/- (૨૪૧) પુસ્તકની પાંખે : નરોત્તમ પલાશ, ૨૦૧૩, પ્રવીષ પ્રકાશન પ્રા. લિ., રાજકોટ, પૃ. ૧૧૨, રૂ. ૧૦૦/- (૨૪૨) મા ભૌમ પાણી ફરીએ : અનુ. કિશોર ગૌડ, ૨૦૧૨, ગંગાબા પરિવાર પ્રકાશન, અમદાવાદ, પૃ. ૧૦+૧૦૦, રૂ. ૧૨૫/- (૨૪૩) નવું જીવન નવી દસ્તિ : ફાધર વર્ગીસ પોલ, ૨૦૧૨, રનાદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૧૬+૧૨૭, રૂ. ૧૫૦/- (૨૪૪) પરાજય નહિ વિજય : અનુ. કિશોર ગૌડ, ૨૦૧૨, ગંગાબા પરિવાર પ્રકાશન, અમદાવાદ, પૃ. ૧૦+૧૮૨, રૂ. ૧૫૦/- (૨૪૫) નજન સત્ય : અનુ. કિશોર ગૌડ, ૨૦૧૨, ગંગાબા પરિવાર પ્રકાશન, અમદાવાદ, પૃ. ૧૨+૩૦૬, રૂ. ૨૫૦/- (૨૪૬) વિવેક માધુરી : યાસીન દલાલ, ૨૦૧૨, રનાદે પ્રકાશન, અમદાવાદ, પૃ. ૮૪૨૮૦, રૂ. ૨૫૦/- (૨૪૭) નરેન્દ્ર મોદીનો વિચાર વૈભવ : સંપા. હિનેશ દેસાઈ, ૨૦૧૩, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, પૃ. ૪૪૭૬, રૂ. ૧૦૦/- (૨૪૮) શયામ બેનેગલ (પરિચય પુસ્તકા-૧૨૮૮) : યાસીન દલાલ, ૨૦૧૩, પરિચય ટ્રસ્ટ, મુંબઈ, પૃ. ૫૮, રૂ. ૧૫/-



આપણી વાત

સંકલન : પ્રફુલ્લ રાવલ

આપણી વાત

મે મહિનાની સખત ગરમીમાં પણ સાહિત્યની પ્રવૃત્તિ એવી ને એવી જ રહે છે. આ કાળજાળ ગરમીમાં પણ વ્યવસાયી સંસ્થા ઓમ કોમ્યુનિકેશન વિશ્વ પુસ્તક દિન નિમિત્તે કાર્યક્રમ કરીને નોબેલ પારિતોષિકિવિજેતા માર્ક્ઝેઝને અંજલી આપી છે. ઈશ્વર પેટલીકરના જન્મદિન નિમિત્તે સાહિત્ય અકાદમી, ગાંધીનગરની સહાયથી એક પરિસંવાદનું આયોજન કર્યું હતું. પરિષદ અંતર્ગત ચાલતી એની સરૈયા પ્રોત્સાહન લેખનનિધિ ઉપક્રમે આવી બળબળતી બપોરે ઉચ્ચ બહેનોએ વિવિધ જીવમાં વાતાવરણ કર્યું અને તેના વિશે ચર્ચા કરી. પરિષદની ભાષાસાહિત્યના વિકાસની પ્રવૃત્તિમાં આ પ્રવૃત્તિ ભવિષ્યમાં એક અલગ પ્રકારની લેખિકાથી સમૃદ્ધ થશે. આના અનુસંધાને રાજસોભાગ આશ્રમ, સાયલાના નિમંત્રણથી લેખિકાઓ માટે વાતાવરણનું પણ આયોજન ગોઈવાયું છે. પરિષદ દ્વારા ગુજરાત નાટ્ય-સંગીત અકાદમીના ઉપક્રમે અભિનયસમાટ ‘પોરહાવાળાની વાર્તા’, ઝવેરચેંડ મેઘાશી કૃત ‘રતન નિયું રોળ’નું દશ્ય-શાય્ય દ્વારા એકપાત્રીય મંચન કર્યું ત્યારે રા. વિ. પાઠક હોલ ખીચોખીય ભરાયેલો હતો. મેઘાશીની આ કથાનું ઉપેન્દ્ર નિવેદીએ અભિનય સાથે કથન કરી શ્રોતાઓને ખુશખુશાલ કરી દીધા હતા. જીવનના સાડાસાત દાયક વિતાવી ચૂકેલા આ કલાકારે એવી સરસ રીતે આ સાહિત્યિક કૃતિનું મંચન કર્યું કે સહૃદ્દે પરિતોષ થયો. મેઘાશીની મૂળ કથા કરતાં ઉપેન્દ્ર નિવેદીનો અંત જુદો હતો અને એ ઉપેન્દ્ર નિવેદીની સર્જકતાને પણ નિર્દેશ છે. પરિષદ આ કાર્યક્રમથી પ્રજા સુધી પહોંચી છે.

ગુજરાતી ભાષાના સમર્થ કવિ રમેશ પારેખ એમની કવિતાથી સમગ્ર ગુજરાતમાં સુપ્રસિદ્ધ છે. એમની કવિતામાં આવતાં પાત્રો ગુજરાતના કાબ્યરસિકોને સતત આકર્ષણી રહી છે. ત૧૧મી મેના રોજ વાર્તાકાર વિવેચક ગુશવંત વ્યાસે ‘રમેશકથા’ની અભિવ્યક્તિ કરી ત્યારે એક સર્જકની ભાષા પરની પકડ અને લોકો સુધી પહોંચવાની શક્તિનાં દર્શાન થયાં. ગુશવંત વ્યાસની આ સાતમી રમેશકથા છે અને આ પરંપરા હજુ પણ તેઓ ચાતુર રાખવાના છે ત્યારે પરિષદ વતી એમની આ અભિવ્યક્તિને બિરદાવતાં આનંદ થાય છે.

- પ્રફુલ્લ રાવલ

પાક્ષિકી અંતર્ગત

તા. ૧-૫-૨૦૧૪ના રોજ હરીશ ખત્રીએ રમેશ દવેની ‘આસમાની’ વાર્તાનો

આસ્વાદ કરાયો હતો જે રસપ્રદ હતો. વાર્તાની ખૂલ્લીઓ વિશે સરસ રજૂઆત થઈ હતી. વાર્તાકાર પૂજા તત્ત્વસ્તે ‘અવાજો’ વાર્તાનું પઠન કર્યું હતું જેમાં વિવિધ અવાજો સાથે બંને બહેનોની મનઃસ્થિતિનું કલાત્મક રીતે આવેખન થયું હતું. વાર્તા ભાવકોને સારી રીતે સ્પર્શી ગઈ હતી.

ગુજરાતી સાહિત્ય પરિષદ શાનપીઠ અંતર્ગત

ગુજરાતી સાહિત્ય પરિષદ શાનપીઠ અંતર્ગત તા. ૧૭-૫-૨૦૧૪ના રોજ સાંજે ૭-૦૦ કલાકે રા. વિ. પાઠક સભાગૃહમાં ગુજરાત રાજ્ય યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સંગીત-નાટક અકાદમીના સહકારથી અભિનયસમાટ ઉપેન્દ્ર નિવેદી અભિનિત અને રાષ્ટ્રીય શાયર શ્રી જવેરચંદ મેઘાણી લિખિત ચારણંપતીના પ્રેમ-વિજોગની અમરકથા ‘રતન નિયું રોળ’ અને સૌરાષ્ટ્રની રસધાર અંતર્ગત ‘પોરહાવાળા’ની પ્રસિદ્ધ લોકવાર્તાના દશ્ય-શાય માધ્યમ દ્વારા કથાકથનની પરંપરાગત શૈલીમાં એકપાત્રીય મંચન કાર્યક્રમ યોજાયો હતો.

અભિનંદન

શ્રી ક. લા. સ્વાધ્યાયમંહિરના પૂર્વ નિયામક હેઠળ ડૉ. રમેશ ર. દવેના માર્ગદર્શન. શ્રી ચારુ અધ્વર્યુએ ‘ગુજરાતી આત્મકથામાં શૈશવ, ડેશોર્ય અને યુવાનીનું નિરૂપણ : એક અભ્યાસ’ વિષય પર મહાનિબંધ તૈયાર કરીને પીએચ.ડી.ની પદવી મેળવી છે. તેમને અભિનંદન.

રવીન્દ્રભવન અંતર્ગત

રવીન્દ્રભવન, ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે તા. ૭-૫-૨૦૧૪ના રોજ રવીન્દ્રનાથ યાગોરની ૧૫૦મી જન્મજંતિ નિમિત્તે શ્રી સુજ્ઞા શાહ પ્રસ્તુત ‘રવીન્દ્રસંગીત’નો કાર્યક્રમ ગોવર્ધન સ્મૃતિમંહિરમાં યોજાયો હતો. જેમાં ગાયકવૃંદ: સુચેતા રોય, રૂજી ચેટરજી, શેફાલી નયન અને ઇસ્થિતા ચેટરજીએ રવીન્દ્રનાથ યાગોરનાં ગીતોનું ગાન કરીને ઉપસ્થિત ભાવકોને રવીન્દ્રમય બનાવ્યા હતા.

પરિષદના આગામી કાર્યક્રમો

પાકિસ્તાન અંતર્ગત

તા. ૫-૬-૨૦૧૪ના રોજ દીનાબહેન પંડ્યા વાર્તાપઠન કરશે. અને દીવાનભાઈ ગિરોશ ભંની વાર્તા ‘સુગંધ’નો આસ્વાદ કરાવશે. સાંજે ૬-૦૦ કલાકે.

વિશ્વકવિતા કેન્દ્ર અંતર્ગત

તા. ૪,૧૧,૧૮-૬-૨૦૧૪ના રોજ સાંજે ૭-૦૦ કલાકે બુધસભા અને તા. ૨૫-૬-૨૦૧૪ના રોજ વ્યાખ્યાન.

ગુજરાત યુનિવર્સિટી માન્ય પત્રકારત્વ અને અનુવાદના અભ્યાસક્રમ

ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક. લા. સ્વાધ્યાયમંદિર દ્વારા ગુજરાત યુનિવર્સિટી માન્ય છ-માસિક પત્રકારત્વ અને અનુવાદના પ્રમાણપત્ર અભ્યાસક્રમના વર્ગોનું સત્ર ૧૫ જુલાઈ, ૨૦૧૪થી શરૂ થશે. અભ્યાસક્રમમાં જોડાવા ઈચ્છિતા વિદ્યાર્થોઓએ તાત્કાલિક સંપર્ક કરવો. વહેલા તે પહેલાના ધોરણો પ્રવેશ આપાશે. વર્ગો સોમવાર અને મંગળવારે સાંજના ૫-૦૦થી ૭-૦૦ના સમય દરમિયાન લેવાશે.

સંપર્કસૂત્ર : કાર્યાલય : (૦૭૯) ૨૬૫૮૭૮૪૭

શ્રી ચંદ્રકાન્ત ભાવસાર મો. ૮૫૨૭૬૭૧૦૭૩

સ્થળ : ગુજરાતી સાહિત્ય પરિષદ, યાઈમ્સની પાછળ, નદીકિનારે, આશ્રમરોડ,
અમદાવાદ-૩૮૦૦૦૮

સાહિત્યસભા ગાંધીનગરના ઉપક્રમે

ગાંધીનગર સાહિત્યસભા ગાંધીનગરના ઉપક્રમે તા. ૧૮-૪-૨૦૧૪ના રોજ જ્ઞાંજે સર્વશ્રી હરિકૃષ્ણ પાઠક, દોલત ભણ, ભાનુપ્રસાદ પુરાણી, ડૉ. કનૈયાલાલ ભણ, ડૉ. કેશુભાઈ ડેસાઈ, કલ્પેશ પટેલ, ૨૯નીકુમાર પંડ્યા, રાધવજી માધડ, રમણ વાઘેલા, પ્રવીજા ગઢવી, વસ્તં ગઢવી અને ભરત કવિની ઉપસ્થિતિમાં ડૉ. એસ. એસ. રાહીનો ગજલપઠનનો કાર્યક્રમ યોજાયો હતો.

પ્રશિષ્ટ કૃતિઓના વાચનનો આનંદ' વિશે શ્રી સંજ્ય ભાવેનું વ્યક્તત્વ

શ્રી બદ્દંકર વિદ્યાદીપક શાનવિજ્ઞાન વ્યાખ્યાન-શ્રેણી અંતર્ગત શ્રી સંજ્ય ભાવેએ વિશ્વકોશના શિલ્પી ડૉ. ધીરુભાઈ ડાકરને અંજલિ આપતાં તેમના વાચનપ્રેમની વાત કરી હતી. એલ્ફિન્સ્ટન કોલેજમાં ધીરુભાઈ ભણતા હતા ત્યારે એક નિબંધસ્પર્ધામાં તેમને બસો રૂપિયા ઈનામ મળ્યું હતું. તેમાંથી સો રૂપિયાના એમણે પુસ્તકો ખરીદાં હતાં. ધીરુભાઈનાં સૂચિકાર્ય તેમજ ઈતિહાસલેખન પણ તેમના પ્રચંડ પુસ્તકપ્રેમનાં સાક્ષી છે. આ ઉપરાંત તેમણે 'પંચાત્મક', 'સુદામાચરિત', 'દીપનિર્વાણ', 'ગરીબ પણ ધીએ કેટલાં બધાં', 'વંચિતોના વાણોતર', 'એનિમલ ફાર્મ', 'શ્યામચી આઈ', 'વ્યક્તિ આણિ વલ્લી', 'ધરતીની આરતી' જેવી કૃતિઓનો પ્રશિષ્ટ કૃતિ તરીકે વ્યાખ્યાનમાં આસ્વાદ કરાયો હતો.

ઈશ્વર પેટલીકરના જન્મદિન નિમિત્તે પરિસંવાદ

ઓમ કોમ્પ્યુનિકેશન અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે આયોજિત ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ 'ઈશ્વર પેટલીકર'ના જન્મદિન નિમિત્તે પરિસંવાદ તા. ૬-૫-૨૦૧૪ના રોજ બપોરે ૧ થી ૪ કલાક દરમિયાન યોજાયો હતો. આ સેમિનાર ત્રણ બેઠકમાં વહેલાયેલો હતો. પ્રથમ બેઠક શ્રી ચંદ્રકાન્ત શેઠની અધ્યક્ષતામાં યોજાઈ હતી

જેમાં ચંદકાન્ત શેડે ‘મારી નજરે : ઈશ્વર પેટલીકર’ વિષય પર અધ્યક્ષીય વક્તવ્ય આપ્યું હતું. મણિલાલ ડ. પટેલે બીજુરૂપ વક્તવ્ય આપ્યું હતું. આ બેઠકનું સંચાલન જિશેરા બ્રહ્મભાઈ કર્યું હતું. બીજી બેઠક રઘુવીર ચૌધરીની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં રમેશ ર. દવેએ નવલકથા ‘જનમટીપ’ વિશે વક્તવ્ય આપ્યું હતું. શ્રી દાસ્ટિ પટેલે ‘લોહિની સગાઈ’ વાર્તા વિશે રસપ્રદ વક્તવ્ય આપ્યું હતું. શ્રી અજ્યાસીંહ ચૌહાણે ચરિત્રકાર પેટલીકર વિશે વક્તવ્ય આપ્યું હતું. આ બેઠકનું સંચાલન હરદ્વાર ગોસ્વામીએ કર્યું હતું. ત્રીજી બેઠક વિષ્ણુભાઈ પંડ્યાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. વિષ્ણુ પંડ્યાએ ‘પત્રકાર ઈશ્વર પેટલીકર’ વિશે વક્તવ્ય આપ્યું હતું. શ્રી રાજેન્દ્ર પટેલે આ સેમિનારના સમાપન-વક્તવ્યમાં પોતાનો રાજ્યાંત્રી બ્યક્ત કર્યો. આ બેઠકનું સંચાલન દીવાન ઠાકોરે કર્યું હતું અને મનીષ પાઠકે સૌનો આભાર બ્યક્ત કર્યો હતો.

સાહિત્યસંગમના ઉપકમે

સાહિત્યસંગમના ઉપકમે લેખક, પ્રકાશક, ચિંતક અને નગરબાપા શ્રી નાનુભાઈ નાયકના ૮૮માં જન્મદિન નિમિતે પાંચદિવસીય જીવનોત્સવ યોજાયો જેમાં વ્યક્તિસ્વાતંત્ર્ય, મારો જીવનઅવિકાર, જીવન ચલને કા નામ, હસતાં હસતાં જીવો - હાસ્યોત્સવ, જીવનસંબર્ધમાં પણ આનંદ, સંગીત દ્વારા જીવનઆનંદ, રાગ પીલુની સરગમ જેવા વિષય પર તા. ૮-૫-૨૦૧૪થી તા. ૧૩-૫-૨૦૧૪ સુધીના પાંચ દિવસનું જીવનોત્સવનું આયોજન થયું હતું. તા. ૮-૫-૨૦૧૪ના રોજ અમેરિકન સિવિલ વોર માટે નિમિત્ત બનેલી ને એક ગુલામની ડાયરી પર બનેલી કલાત્મક, ઓસ્કાર વિજેતા ફિલ્મ ‘૧ રચસ અ સ્લેસ’ની દશ્ય-શ્રાવ્ય રજૂઆત નરેશ કાપડિયાએ કરી હતી. તા. ૧૦મી મે ના રોજ ‘નાનુ’માંથી ‘નાનિયો’, પછી, ‘નાનુભાઈ’, પછી ‘મામા’, પછી ‘બાપા’ ને આજે ‘નગરબાપા’ સુધી પહોંચનાર શ્રી નાનુભાઈ નાયકની જોસ્સેદાર જીવન-સંબર્ધ-આનંદકથાની એમના જન્મદિવસે દશ્ય-શ્રાવ્ય સ્વરૂપે રજૂઆત થઈ હતી. તા. ૧૧મી મેના રોજ સર્વશ્રી યજીવી કરંજિયા, નયન દેસાઈ, રવીન્દ્ર પારેખ, દિલીપ મોદી, નરેન્દ્ર જોશી, બકુલેશ દેસાઈ, જ્યકુમાર દમણિયા, રમણભાઈ જરીવાળા વગેરેએ હાસ્યનિબંધ, કવિતા, જોક્સ-ટુચ્કાની રજૂઆત કરી હતી, અને પ્રબોધ જોશીલિભિત અને નરેશ કાપડિયા દિંગદીર્શિત નાટક ‘તીન બંદર’ાં અરૂક્ષા મજમુદાર, તરુણ-રશ્મિ પરીખ, અતુલ મજમુદાર ને સુરેન્દ્ર દલાલ જેવા સિનિયર સિટીઝન્સે નાટકમાં અભિનય કર્યો હતો. તેમજ ‘લાગણીના ઘરમાં આપણે’ નાટકની ભજવણી, જનક નાયક, દિલીપ ઘાસવાળા અને ચિંતન નાયકે કરી હતી. તા. ૧૨મી મેએ ઓસ્કાર વિજેતા ફિલ્મ ‘સ્યુગો’ પર દશ્ય-શ્રાવ્ય કાર્યક્રમ જનક નાયકે કર્યો હતો. તા. ૧૩મી મેએ ડૉ. સુનિલ મોદીએ પીલુ રાગનાં જુદાં જુદાં પાસાંની વાત કરી હતી અને બંદીશો રજૂ કરી હતી. તો સર્વશ્રી રત્નાભાઈન જાદવાણી, પાયલ ભણ અને શીખા સોમૈયાએ ગીત અને ગજલની પ્રસ્તુતિ કરી હતી.

આ ઉપરાંત આ રાગ પર આધારિત ફિલ્મોની ગીતોની ટેક પર રજૂઆત કરી હતી. ભાવનગર ગદ્યસભા આયોજિત ગદ્યકાવ્ય સ્પર્ધા

ભાવનગર ગદ્યસભા તરફથી આગામી જ્યાંત પાઠક સ્મૃતિદિન નિમિત્તે ગુજરાતી ભાષાના તમામ સર્જકો માટે ગદ્યકાવ્ય સ્પર્ધાની ઘોષણા કરવામાં આવે છે. ભાવનગર ગદ્યસભા આયોજિત આ ગદ્યકાવ્ય સ્પર્ધામાં ભાગ લેવા માંગતા સર્જકોએ સ્વરચિત, અપ્રગટ અને સંપૂર્ણ મૌલિક ગુજરાતી ગદ્યકાવ્ય તા. ૧૫-૬-૨૦૧૪ સુધીમાં અજ્ય ઓઝા (ભાવનગર ગદ્યસભા), પ્લોટ નં. ૫૮, મીરાપાર્ક, ‘આસ્થા’, અંજિલેશ સર્કલ, ઘોઘા રોડ, ભાવનગર-૩૬૪૦૦૧ – આ સરનામે મોકલવા વિનંતિ. શ્રેષ્ઠ ત્રણ ગદ્યકાવ્યોને પુરસ્કૃત કરવામાં આવશે. સ્પર્ધાના પરિણામ સુધી ફૂતિ અપ્રગટ રાખવી. ભાવનગર ગદ્યસભાએ નીમેલ નિર્ણયકોનો નિર્ણય સૌને બંધનકર્તા રહેશે. આ સ્પર્ધાના પરિણામ વિશે તેમજ ગદ્યસભાને લગતી અન્ય સાહિત્યક વિગતો ભાવનગર ગદ્યસભાના બ્લોગ www.gadyasabha.wordpress.com પર જોઈ શકાશે.

ગુજરાત સાહિત્ય સભાના ઉપકમે યોજાયેલી દર્શક જન્મશતાબ્દી નિબંધ-સ્પર્ધા

ગુજરાત સાહિત્ય સભાએ શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ની જન્મશતાબ્દીની ઉજવણીના સંદર્ભે ગુજરાતબ્યાપી મહોત્સવ નિમિત્ત નિબંધ-સ્પર્ધાનું આયોજન કર્યું હતું. દીતિહાસકાર દર્શક, લોકશાહી વિચારક દર્શક, કેળવણીકાર દર્શક અને નવલકથાકાર દર્શક – આ વિષયો પર નિબંધો મંગાવવામાં આવ્યા હતા જેમાં દર્શકના જીવન અને કવનના જુદા જુદા વિષયોને અનુલક્ષીને સ્પર્ધા રાખવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ આમાં સારી એવી સંખ્યામાં ભાગ લીધો હતો. આમાં પ્રથમ પારિતોષિક કાવિનીબહેન પરીખને, દ્વિતીય પારિતોષિક પન્નાબહેન એચ. દેસાઈને અને તૃતીય પારિતોષિક દિનેશભાઈ જોશીપુરાને પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત બીજાં પાંચ પ્રોત્સાહક પારિતોષકો આપ્યાં છે.

રવીન્દ્ર પારેખને ધનજી કાનજી ચંદ્રક

ગુજરાત સાહિત્ય સભા ૧૯૮૮થી સાહિત્ય તેમજ અન્ય વિદ્યાઓમાં નોંધપાત્ર કામ કરતા સર્જક, વિવેચક, સંશોધકને ધનજી કાનજી ગાંધી ચંદ્રક પ્રદાન કરે છે. એ સંદર્ભે ૨૦૧૨નો ધનજી કાનજી ગાંધી ચંદ્રક રવીન્દ્ર પારેખને અર્પણ કરવાનું સભાની ૬-૫-૨૦૧૪ની બેઠકમાં ઠરાવવામાં આવ્યું છે. આગામી હિવસોમાં ચંદ્રક અર્પણવિધિનો કાર્યક્રમ યોજાશે તેની નોંધ લેવા વિનંતિ.

થોડા વખત પર જ સૂરતની નર્મદ સાહિત્યસભાએ રવીન્દ્ર પારેખને નવલકથા ‘મનપ્રવેશ’ માટે નંદશંકર ચંદ્રક અર્પણ કર્યો હતો. તે પછીનો આ બીજો નોંધપાત્ર ચંદ્રક શ્રી પારેખને મળ્યો છે.

‘પરબ’ સામયિકના નવા આજીવન સભ્યો

| ક્રમ | નામ | ગામ | ક્રમ | નામતા પટેલ | અમદાવાદ |
|------|---------------------|-----------|------|------------------------|----------|
| ૧ | પ્રા. દશરથ એસ. પટેલ | તોટણીયા | ૩૨ | સિમતા પી. શાહ | અમદાવાદ |
| ૨ | નરેશ મગરા | પૂના | ૩૩ | રાજેન્ડ્ર પંડ્યા | અમદાવાદ |
| ૩ | દિનેશ ચૌહાણ | માલાવાડા | ૩૪ | મહેશ ડી. ગામીત | કપરાડા |
| ૪ | નૂતન એમ. ચૌધરી | અમદાવાદ | ૩૫ | ભરત જે. શાહ | અમદાવાદ |
| ૫ | કૌશલ ઉપાધ્યાય | અમદાવાદ | ૩૬ | ઉમેશ જોશી | અમદાવાદ |
| ૬ | મનસુખ એ. માટુ | ગાંધીનગર | ૩૭ | કૃષ્ણકુમાર શર્મા | અમદાવાદ |
| ૭ | નરેશ આર. વાણોલા | અંકલેશ્વર | ૩૮ | જ્યાન પાઠક | અમદાવાદ |
| ૮ | સરલ ટી. શાહ | થાણા | ૩૯ | દેવજીભાઈ જી. સોલંકી | ધામા |
| ૯ | મહિનાભાઈ પ્રજાપતિ | ગાંધીનગર | ૪૦ | નીમા કે. પટેલ | ચંદનપુરા |
| ૧૦ | નિર્ભણ ડી. ટેસાઈ | થાણા | ૪૧ | ભાગવી પંડ્યા | અમદાવાદ |
| ૧૧ | વિકમ જી. ચૌધરી | બારડોલી | ૪૨ | હીના પંડ્યા | સુરત |
| ૧૨ | ડૉ. સુષ્મા ઐયર | સુરત | ૪૩ | તુખાર ત્રિવેદી | અમદાવાદ |
| ૧૩ | અર્યાના રાજુલ કેસાઈ | સુરત | ૪૪ | નીતિન એ. સરૈયા | અમદાવાદ |
| ૧૪ | રમેશ બી. ચૌધરી | બોરીઆવી | ૪૫ | મયંક આર. | અમદાવાદ |
| ૧૫ | દિલીપ દવે | અમદાવાદ | ૪૬ | જિજોશ બી. શાહ | અમદાવાદ |
| ૧૬ | નરેન્દ્ર એમ. શાહ | સુરત | ૪૭ | વીરા ગૌરાંગ એસ. | વડોદરા |
| ૧૭ | વિહતસિંહ ડી. મહીડા | અમદાવાદ | ૪૮ | ડૉ. કનૈયાલાલ એમ. બારોટ | |
| ૧૮ | જયંત ડાંગોદા | અમદાવાદ | | | મહેસાણા |
| ૧૯ | જયંત એન. સોની | મુંબઈ | ૪૯ | ડૉ. મોહનલાલ પટેલ | આશંકા |
| ૨૦ | દિલીપ સી. દવે | અમદાવાદ | ૫૦ | હેમા જે. પરીખ | વડોદરા |
| ૨૧ | રાધિકા સી. પટેલ | અમદાવાદ | ૫૧ | કિશોર મકવાણા | અમદાવાદ |
| ૨૨ | મનીષ એચ. રાજ્યગુરુ | ગઢા | ૫૨ | નિમિષા દલાલ | સુરત |
| ૨૩ | ઉપેન્દ્ર એમ. પટેલ | અમદાવાદ | ૫૩ | કલેશ પટેલ | ગાંધીનગર |
| ૨૪ | પરાગ પ્રજાપતિ | અમદાવાદ | ૫૪ | જિતેન્દ્ર ડી. મહેતા | અમદાવાદ |
| ૨૫ | ડૉ. અલ્કેશ વી. દવે | અમદાવાદ | ૫૫ | રેખા આર. શાહ | અમદાવાદ |
| ૨૬ | મોહિની શર્મા | અમદાવાદ | ૫૬ | ચિરાગ ઠક્કર | અમદાવાદ |
| ૨૭ | પરીક્ષિત જોશી | અમદાવાદ | ૫૭ | દિનેશ જે. પંડ્યા | મુંબઈ |
| ૨૮ | રાહુલ જોશી | અમદાવાદ | ૫૮ | હસમુખ ચાગડિયા | અમદાવાદ |
| ૨૯ | ડૉ. મીના ટી. પારેખ | વલસાડ | ૫૯ | જિજોશ બ્રહ્મભક્ત | અમદાવાદ |
| ૩૦ | ડૉ. કિશોરી ચંદારાણા | અમદાવાદ | ૬૦ | ડૉ. કુંતલ ગજીજર | અમદાવાદ |

| | | | | | |
|----|-------------------------|-----------|-----|------------------------|----------|
| ૬૧ | ડૉ. ચેતન બી. લાખાણી | અમદાવાદ | ૭૪ | અશોક સુતરિયા | વડોદરા |
| ૬૨ | રમેશ પાંચોટીયા | મહેસૂસાણા | ૭૫ | દિલીપકુમાર ધોરિયા | વડોદરા |
| ૬૩ | ઘનશ્યામ ગઢવી | અમદાવાદ | ૭૬ | ઉમેશ એમ. ભહુ | સુરત |
| ૬૪ | મિહિરકુમાર વી. શાહ | અમદાવાદ | ૭૭ | રમણલાલ ટી. જરીવાલા | સુરત |
| ૬૫ | ઉપાબી જાડેજા | રાજકોટ | ૭૮ | પ્રભા એચ. પરમાર | સુરત |
| ૬૬ | Pranab Mukharjee | કોલકતા | ૭૯ | પરાકમસિંહ જાલા | અમદાવાદ |
| ૬૭ | ઇયા ત્રિવેદી | અમદાવાદ | ૧૦૦ | અનિલ વશિષ્ઠ | અમદાવાદ |
| ૬૮ | જતીન જે. ઓઝા | અમદાવાદ | ૧૦૧ | ભૂપેન્દ્ર જેસલપુરા | અમદાવાદ |
| ૬૯ | અનિલ સી. શાહ | અમદાવાદ | ૧૦૨ | હેમા હિરેન જોશી | સુરત |
| ૭૦ | સાગર પી. શાહ | અમદાવાદ | ૧૦૩ | ડૉ. સતીશ ટી. ચૌહાણ | બારડોલી |
| ૭૧ | નિશા પંચાલ | અમદાવાદ | ૧૦૪ | અજ્ય મહારાજા | અમદાવાદ |
| ૭૨ | દિવાકર શાહ | ઠન્ડોર | ૧૦૫ | ગીતા ટેવદત શુક્લ | સુરત |
| ૭૩ | જાગૃતિ રાજ્યગુરુ | રાજુલા | ૧૦૬ | ઉપિન. પચ્છીગર | સુરત |
| ૭૪ | વસ્તંત કે. દાવડા | અમદાવાદ | ૧૦૭ | ગોવિંદ ભક્તા | યુ.એસ.એ. |
| ૭૫ | ડૉ. હરિઓમ રાવલ | ભાન્ડુ | ૧૦૮ | ડૉ. પ્રશાંત જોશીપુરા | ગાંધીનગર |
| ૭૬ | હેત વી. રાવલ | મહેસૂસાણા | ૧૦૯ | હેમેન્ડ એ. શાહ | અમદાવાદ |
| ૭૭ | વીરેન્દ્ર એમ. પટેલ | અમદાવાદ | ૧૧૦ | ચંદ્રકાન્ત ઠક્કર 'મેહ' | અમદાવાદ |
| ૭૮ | રણેશ્વરાન્ત જી. ભહુ | અમદાવાદ | ૧૧૧ | રવિ પેથાણી | અમદાવાદ |
| ૭૯ | સંજ્ય વી. ભદોલીયા | જામનગર | ૧૧૨ | ડૉ. નિખિલ પટેલ | આણંદ |
| ૮૦ | જશવંત રાવલ | આણંદ | ૧૧૩ | તાહા મનસુરી | અમદાવાદ |
| ૮૧ | ધારિણી સોલંકી | અમદાવાદ | ૧૧૪ | જયમીન આર. વત્તા | અમદાવાદ |
| ૮૨ | અર્યાના શેશાંક શેશાદ્રી | અમદાવાદ | ૧૧૫ | રેખા તરુણ ચોકની | અમદાવાદ |
| ૮૩ | વસ્તંતકુમાર રાવલ | અમદાવાદ | ૧૧૬ | Poet Babar Bambus | યુ.કે. |
| ૮૪ | શિરાગ આ | અમદાવાદ | ૧૧૭ | કીર્તિદા વૈદ | નવસારી |
| ૮૫ | ખોડાજી એમ. ઠાકોર | અમદાવાદ | ૧૧૮ | રંજન ટી. રાણા | બુધારી |
| ૮૬ | પિનાકિન મેઘાણી | અમદાવાદ | ૧૧૯ | ડૉ. માનસિંહ કે. ચૌધરી | આણંદ |
| ૮૭ | દિનકર શુક્લ | વડોદરા | ૧૨૦ | નીલા કે. ચંપાવત | આણંદ |
| ૮૮ | સોનાલી એચ. શેઠ | અમદાવાદ | ૧૨૧ | નૌશિર એ. તપિયા | સુરત |
| ૮૯ | કરિશમા એચ. શેઠ | અમદાવાદ | ૧૨૨ | રાજેશ ટી. રાણા | સુરત |
| ૯૦ | હેઠા કાનાણી | ગીરગઢા | ૧૨૩ | હિમાંશુ સી. સોપારીવાલા | સુરત |
| ૯૧ | અજિત આર. પટેલ | અસલાલી | ૧૨૪ | રૂપલ ટી. પરમાર | કુંગરી |
| ૯૨ | ચંદાની મોહન એચ. | અમદાવાદ | ૧૨૫ | ચેતના પી. પટેલ | કુંગરી |
| ૯૩ | પ્રિયાંશુ પટેલ | લુણાવડા | ૧૨૬ | ચિંતન આર. રાણા | સુરત |

આવરણાચિત્ર : આસ્વાદનોંધ

પીયુષ ઠક્કર

કણકૃતિનું શીર્ષક : હનુમાન ૧ અને ૨

કલાકાર : કે. જી. સુભ્રાજયન્ (જ. ૧૯૨૪, કુથપરામબા, કેરળ)

માધ્યમ : એક્રેલિકની સપાટી પર અવળું ચિત્રાંકન (reverse painting on acrylic sheet)

માપ : પ્રત્યેકનું માપ ૨૪" X ૩૬"

વર્ષ : ૨૦૧૩ - ૧૪

પરબ, મે ૨૦૧૪ના સાતાયમાં :

૨૦૧૪ના ફેબ્રુઆરી મહિનાની ૧૫મી તારીખે મણિસાહેબે આયુનાં ૮૦ વર્ષ પૂરાં કર્યાં એટલે કે આવરણ પર મૂક્ખવામાં આવેલાં ચિત્રો ૮૮-૯૦ વર્ષની ઉભરે રચાયેલાં છે. પહેલાં ચિત્રમાં આપણાં નૈસર્જિક પરિવેશમાં જોવાં મળતાં વાનરોનું આવેખન છે. એમાં વાનરમાત્રની તરા અને સ્વભાવગત રમતિયાળપણું છે તો બીજા ચિત્રમાં આપણા પૂરાકથાઓ વડે સંસ્કારીત અને પરિવર્તિત થયેલું એનું રૂપ છે. અર્થાત હનુમાન. બન્ને ચિત્રોમાં ભડક રંગો અને વિષમ રંગોનું સમન્વય યોજાયું છે. કેસરી અને ભૂરાની વિધવિધ જાંયના જાણો કે એ સકલ ચિત્રો ભાસે છે. ચિત્રોમાં પરિવેશની રચના કેટલાંક સામાન્ય કહી શકાય એવા આકારો વડે કરવામાં આવી છે. વિષમાં પ્રવેશ મળી રહે એટલી જ વિગતો વડે પદાર્થનો નિર્દેશ કરવામાં આવ્યો છે. જો કે એથી નથી તો વિષય નગર્ય બની જતો કે એ માત્ર નિમિત્તરૂપ પણ નથી રહેતો. રેખાંકનની તરલતા અને ત્વરિતતા નિરાયાસ જણાય છે. મુક્ત રેખાંકન અને ઘણ-ઘેરાં રંગ-અવકાશોની પરસ્પર ગુંથણીમાં વિષયનો ઉઘાડ થતો જોઈ શકાય છે. ઉષ્ણ અને શીતળ રંગ-અવકાશોની સહોપસ્થિતિના કારણે આપણી દસ્તિને ત્વરિત ગતિ મળે છે. મહત્વની વાતે પણ છે કે આવરણ પરના ચિત્રોનો તેમજ અન્ય ચિત્રશ્રેણીનો ઉદેશ કોઈ પણ સામાજિક કે રાજનૈતિક અર્થઘટનો તરફનો નથી (જુજ અપવાદોને બાદ કરતાં). વાસ્તવિક વાનરથી તે કાલ્યનિક હનુમાન સુધીની ફણમાં ચિત્રકરના મનોજગતની સહજ અને રમતિયાળ તાસીર અહીં ઝીલાયેલી જોવા મળે છે.



કણાવિવેચક આર. શિવકુમારને મણિસાહેબે આપેલી મુલાકાતમાંથી આ ચિત્રો નિમિત્તે બે વાત : મણિસાહેબ પ્રકૃતિએ પોતાને વાર્તાકાર (fabulist) તરીકે ઓળખાવાનું પસંદ કરે છે. તેઓ કહે છે કે, “દશ્યવાર્તાઓ કહેવા માટે હું પરિવેશમાંથી મળેલી

ઇમેજિસ રૂપાંતરિત કરવામાં માનું છું. જોઈએ તો એનાં લક્ષણો પણ બદલતો રહું છું. એને તરવરતી – ઊડતી દેખાંનું છું તો એની પાસે અભિનય પણ કરાવડાંનું છું.” મારાં ચિત્રો એટલાં પૂરતાં રમતિયાળ છે અને એક રીતે અનાયાદે રચાયેલાં પણ ખરાં. ક્યારેક મારાં ચિત્રોમાં ખૂબ જ પ્રચલિત વિષયવસ્તુ લઈને એના નવતર અર્થઘટનો તરફ જવાનો પણ પ્રયાસ કરતો હોઉં છું.”

“હું ધારું છું કે જેમ જેમ ઉભર વધતી જાય છે એમ એમ રંગોની ભૂખ વધતી અનુભવું છું દીસ્તોયેક્કીની નવલકથામાં એક પ્રસંગ છે, એક વૃદ્ધ, અશક્ત અને બિમાર પાદરીની દષ્ટિ એટલી તો સતેજ થઈ ગઈ છે કે એને જગત જાણે કે રત્ન-માણેક અને કિમતી પથ્થરનું બનેલું જણાય છે. મારી વાત કરું તો વિતતાં વર્ષોની સાથે સાથે જગત વધારે ને વધારે તત્ત્વીન કરનારું અને સતત ફીટાં મને અનુભવાય છે. પછી ભવે ને એમાં રંગો હોય કે ન હોય....” (સારાનુવાદ : લેખક)



એકાશનુમા વર્ષમાં પ્રવેશ નિમિત્તે સૌ કળારસિકો વતી મણિસાહેબને શત શત વંદન.

સંદર્ભ :

1. Siva Kumar, R. K. G. Subramanyan: A retrospective. New Delhi : National Gallery of Modern Art, ૨૦૦૩. Print.
2. <http://www.webofstories.com>
3. Subramanyan K. G. New Works, Calcutta: Seagull Foundation for the Arts, ૨૦૧૪. Print.

કળાકારનું સરનામું : ૧૧, ધનુષ્ય સોસાયટી, સમા રોડ, વડોદરા ૩૬૦ ૦૦૮. ગુજરાત.

સાભાર સ્વીકાર

પ્રક્રીષ્ટ

(૨૪૮) શિક્ષણના શિલાદેખ : મનિષ રાજ્યગુરુ, ૨૦૧૩, કુમકુમ પ્રકાશન, અમદાવાદ, પૃ. ૨૦+૧૧૬, રૂ. ૧૨૫/- (૨૫૦) જ્યંતી એમ દલાલની જિંદગીનો દસ્તાવેજ : મોહનભાઈ પટેલ, નરેન્દ્ર પટેલ, ૨૦૧૩, જ્યંતી એમ. દલાલ અમૃત મહોત્સવ સમિતિ, મુંબઈ, પૃ. ૨૮૮, રૂ. ૨૦૦/-

પત્રસેતુ

પ્રિય મિત્ર યોગેશભાઈ,

‘પરબ’ના સાફ્ટેમબર, ૨૦૧૩ના અંકમાં એમિલી ડિક્નિસનના Because I could not step for death કાવ્યના પ્રદીપ ખાંડવાળાના અનુવાદથી ઘણી નિરાશા અનુવાદી. એમની એક વાત સાવ સાચી કે વિવેચક એવન ટેના મત પ્રમાણે આ અંગેજ સાહિત્યનું એક મહાન કાવ્ય છે. પણ એના અનુવાદમાં કે કાવ્યની નોંધમાં આ ઉત્તમ કાવ્ય છે એની થોડીઘણી પણ પ્રતીતિ થાય છે જરી ? એમિલીના કાવ્યના લાઘવ, ઊડાણ અને ભર્મને અનુવાદમાં ચૂકી જવાયાં છે. ક્યાંક તો સ્થ્યલ શાંદ્રિક અનુવાદ છે તો ક્યાંક મૂળના અંગેજને ગુજરાતીમાં અવતારવામાં ગંભીર ક્ષતિઓ થઈ છે. થોડાંક દષ્ટાંતો આપું.

મરણકાળે કાવ્યની નાયિકાના શબ્દો And I put away / My labor and my leisure tooનો અનુવાદ આ પ્રમાણે થયો છે : ‘મેં બાજુ પર મૂકી દીધું હતું / મારું કામ અને મારી નવરાશ.’ અરે રે, labor અને leisureનો આવો શાંદ્રિક અનુવાદ ? અહીં labor એટલે ‘કામ’ અને ‘leisure’ એટલે ‘નવરાશ’ આ અનુવાદ દેશાપાંડેએ કર્યો હોય એવું લાગે છે ! એમિલી જેવી સમર્થ કવયિત્રીને આમાં કેટકેટલું અભિપ્રેત છે ! આ બે શબ્દો દ્વારા એમિલીએ સમગ્ર જીવનનો સાર આપી દીધો છે : labor એટલે જીવનમાં આધિવ્યાધિરૂપાદિ અને leisure એટલે સુખસમૃદ્ધિ. અનુવાદમાં આવી સ્વતંત્રતા શક્ય નથી. ઈષ પણ નથી. ઇતાં laborના અનુવાદમાં negative connotation હોવું જોઈએ અને leisureમાં positive. હું labor એટલે ‘મજૂરી’ અને leisure એટલે ‘સુખચેન’ સૂચયવું.

ત્રીજી કરીમાં એમિલીએ passed શબ્દ ત્રણ વાર પુનરાવર્તિત કર્યો છે : we passed the school / we passed the fields of Gazing grain/we passed the setting sun - એમિલી જેવી કવયિત્રીને શબ્દની ખોટ તો ન જ પડે ને. તો એકના એક શબ્દને ત્રણ ત્રણ વાર દીહરાવવા પાછળ કરી કાવ્યનું પ્રયોજન હશે ને ? કવયિત્રીને અહીં કાળની ગતિને મૂર્ત કરવાનું પ્રયોજન લાગે છે. રિસેસમાં રમતાં બાળકો, ધાનનાં જેતરો અને અસ્તણામી સૂર્યથી બાળપણ, પુખ્તાવરસ્થા અને મરણને કવયિત્રી સૂચયે છે. આ passed શબ્દને અનુવાદમાં પુનરાવર્તિત ન કરવામાં અનુવાદકે સમૃદ્ધ બંજના ગુમાવી છે.

ચોથી કરીમાં Tippetનો અનુવાદ કેપ ખોટો છે, સિવાય કે મુદ્રણદોષ હોય. અનુવાદકને વિવૃત્ત કે નહીં પણ સંવૃત્ત કે ઈષ હોય. જોકે તોપણ એક અંગેજ Tippet

શબ્દનો બીજા અંગ્રેજ ક્રેપ'થી અનુવાદ કરવામાં શું સ્વારસ્ય છે તે ન સમજી શકાય તેવું છે. અને 'ક્રેપ' શબ્દ ગુજરાતીમાં રૂઢ નથી થયો – જેમ એપ્રિલ-૨૦૧૭ના 'પરબામાં પ્રદીપ ખાંડવાળાએ Stopping by the Woods on a Snowy Eveningના અનુવાદમાં And miles to Goનો અનુવાદ "માઈલોના માઈલો" કર્યો છે ત્યાં 'માઈલ' શબ્દ ગુજરાતીમાં રૂઢ થઈ ગયો છે તેથી સ્વીકારી શકાય; જોકે 'જોજન' જેવો શુદ્ધ ગુજરાતી (એટલે કે મૂળ સંસ્કૃત યોજનનો તફાવ) ઉપલબ્ધ હોય ત્યારે 'માઈલ' વાપરવાની અનુવાદકને ફરજ નથી પડતી.

પાંચમી કરીમાં A Swelling of the Groundનો 'સૂજેલી જમીન' અનુવાદ અસહ્ય છે. જમીન કેવી રીતે સૂજી જાય? કબર ઉપર તાજી જ મારી વાળી હોય તે થોડો વખત 'ઓપ્સેલી' રહે, સમથળ ન હોય તે Swellingથી અભિપ્રેત છે.

છેલ્લી કરીમાં અનેક મુશ્કેલીઓ છે.

તે પછી – હવે તો સૈકા વીતી ગયા – તે છતાં

આ ગાળો એ દિનથી ટૂંકો વાગે છે

જ્યારે મને પ્રથમ વાર પ્રતીતિ થઈ કે

અંશોનાં માથાં શાશ્વતી તરફ વળેલાં હતાં.

અહીં બીજું પંક્તિમાં દર્શક સર્વનામ 'એ'ની જરૂર નથી; એ નાહક બમ ઊભો કરે છે. સદીઓ વીતી ગઈ છતાં જાણે એક જ દિવસ પસાર થયો હોય એવું વાગે છે. સદીઓ જેવો લાંબો વખત 'એ' દિવસ જેટલો ટૂંકો છે એવો અર્થ અભિપ્રેત નથી. અને ફિરંગી 'દિન' શા માટે? 'દિવસ' કેમ નહીં? I first surmisedનો અનુવાદ 'જ્યારે મને પ્રથમ વાર પ્રતીતિ થઈ કે' સાવ ખોટો છે. surmised એટલે અનુમાન, પ્રતીતિ નહીં. પછીની પંક્તિમાં અનુમાન શાશ્વતીનું છે. શાશ્વતીની પ્રતીતિ કેવી રીતે થઈ શકે? તેથી કવયિત્રી શાશ્વતીનું માત્ર અનુમાન જ કરે છે.

કાવ્યનો અનુવાદ દુષ્કર છે, અત્યંત દુષ્કર છે, છતાં મૂળનો ભાવ મહંદ્રો તો ઊતરવો જોઈએ. કાવ્યના અનુવાદમાં જે શક્ય ન બને તેની પુરવણી 'નોંધ' કરી શકે. પણ નોંધમાં પણ ગુંઘવળો છે તેની નોંધ નથી કરતો. પ્રદીપભાઈને નોંધમાં 'કર લે સિંગાર ચતુર અલગેલી/સાજન કે ઘર જાના હોગા' એ નોંધવાનું વાદ ન આવ્યું?

યોગેશભાઈ, એક સૂચન કરું? અનુવાદ સાથે મૂળ કાવ્ય પણ પ્રકટ કરો તો?

મધુસૂદનનાં સ્નેહસમરણ
(સિનસિનાટી, ઓહાયો, યુ.એસ.એ.)

૧૩ Nov. ૨૦૧૩

આ અંકના લેખકો

અમિત્જિત બાસ : ગુલાબકુજ, રજાજિત મેમોરિયલ પાછળ, જામનગર-૩૬૧૦૦૧

એસ. એસ. રાડી : Eezee Society, Plot No. 13, Behind Pupee Bank, Opp. Parmar Pavan, Kondhwa (Khurd), Pune-41048

કિશોર બાસ : ૬/બી, મહેતા સોસાયટી, હાઈસ્કૂલ પાછળ, કાલોલ, જિ. પંચમહાલ દક્ષા વિ. પણ્ણી : ‘તીરથ’, ૨૧૮૭/સી. શાંતિસદન, વડોદરિયા પાર્ક, હિલડ્રાઇવ રોડ, ભાવનગર-૩૬૪૦૦૨

ધીરુ પરીખ : લાવજ્ય, વિજયપાર્ક, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૮

પીયુષ ઠક્કર : બળવંત પારેખ સેન્ટર, સી/૩૦૨, સિદ્ધિ વિનાયક કોમ્પ્લેક્સ, રેલવે સ્ટેશન પાછળ, વડોદરા-૧

પ્રદીપ ખાંડવાળા : બી-૧૧૦, જ્યુપિટર ટાવર્સ, અતિથિ રેસ્ટોરન્ટ લેન, બોડકટેવ, અમદાવાદ-૩૮૦૦૪૪

પ્રહૃત્યલ રાવલ : ૩, રાજમહેલ ફ્લોટ, આઈ.ઓ.સી. કોલોની રોડ, વીરમગામ-૩૮૨૧૫૦

બિપિન આશર : પ્રોફેસર, ગુજરાતી ભાષાસાહિત્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ-૩૬૦૦૦૪

ભગવતીકુમાર શર્મા : બી/૩૨, પવિત્ર રોહાઉસ, ગેટ નં. ૨, આનંદમહલ રોડ, સુરત-૩૮૫૦૦૮

મહુસુદન કાપદ્યા : 7880, Stonegate drive Apt. 1209 Cincinnati, OH 45255 U.S.A.

રજનીકુમાર પંડ્યા : વી/૮, રાજકીય પાર્ક, મીરા ચારરસ્તા, બિણાકાકા માર્ગ, અમદાવાદ-૨૮

રમેશ પટેલ : ‘પ્રાંજલ’, ૩૦, આનંદવાટિકા સોસાયટી, સરદારપુર પાસે, અડાજણ રોડ, સુરત-૩૮૫૦૦૮

ડૉ. રેણુકા શ્રીરામ સોની : સુતરિયા હાઉસ, ગ્રીજે માળ, ભાઈકાકા હોલ પાસે, અમદાવાદ-૩૮૦૦૦૬

લખિત ત્રિવેદી : ‘શિવકૃપા’, ૧, વૈશાલીનગર, રૈયા રોડ, રાજકોટ-૩૬૦૦૦૭

લાભશેંકર ઠાકર : સી/૧૮, જલદર્શન ફ્લોટ, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૮

વિનોદ ગાંધી : ૮૩, સુવિધાનગર, ભુરાવાવ, ગોધારા-૩૮૮૦૦૧

ડૉ. વિરંગિ ત્રિવેદી : ૩/૩૩ તિયનગર, સુભાષપાર્ક પાસે, હરણી રોડ વડોદરા-૩૮૦૦૦૬

શંભુપ્રસાદ જોશી : સી/૮૦૧, ગાલા ગાડીનિયા, સફ્ફલ પરિસર પાસે, સાઉથ બોપલ, અમદાવાદ-૩૮૦૦૪૮

સંઘૃતિરાશી કેસાઈ : ૨/સી, નાનિક નિવાસ, વોર્કન રોડ, મુંબઈ-૪૦૦૦૨૬

સુરેશ ઓઝા : ૧, સાઈનાથ એપાર્ટમેન્ટ, ૮૮, આંગાદ સોસાયટી, આંબાવાડી, અમદાવાદ-૧૫

હરીશ મીનાશુ : ૮/અ૨, ‘સુમિરન’, ઔરમ્ય બંગલા, વિનુકાકા માર્ગ, બાકરોલ-૩૮૮૩૧૫, જિ. આંગાંદ

જે નવલક્ષ્ય પરથી નાટકની રેચના થઈ અને ગુજરાતી પ્રેક્ષકોએ ખૂબ બિરદાવી તે નવલક્ષ્ય.

અકૃપાર

લે. ધૂવ ભણ

કિંમત : ૨૦૦ રૂપિયા

જે નાટક ગુજરાતના તખ્તા પર આગવી ભાત ઉપસાવીને અદ્ભુત લોકચાહના પામી ચૂક્યું છે તે નાટક

કસ્તૂરબા

લે. નારાયણ દેસાઈ

કિંમત : ૬૫ રૂપિયા

પારિવારિક, સામાજિક અને વ્યાવસાયિક સંબંધોને રથિયામણા બનાવવાની પ્રેરણા આપતાં પુસ્તકો

માય ડિયર સન (પુત્રને પત્રો)

ડૉ. રેણુકા પટેલ

165

સાસુવહુ ડૉટ કોમ

નીલમ દોશી

200

દીકરી મારી દોસ્ત

નીલમ દોશી

170

પરિવારની પારાયણ

રાજ્પરમેશ્વર

120

માબાપ બનતાં શીખીએ

ઉર્મિલા શાહ

140

મા-બાપ સાથે ગોળી

ઉર્મિલા શાહ

125

બાળકને ઉછેરતાં શીખીએ

ઉર્મિલા શાહ

150

સંતાનને પણ કંઈક કહેવા દો

ઉર્મિલા શાહ

150

સંતાનનું ઘડતર - એક સાધના

ઉર્મિલા શાહ

110

વહાલી મમ્મી

રોહિત શાહ

30

વહાલા પણ્ણા

રોહિત શાહ

30

વહાલો ટીકરો

રોહિત શાહ

30

વહાલી ટીકરી

રોહિત શાહ

30

વહાલો દોસ્ત


રોહિત શાહ

30

વહાલા જીવનસાથી

રોહિત શાહ

30



ગુજરાત ગંધરવના કાર્યાલય

ગુજરાત સાહિત્યભવન

રાતનપોળનાકા સામે, ગંધીમાર્ગ, અમદાવાદ-380001

■ ફોન : 22144663, 22149660 ફેક્સ : 22144663

■ ઈ-મેઈલ : goorjar@yahoo.com

સંસ્કાર સાહિત્યમંડિર

પ, N.B.C.C. હાઉસ,
સહજાનાંદ કોલેજની બાજુમાં,
અંબાવાડી, અમદાવાદ-૧૫
ફોન : ૨૬૩૦૪૨૫૮

ગુજરાત સાહિત્ય પ્રકાશન
૧૩, શિવરંજની સોસા., ઓવરાબિજના છેડે,
અશ્વમેધ બંગલોજના બસસ્ટેન્ડ પાસે,
સેટેલાઈટ, અમદાવાદ-૧૫
ફોન : ૨૬૭૬૧૭૬૬ મો. ૮૮૨૫૨૬૮૭૫૮



- ૧ પહેલી નજરે જ આંખમાં વસી જાય એવો નૂતન અવતાર...
- ૨ ગ્રંથવિહારની મુલાકાત એક યાદગાર અનુભવ...
- ૩ સુંદર સંગ્રહ, આત્મીય વાતાવરણ.

ગુજરાતી સાહિત્ય પરિષદનું
પુસ્તકવેચાણ કેન્દ્ર

ગ્રંથવિહાર

: સંપર્કસૂત્ર :

ગુજરાતી સાહિત્ય પરિષદ

ગોવર્ધનભવન સ્મૃતિ મંદિર, યાઈમ્સ પાછળ, નદી કિનારે,
ગુજરાતી સાહિત્ય પરિષદ માર્ગ, આશ્રમરોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૯
ફોન : (૦૭૯) ૨૬૪૭૬૩૭૧, ૨૬૪૮૭૮૪૭, ૨૬૪૮૭૮૪૮
કિશોર ગૌડ (મો.) ૮૪૨૭૩૨૦૮૩

પુસ્તક : અનેક પાસાને સમજવાની ચાવીઓ

જેમ સત્કર્મથી તેમ સદ્ગ્વાચન ને સદ્ગ્વિચારથી ચિત્તવિકાસ થાય છે એમ મને અનુભવે લાગ્યું છે. અધ્યયન-અધ્યાપન નિમિત્તે સંશોધન-સંપાદન-અનુવાદ નિમિત્તે મારાથી જે કંઈ વંચાયું તેને હું “સ્વાધ્યાયતપ” સમજું છું. જે વિષયનું આપણે વાંચીએ તે વિષયનું જ્ઞાન તો આપણનું વધે જ, સાથે એ વિષય સાથે સંલગ્ન જીવનનાં અનેક પાસાને સમજવાની ચાવીઓ પણ આપણાને મળતી હોય છે.

જ્યારે કોઈ પુસ્તક હું વાંચ્યું છું ત્યારે એ પુસ્તકના લેખક સાથે, એના મનોવિચ્છ સાથે, એના જીવન-સંદર્ભ સાથે હું સીધા સંબંધમાં મુકાઉં છું. તેથી કોઈ પણ સારા પુસ્તકનું વાચન મારે મન સત્તસંગ-રૂપ બની રહે છે. સેમ્યુઅલ બેકેટનું “વેઈટિંગ ફોર ગોદો” વાંચતાં જુદા જ દેશકાળમાં થઈ ગયેલી અને કોઈ અલગ વિચારધારાને સંવેદના સાથે કામ પાડતી એક સર્જક પ્રતિભાનો, પરોક્ષ રહેલા મને જે રીતે સાક્ષાત્કાર થાય છે, તેને હું વાચનના ચમત્કાર રૂપે જોઉં છું. જાતભાતના સદ્ગ્વાચને મારા વ્યક્તિત્વનો – મારા સંવિતનો સીમાવિસ્તાર સધાય છે, મારો ચેતોવિસ્તાર થતો વરતાય છે.

[‘ઉદ્દેશ્ય’]

ચંદ્રકાન્ત શેઠ

: સ્થાનસમર્પિત :

નિમેષભાઈ ડગલી

અમ. બી. ટ્રેડિશનલ પ્રિન્ટસ પ્રા. લિમિટેડ

અ/ઓ, અલકાપુરી સોસાયટી, ઉસ્માનપુરા ચાર રસ્તા પાસે,
આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૧૩. ફોન : ૩૨૭૦૬૬૫૫

કવિ શ્રી સુન્દરમૂના નવા કાવ્યસંગ્રહો

| | | | |
|---------------------------------|------|--------|---------|
| ૧. પલ્લવિતા | ૧૮૮૫ | ૮૩૪૬ | રૂ. ૧૬૦ |
| ૨. મહાનંદ | ૧૮૮૫ | ૭૧૯૮૩ | રૂ. ૮૦ |
| ૩. પ્રભુ-પદ | ૧૮૮૭ | ૧૩૪૪૧ | રૂ. ૨૨૫ |
| ૪. અગમ નિગમા | ૧૮૮૭ | ૧૧૨૮૨ | રૂ. ૧૫૦ |
| ૫. પ્રિયાંકા | ૧૮૮૭ | ૧૧૩૬૭ | રૂ. ૧૫૦ |
| ૬. નિત્યશ્વોક | ૧૮૮૭ | ૧૨૧૮૮ | રૂ. ૧૦૦ |
| ૭. નયા પૈસા | ૧૮૮૮ | ૧૩૩૩ | રૂ. ૧૭૫ |
| ૮. વરદા | ૧૮૮૮ | ૧૮૫૨૮ | રૂ. ૨૫૦ |
| ૯. ચક્કદૂત | ૧૮૮૮ | ૮૨૪૫૮ | રૂ. ૧૨૫ |
| ૧૦. લોકલીલા | ૨૦૦૦ | ૧૩૨૪૨ | રૂ. ૧૦૦ |
| ૧૧. દક્ષિણા-૧ | ૨૦૦૨ | ૧૭૩૨૩ | રૂ. ૫૦ |
| ૧૨. મનની મર્મર | ૨૦૦૩ | ૧૦૪૩૮૭ | રૂ. ૫૦ |
| ૧૩. ધ્રુવયાત્રા | ૨૦૦૩ | ૧૨૩૪૫ | રૂ. ૫૦ |
| ૧૪. ધ્રુવચિત્ત | ૨૦૦૪ | ૧૭૨૭૪ | રૂ. ૫૦ |
| ૧૫. ધ્રુવપદે | ૨૦૦૪ | ૧૧૨૪૩ | રૂ. ૫૦ |
| ૧૬. શ્રીમાતાજીના સાન્નિધ્યમાં-૧ | ૨૦૦૪ | ૧૬૩૨૦ | રૂ. ૨૦૦ |
| ૧૭. શ્રીમાતાજીના સાન્નિધ્યમાં-૨ | ૨૦૦૪ | ૧૬૩૭૦ | રૂ. ૨૦૦ |
| ૧૮. શ્રીમાતાજીના સાન્નિધ્યમાં-૩ | ૨૦૦૬ | ૩૨૩૧૭ | રૂ. ૨૫૦ |
| ૧૯. મંગળા-માંગલિકા | ૨૦૦૭ | ૨૮૨૩૮ | રૂ. ૧૫૦ |
| ૨૦. તું કયાં... હું કયાં !? | ૨૦૦૮ | ૨૮૩૦૪ | રૂ. ૨૫૦ |
| ૨૧. સ્વાગતમૂર્તિ ગીતવાહીને | ૨૦૦૮ | ૧૬૨૦૭ | રૂ. ૧૫૦ |
| ૨૨. 'સાવિત્રી'ના કાવ્યખંડો | ૧૮૮૫ | ૨૪૪૭૩ | રૂ. ૩૦૦ |

(અનુવાદ : શ્રી અરવિન્દના મહાકાવ્ય Savitriમાંથી, મૂળ અંગ્રેજ સાથે.)

| | | | |
|---------------|------|-------|--------|
| ૨૩. દક્ષિણા-૨ | ૨૦૦૨ | ૧૮૬૭૬ | રૂ. ૫૦ |
|---------------|------|-------|--------|

(અનુવાદ : શ્રી અરવિન્દના Last Poems, More Poems, Collected Poemsમાંથી, મૂળ અંગ્રેજ સાથે.)

આ તમામ સંગ્રહોનાં પ્રાપ્તિસ્થાન :

૧. ગ્રંથાગાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, ટાઈમ્સ ઓફ્સ ઇન્ડિયા પાઇલ, આશ્રમમાર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૮
૨. ગૂર્જર ગ્રથરટન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧

પુસ્તકો અને મધુમક્ષિકા

પુસ્તકો આપણા વજાદાર સંભિતો હોવાની સૂક્તિનું વજૂદ મને પ્રતીત થયું છે. વાચને મારા મનોમય કોશના, મારા વિજ્ઞાનમય અને આનંદમય કોશના સમૃદ્ધિવિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. મારાથી આજ દિન સુધી જે કંઈ વંચાયું છે તેનાથી અનેકગણું વાંચવાનું બાકી છે. જિંદગીભર વાંચતાંએ ન ખૂટે એવો વાચનનો અક્ષય બાળનો છે. એ બધા વાચનો પાર પામવામાં તો ૮૪ લાખ અવતાર પણ કદાચ ઓછા પડે !

આ પુસ્તકો કંઈ કાગળ-કલમની વસ નથી. માનવજીવનના ગહન અને વ્યાપક દર્શન-મનન-ચિંતન ને સર્જનનાં એ રસાતમક સ્વાદિષ્ટ ફળો છે. જેઓ જીવી ગયા છે ને જેઓ જીવી રહ્યા છે એવા લેખકો-સર્જકોની સંવિતિના એ અક્ષરાદેખો કે નકશાઓ છે. એ સર્વનો મર્મરસ મધુમક્ષિકાની રીતે ગ્રહણ કરતાં કરતાં જ આપણી ભીતર એક સરસ મધુપુટ રચાતો હોય છે.

[‘ઉદ્દેશ’]

ચંદ્રકાન્ત શેઠ

સ્થાનસમર્પિત

વસન્ત આત્મા ચેરિટેબલ ટ્રસ્ટ

ગુજરાત સ્ટીલ ડિસ્ટ્રિબ્યુટર

અમદાવાદ

લટૂર પ્રકાશન

‘અવનિલોક’, ત શાંતિનગર સોસાયટી, ૨૨૭૩ હિલ ક્રાઈફ, ભાવનગર-૨

નાનાથી નાની અને મોટાથી મોટી વ્યક્તિ-વિભૂતિઓનાં પ્રેરણાદાયી
રેખાચિત્રો - પ્રસંગો - મુલાકાતો - આવેખો :

૧. અક્ષરોમાં આલખમ - નટવર આહલપરા - ડિ. રૂ. ૩૨૫/-
૨. શતાબ્દીના શિલ્પી - મહેન્દ્ર ગોહિલ - ડિ. રૂ. ૧૫૦/-
૩. આત્મ હે યાદ મુલાકો - ડૉ. હસમુખ નાગેચા - ડિ. રૂ. ૨૫૦/-

નામી લેખકોના નીવડેલા વાર્તાસંગ્રહો :

૧. નાતો - મનોહર ત્રિવેદી - ડિ. રૂ. ૧૨૦/-
(ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક)
૨. સામા કાંઠાની વસ્તી - નવનીત જાની - ડિ. રૂ. ૧૫૦/-
(ગુજરાત સાહિત્ય અકાદમીનું દ્વિતીય પારિતોષિક)
૩. અત્તરગલી - ગિરીશ ભંડ - ડિ. રૂ. ૧૫૦/-
૪. સાતમો કોઠો (પુનર્મુદ્રણ) - ઈજાતકુમાર ત્રિવેદી - ડિ. રૂ. ૧૨૫/-
૫. ક્રીમેટોરિયમ - અજ્ય ઓળા - ડિ. રૂ. ૧૫૦/-
૬. ગજવામાં ગ્રામ - મનોહર ત્રિવેદી - ડિ. રૂ. ૧૫૦/-
૭. સુરગંધ - ગિરીશ ભંડ - ડિ. રૂ. ૧૫૦/-
૮. નિરુત્તર - બદ્ધુલ દવે - ડિ. રૂ. ૧૫૦/-
૯. થુંબરી - સંજ્ય ચૌહાણ - ડિ. રૂ. ૧૫૦/-

અને, આ પણ મળશે :

૧. વિજ્યરાય વૈદ્યની સ્મરણયાત્રા - સં. બંકિમ વૈદ્ય, ડૉ. રમેશ શુક્લ - ડિ. રૂ. ૨૫૦/-
૨. પ્રવાસનિબંધકાર ભોળાભાઈ પટેલ - મૈત્રેયી ખાડહિયા - ડિ. રૂ. ૧૫૦/-
૩. માય ડિયર જ્યુના (પુનર્મુદ્રિત) વાર્તાસંગ્રહો : ‘જીવ’, ‘સંજીવની’, ‘અને વાણા લઈ જાવ’. - ત્રાણોની ડિ. રૂ. ૫૦૦/-
૪. માય ડિયર જ્યુની પ્રશયન્તિપુરી : મરણાટીપ - કર્મળપૂજા - ઝુરાપાકંડ સાથે પઠનની ૬ કલાલની ઓડિયો સીડી ડિ. રૂ. ૪૫૦/-
તમારા બુકસેલર પાસેથી મળશે. સીધો સંપર્ક કરો : વિશેષ વળતરથી વેર બેઠાં પહોંચાડીશું.

માય ડિયર જ્યુ : ૮૮૮૮૮૬૬૬૨૬ - ૮૪૨૬૧૬૦૨૦૮

અવનીન્દ્ર : ૮૭૭૭૧૧૫૬૪૬ - ૮૬૨૪૬૮૫૬૪૬